

१००२५ बि (संस्कृत) लेख  
कृष्ण गीता उपायोगिता ।  
द्वारा डॉ प्रसादसुन्दरज्ञानी

# श्री स ऐश्वर्य गुरु यरित स मनु वाद

२-८६५६  
१-८६५६  
०



॥ श्री स ऐश्वर्य दत्तनाम लक्षण ॥

श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर  
श्री महावीर जैन आराधना केन्द्र  
गांधीनगर पि ३८००९

१०१ अप्रृष्ट

## સ્તોત્ર

પૂર્વ એક અદ્વિતીય અળ તુંજ શ્રીહરે, થાઉ નૈકે ઈચ્છી એમ સંજ્ઞું વિશ્વ અંડ હે !  
 ગુજરાતમણે ગુણે રમાડી સંત, દુષ્ટને દ્રમે; વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૧  
 કર્મત્યકાલોક ભ્રષ્ટ રતિયમાં વિદોક્ષી તું, તીર્ણ સ્રદ્ધાવત થઈ સ્વભક્તાધ્વાંત સંહયું !  
 લગ્નપ્રાય ધર્મસેતુ રથાપી સ્થિર તું રમે, વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૨  
 સર્વનંદદ્વય શુદ્ધ સત્ત્વમૂર્તિ તું વિભોા, ભીતિપ્રસ્ત લોક નરતને સ્વત્તાત્રવત ગમ્યો !  
 ઉર્ધ્વ આશ્રમ ર્વીકારી તાં હીનદીનતે; વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૩  
 આપે મુક્તને તું વાઙ, દિષ્ટ અધને અહો ! પુત્ર વાય સ્ત્રી લબે, નવીન પ્રાણ પ્રૈત હો !  
 ત્વપ્રભાવ કો લહે ? તું કાણનેય પત્ર હે ! વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૪  
 મુક્તાયાશરો તું, કદ્યપ્રે મેદ્ધા ધર્મનારાને; સકામને તું કામધુરે, તું હૈન્યદાવમેધ હે !  
 દુષ્કૃતાભિન વેદ સર્વ ભાઈ તાંદો અરે, વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૫  
 યોગિધ્યેય તીર્થતીર્થ સંતળું પ્રલો, પકામિદૈવત શ્રીકેદિસ્થાન નિર્મલ ઈંગ લો !  
 વિદ્વાશ્રય સ્વભક્તાતાતગેહ ત્રીશ હે ! વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૬  
 વેદ મુક ! કોણ રાકા ઝૃસનશઃ લહે તને ? વિશ્વદ્વય લદ્ધિનાવ નાન્ય, અષ્ટમુર્તિ હે !  
 ઉં સ્વરષ્ય તું અર્થ મૂર્ત્યમૂર્તિભિન રે, વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૭  
 દંડાત્રહસ્ત ભરત શાન્ત સ્વાભિદ્વય આ લીમાડમરણસંગમસ્થ ધ્યેય ચિત્તમાં સદા !  
 થાપ સ્થિર એજ ધીર માગું શાન તાર હે, વંદું હે નૃસિંહસરસ્વતીશ તૃત્યદાખજ એ !! ૮

( શ્રીગુરુલીલામૃત અધ્યાય-૬૬ )

श्री स ष्ठ श ती गु रु य रि त स भ नु वा ह



३६ अवधृत

# નિવેદન

( પ્રથમ આવૃત્તિનું )

૫. પૂ. સહયુર વાસુદેવાનંદસરસ્વતી સ્વામીમહારાજશ્રીએ સંસ્કૃતમાં તેમજ મરાડીમાં દાતાનેય ભગવાનની લીલાઓ ગણું પ્રચુર સાહિત્ય પીરસ્યું છે. પૂ. શ્રી. ના. શખદોમાં કંઈએ તો આધુ શાંકરાચાર્ય પણી કેદીએ વૈવિધ્યપૂર્ણ વરદ આધ્યાત્મિક સાહિત્ય પીરસ્યું હોય તો તે પૂ. સ્વામી મહારાજશ્રીએ, એમના અધ્યા જ અંથો એક વા બીજેરૂપે ગુરુચરિત્રને જ ગાય છે. ધર્માચાર એમ પણ લાગે છે કે, એ સિવાય બીજે વિપ્લવ જ નથી શું? પરંતુ એ અધ્યા જ અંથો સ્વયં દાતાનેય ભગવાનની આસ્તાથી અને પ્રેરણાથી જ તેમણે જે રીતે લખાયા તેમ લખાયા હોવાથી આપણી મતિ એમાં ચાલે એમ નથી. છતાં એક વાત ચોક્કપી દેખાય છે કે, ગુરુચરિત્રને એમણે વિવિધ રીતે, છંદની, સાહિત્યની, વરદ ઉપાસનાની અને ગૂઢ રહસ્યોદ્ઘાટનની અનેકવિધ દૃષ્ટિએ જૂદા જૂદા અંથોમાં અથિત કર્યું છે.

એવા આર્પ અંથો પૈકી એક અંથ તે સપ્તશતીગુરુચરિત; આ અંથ મૂળ મરાડી અંથ ગુરુચરિત્રને દુંકમાં ૭૦૦ મરાડી એવીમાં સ્વામી મહારાજે અથિત કર્યો હતો. પૂ. શ્રી. ને જ્યારે શ્રીગુરુલીલામૃત અંથ રચવાની આજા મળી ત્યારે શ્રીગુરુલીલામૃતમાં જ કહ્યું છે; ‘મૂળો વેદ વહે ક્ષણે, કહે ગુરુ જે ઐલ’ એ પ્રમાણે એ અંથ રચાઈ જવાનો તો હતો જ, પણ એ અંથ લખતાં પહેલાં લક્ષ્મિપૂર્વક, ભરસ્વતીની ઉપાસના, ગુરુની કૃપાયાચના અને હદ્ય અને બુદ્ધિમાં રહેલી અશુદ્ધિએના નિવારાણ્યાર્થી કંઈક ઉપાસના કરવી એવો સત્સંકલ્પ થતાં સ્વામી મહારાજશ્રીના ઉપર્યુક્ત મરાડી અંથનો સમનુવાદ કરવાની પ્રેરણા થઈ. અને

“એક લક્ષ્મિથી ગૈરિત। લેખને થયો ઉદ્ઘૂકાન। કેવળ હંદ્યુદ્ધ માટ। ભાટ હું તો શ્રીગુરુનો ||” એમ આ અંથના ઉપોદ્ઘાતમાં સ્વયં પૂ. શ્રી.એ લખ્યા પ્રમાણે આ અંથ રચયે. શ્રીગુરુલીલામૃત અંથની પાંચમી આવૃત્તિ નીકળવાની તૈયારી છે ત્યારે તે વરદ અંથ લખાતાં પૂ. શ્રી એ કેવી વાકુમયી તપથર્યા કરી છે તેનો આ અંથના વાચનથી ખ્યાલ આવશે તો પણ આ પ્રકાશનની સાર્થકતાનો સંતોષ થશે. આકી આ અંથના પારાયણની પણ ઓપાસનિક દૃષ્ટિએ અગત્ય છે જ છે.

“ धीमता डोरे मूळी क्षाणु । जे डो करशे नित्य पठन । हेखशे ए परयो जाण । अत्य हिन न लागतां ॥ ” सुर्जेषु  
किं बहुना ? वाचको जते जे ए अनुबव करी ले अटलुं ज खस छे.

आ पुस्तकना प्रकाशनतुं श्रेय, भाद्रशुनिवासी ग. स्व. श्री धीरजरामहेन पटेलनी, तेमना स्वर्गरथ पति श्री हिनकर-  
भाईना पुष्यसभरणार्थे समर्पित निष्काम सेवाभक्तिने आभारी छे. परम इपाणु परमात्मा सहगतने चिर शान्ति अर्पो ए  
प्रार्थना साथे विरमु छुं

वि सं २०२७, पोष सुद २  
श्री नरसिंहसरस्वती ५८-८९४५८५

प्रकाशक

( द्वितीय आवृत्तिनुं )

श्रीगुरुलीलाभूतनी पांचगी आवृत्तिना प्रकाशननी साथे साथे ज आनी प्रथम आवृत्ति काढवानो योग उपस्थित थयो  
होतो ते ज रीते ऐनी बीज आवृत्ति पण श्री गुरुलीलाभूतनी छटी आवृत्तिना प्रकाशन सभये नीडणी रहे छे ए एक  
दैवी सुयोगा ज गण्डाय. आवृत्तिना प्रकाशनमां प्रभुप्रीत्यर्थे रा. २५३० गाम कण्ठजरी (पंचमहाल)नां स्व. जगत्तुरनदास  
जयशंकर उपाध्यायना पुष्यार्थे तथा २५३१ गाम कण्ठजरी (पंचमहाल)नां स्व. रेवाभेन गणपतरामना पुष्यार्थे तेमना  
कुटुंभीजनो तरफथी पुण्यांजलि इपे तथा १५४० गाम राजभीपणानां स्व. २८३० गुरुजीरी प्र. शुक्लना पुष्यार्थे शुक्ल अभोदयंद  
गणपतिशंकर तरफथी पुण्यांजलि इपे अने रा. ३१० श्री कान्तिलाल जेवा (जिटेवा-हाव अमदावाद) तरफथी अमना स्व  
पिता छोटालालभाई तथा भातुश्री पार्वतीभेनना पुष्यार्थे जे निष्काम द्रव्यसहाय भणा छे तेनी सालार नेवं लई प्रभुयरणु  
निवेदित करी विरभाए थाए.

प्रकाशक

प्रकाशक :

अभूतलाल नाथाभाई भेदी  
ग्रमुख, श्रीअवधूत साहित्य प्रकाशन ट्रस्ट,  
नारेथर.

द्वितीय आवृत्ति

प्रत : २०००  
सन १८७६  
मूल्य रा. १-५०

मुद्रक :

श्री शंकर (ग्रनिंग प्रेस,  
श्री बापेश्वर महादेव प.से,  
करमसद. वाया-आणुंद.

## ॥ श्रीपादश्रीवल्लभस्तोत्रम् ॥

आक्षयै ये मंशु भिक्षान्तोल्लभीतस्तस्या यः कृपार्द्धः सुतोऽभूतः ।  
विस्मृत्यास्मान् किं स गाढं निद्रौ श्रीपादद्वौ वापदाङ्गनिद्रौ ॥१॥

आर्वास्याम्यां प्रवल्लन्त्रजन्मः कृत्वा स्वं गान संच्यारार्थमान्यः ।  
विस्मृत्यास्मान् किं स गाढं निद्रौ श्रीपादद्वौ वापदाङ्गनिद्रौ ॥२॥

सार्वां भर्तुं योद्धाता खीस्तु तस्या हुःअं हर्तुं तं स्वयं तस्तुतःस्याः ।  
विस्मृत्यास्मान् किं स गाढं निद्रौ श्रीपादद्वौ वापदाङ्गनिद्रौ ॥३॥

राज्यं येऽदादाशु निर्णेष्वकाय अतीता नत्या यः स्वयुत्तै नकायः ।  
विस्मृत्यास्मान् किं स गाढं निद्रौ श्रीपादद्वौ वापदाङ्गनिद्रौ ॥ ॥

प्रेतं विप्रं श्वभित्वाऽस्तज्जूर्ति यथेऽहिक्षालिनीं स्वीकृतिंभ् ।  
विस्मृत्यास्मान् किं स गाढं निद्रौ श्रीपादद्वौ वापदाङ्गनिद्रौ ॥५॥

॥ धृति श्री. ५ ५. वासुदेवानं द्वसरस्वतीविरचितं  
श्रीपादश्रीवल्लभस्तोत्रं सम्पूर्णम् ॥

## ॥ दत्तमन्तर्गर्भश्रीपादस्तोत्रम् ॥

दत्तात्रेये द्यासिन्धुहिंद्यद्विष्ट भग्निः ।  
हुरिर्द्वारी हिरण्यालः श्रीपादः शरण् भम ॥ १ ॥

हुर्षुः कमलपत्राक्षः कर्पूरालः कलिकृतिः ।  
उन्मत्त उदुपाध्यक्ष उनिद उरसि स्थितः ॥ २ ॥

आर्तनान्दहायकश्चाप्त आर्तनाशसुटीकृतिः ।  
हिंगमध्यरो हिंगमेऽदाता द्रां-वीजतोषितः ॥ ३ ॥

भुनिर्भुमना भायी भन्नेशा भञ्ज्ञलप्रतुः ।  
भालेवा भालप्रियो भन्धुर्भलाङ्गुहुतिर्भविः ॥ ४ ॥

पिशाचः पांसुविस्तांगः पुण्याङ्गः पुमान् परः ।  
ज्ञानसागरस्त्रयत्तमा सराद ग्रनिजनप्रियः ॥ ५ ॥

द्वित्यारिंशतेतानि नामानि श्रीपदः प्रलेषः ।  
प्रतिवासे पठन्मत्यों रङ्गमुक्तो लवेदरम् ॥ ६ ॥

२०३ अवधूत

॥ श्रीगणेशाहतगुरुक्षेत्र नमः ॥

॥ अथात्मपूजा ॥

॥१॥

॥ अथ प्रभेष्वः ॥ अजिताभृत योगनिद्रिताच्युतशक्ते स्वदृतातिभैरहित ।  
घुमुषे श्रुतिभन्दिगीततो अगवज्ञलोगृहि जगृहि ग्यधीट् ॥१ ॥

॥ अथ ध्यानम् ॥ यतोऽस्य जननाधः स्ववशमाय आशो विक्षुः  
स्वराट् सकलविद्वगुरुः स सुअसविद्यात्मा प्रलुः ।  
अ संसृति २ ३ ५ उजिज्ञत मद्वोऽनुमै क्याप्तये  
निषेधविधिवाक्यतश्चिन्तये ॥ २ ॥

॥ अथावाङ्गनम् ॥ कार्यालयान्वीक्ष्य पृथग्युतान्वा योऽनुप्रविश्यापि विजुनिन्दाशात् ।  
निन्ये प्रलुत्वं हि महन्मुखांस्तमुपाहये त्रीशमनन्यथितः ॥ ३ ॥

॥ अथासनम् ॥ अनेकज्ञवीयो हुद्देऽप्यामुवन्नो  
सुराः पूर्वमाखृत्पराऽयोऽपि तिष्ठत् ।  
परान्धावतोऽत्येति यद्यासनं ते  
ग्यधीशाऽपिं चित्मस्तान्यवृत्ति ॥ ४ ॥

॥ अथ पादम् ॥ राहोः शीर्षवृहौपचारिकिदा विष्णोः पदं त्रीश ते  
प्रत्यक्षत्वाच्य निसगंशुद्धमपि सन्मायाशतोऽशुद्धवत् ।

॥२॥

ભાતં મૂઢધિયા તદથેમભલં શાનામૃતં યત્નતો  
ધ્યામતેઽન હિરણ્યમથે વિનિહિતં પાદં ગૃહાણાત્મજ ॥ ૫ ॥

11211

॥ અથાર્થભ ॥ હે વા ચા ર્યુ પ્ર સા હ પ્ર જ નિ ત સુ ર સં પત્તિ સ દ્વ લ જ ત-  
શ્રેષ્ઠયાઠ્યે મગ-જુલેડસ્મિમનનતિતરવિમલે ભાજને વૈ વિશાળે ।  
ચેતઃસંહેડવિદોધે ધૂતભજનજલાદ્વેષ્ટતાર્થભાજલે  
સ્વર્ધ્યો સમ્પાદિતં તે ગ્રધિપ પરમ લોઃ સ્વીકુર્ખ્યાસકામ ॥ ૬ ॥

॥ અધ્યાત્મનમ् ॥ બિદ્ધિવચ્છૂણુદિ યત્કૃતં તે ગ્રધિપાકાવ મે પ્રસીદ શરૂસો ।  
દ્વિવિધાવરણુભૂ તેડપિતં સત્કૃપયાડકાયમનં કુરુષ તેન ॥૭॥

॥ अथ सनानम् ॥ प्रवचनादिसुहर्लभता श्रुतेऽग्यधिपते त धू श्रुतिविश्रुते ।  
परमलक्षितमुशीतत्वसङ्गादं वपुषि सिक्तमथाऽल्लतयेऽस्त्वत्वम् ॥ ८ ॥

॥ અથ વસ્તુમુ ॥ યત્કિચિજુગતિ  
વસ્તુતેનાંપિતં      ત્રીશ      તત્ત્વયાડ્વાસ્યમીશ      તે ।  
                                તેન      પરાનન્દાહુતાસ્તુ      મે ॥ ૬ ॥

॥ अथ यज्ञसूत्रम् ॥ यह अद्वासूत्रं त्रिवृतं पवित्रं कृत्वा समन्त्रं त्रिप सत्पतन्त्रम् ।  
हत्तं सुभित्रं अज तेन चात्र सत्त्रं सुपात्रं कुरु माडन्यतन्त्रम् ॥१०॥

ੴ

॥ अथ चन्दनम् ॥ आहुलाइनं चन्दनमुच्यते तत्सत्यतँृपं न ततः परं ते ।  
ग्रेष्ठं >यधीशागुण तेन नूनमालेपनं ते प्रकरोभि भक्त्या ॥११॥

॥३॥

॥ अथ पुण्यम् ॥ भगवं॒स्यधिप प्रदद्याभि मुहे सुभनः सुभनः सकलार्थविहे ।  
अहु तु॒स्यमभूल्यभौधविहे सुभनः सुभनस्कमनन्यहृहे ॥१२॥

॥ अथ धूपः ॥ योगानवै॒डव बलदर्पपरित्रहाहुकारा-  
बिलाषममताप्रतिधां॒श्व दृष्टवा ।  
धूपेऽयमुत्तमतमेऽपित आर्य शान्ति-  
द्वारा >यधीश पदपर्यवसाय्यसौ ते ॥१३॥

॥ अथ दीपः ॥ सेऽहु आवओजवलज्ज्ञानवीपे । भूलाज्ञानध्वान्तसम्पातहृत्यै ।  
स्थेयान्भास्वाँश्छास्त्रिश तु॒स्यं स्वात्मज्ञये॒तिर्हत एतं गृह्णाणु ॥१४॥

॥ अथ नैवेधम् ॥ यस्य अक्ष्युक्षेत्रे भित्रे आसे । मृत्युर्लेघ्यं चेयम् ।  
कवान्वेष्ट००्यं तस्मै कुस्मै नैवेधार्थं हत्तं द्वैतम् ॥१५॥

॥ ताम्युलमाह ॥ त्रीश तेऽय परब्रह्मिविका पृथ्यमौकपुरुषार्थसाधिका ।  
निविकृद्यपक्षमाधितः पुरा रज्जिकाऽस्तु अवलज्जिका वरा ॥१६॥

॥३॥

॥ अथ प्रदक्षिणा ॥ त्वं त्रीशाहुमहुं त्वमित्यवगतेः स्थेभ्ने निहित्यासनम्  
मानस्ते परिदक्षिणा हि विहिता यद्य चै कृतिम् ।

શ્રીનૃસિહસરસવતીસ્વામી મહારાજ




શ્રીપાદશ્રીવલલલ




प. प. अ. वासुदेवानंदसरस्वती स्वामी महाराज



अबद्धीन पू. श्री. रंग अवधूत महाराज



ભગવાન દત્તાત્રેય



આત્મપ્રાર્થના

દત્તાત્રેય ત્રીશ માતઃ પરેશ  
કારુષુધ્યાધ્યે દીનઅન્ધો પ્રસીદ્ધ ।  
પ્રાણુશ ત્વં પ્રાણીનાં પ્રાણુદાતા  
હર્તા લર્તા હે ક એ વ નિકોડે ॥ ૧ ॥

કઃ શક્તાઃ સ્યાતું ત્વદ્વિશુણાન् ગાતુમત્ર  
માતું માહાતમ્યં નિકોડે ન કોડપિ ।  
કોડહું ઉભેસો મૂહવાગુખુંલઃ સ્યામુ  
સ્તાતું મૂકોડનંતજિહોડપિ વેહઃ ॥ ૨ ॥

નાહં જને કોડપરાધઃ કૃતો મે  
નાયાસિ ત્વં ને દ્વાર્યોહ વાચમુ ।  
કૃપટં ભૂમંસ્તવદ્વિના જીવીતં મે  
સસ્યસ્યેવ પ્રાવૃદ્ધભેદો વિનામણ ॥ ૩ ॥

જામલોડયં લો કામરૂપં પ્રકામં  
દીનં બાલં નિર્દ્યં માં નિહન્તિ ।  
હૃત્વા હૈનં સ્વાતમરાજ્યં પ્રહેણું  
કોડન્યખીશ ત્વદ્વિનાસ્ય પ્રભુઃ સ્યાતુ ॥ ૪ ॥

तद्वायक्षास्तु चिदन्वयेक्षितुरथो त्वानुसमरन् व्याहरेत्  
तारं तारकमेकमात्मनि यथा शाहूलविकीर्तिम् ॥१७॥

॥४॥

॥ अथ नमस्कार ॥ अ स कु ह लिहि ता तेऽनेक जन्मा अत पुष्टे:  
प्र षु ति वि त ति रे वा द्वै त शो वा वि शो वा ।  
त्वयि विनिहितमेतत्मे ज्ञ सर्वं स्वकीयं  
व्यधिप जयतु पूजा त्वधशोमालिनीयम् ॥१८॥

॥ अथ क्षमापनम् ॥ यन्मे न्यूनं संभतं स्थूलदण्ड्या  
भूमन् तेऽनुडेशपीयूषवृष्ट्या ।  
नित्यं ग्रेयः स्वप्रकां शालिनीयं  
तस्याभूतसंपूर्णता शालिनीयम् ॥१९॥

दोधनं चात्मनः शोधनं व्यात्मनः  
पूजनं चात्मनो लोकनं स्वात्मनः ।  
यत्र सैषाऽऽत्मपूजाऽस्तु कङ्कणे सतां  
स्त्रिविष्णु मा परा स्त्रीव कङ्कणेऽसताम् ॥२०॥

॥ ५० ५० श्रीमहावासुटेवानं दसरस्वती (टेम्पे स्वामि) विरचिताऽऽत्मपूजा समाप्ता ॥

॥५॥

प॑ श्यै तं भां त्वं त्ये हा षज्ज प्रलीनं  
हीनं हीनं भर्त्संयन्ति प्रवेदाः ।  
वे हा ती तं त्वं त्ये हा तत्प्रदश्यै  
चिन्धि द्वैतं हुः अभूवं भगैतत् ॥ ५ ॥

मिक्षुश्चाहं द्वारि ते बौक्ष्यकाम-  
स्ति षडा भ्ये षोऽशा न हा रिश्व हुः अी ।  
दत्वा बौक्ष्यं शानविज्ञानसारं  
बत्संवात्मन् सार्थकत्वं प्रयाहि ॥ ६ ॥

हीनश्चाहं निन्दितो द्वैकमध्येरु  
निःस्वेषा नभो निक्रपं त्वां अपद्ये ।  
आपक्षातिंच्छेदने दीक्षितात्मन्  
यत्कर्त्तव्यं तदुकुरुष्वाथु दत्ता ॥ ७ ॥

रिक्तो गच्छेयं कदाचित् पृथिव्यां  
का भे हानिर्हस्यमेवापि ते स्यात् ।  
को वा हाता त्वं प्रोटन्ये दयालुरु  
हीनः को वा भत्प्रोटन्ये दयाहुः ॥ ८ ॥

आन्तोऽत्यन्तं तत्र तत्राटनेन  
आन्तोऽटव्याभागमानां सुखार्थी ।  
भवः भिन्नो भर्तुंकामो भद्रासं  
प्राप्तं द्विष्ट्या धाम ते हेवजुष्टम् ॥ ६ ॥

इन्द्रश्चायं द्वारि ते कातवीर्यं  
प्रहूलाहेऽयं पिंगलो विप्लुशर्मा ।  
अन्येऽप्येते दृष्टुकाभास्तथाहु  
प्राप्ता सर्वे ना विलम्बेऽत्र युक्तः ॥ १० ॥

श्रुत्वेवेदं हीनमाङ्गनं स  
प्राहुर्भूतः शूलभृत्वांगधारी ।  
बिन्दन् भीमं भीषणं जन्मशूलं  
पायाद् द्वेषा मौनगर्भेऽत्रिसूतुः ॥ ११ ॥

रङ्गोऽरङ्गः प्राथंयन्दीनभेवं  
मुक्ताः क्लेशान् नृत्यतीह प्रभताः ।  
अन्येऽप्येवं श्रद्धया सातुरागं  
गायन्तरस्तं हुः अमुक्ता भवन्ति ॥ १२ ॥

२०१ अवधूत

संयु  
य.स  
॥१॥

ॐ

॥ श्रीदत्तः प्रसन्नोऽस्तु ॥



॥ अथ श्रोसमथातीगुरुचरित्रसमनुवाहप्रारंभः ॥

## उपेहधात

कुं न मन गण्यपतिने ॥ भावे वं हुं गुरुदेवने ॥ सूं त साधु सज्जनोने ॥ नमीने थंथ आरंभुं ॥ १ ॥  
 नथी मो हुं कविकीर्तिनो ॥ दास हुं तो सहा संतोनो ॥ न जाणुं खं धं हुं दनो ॥ करो गुन्हो माद मारो ॥ २ ॥  
 एक भ कितथी प्रेरित ॥ वेखने थयो आ उद्युक्ता ॥ केवल हुं चुक्षिभि भाट ॥ लाट हुं तो श्रीगुरुनो ॥ ३ ॥  
 तत्प ग वं ही सुमना ॥ कुं एंती पद्धरयना ॥ जेण्ये आपी स्फुर्ति नाना ॥ हुं दीष्या वगाडीने ॥ ४ ॥  
 मूण व थन आ एमनां ॥ वासुदेवानं द यतिनां ॥ मराठीमां रसाण धष्टां ॥ समनुवाह तेनो आ ॥ ५ ॥

॥१॥

स.गु.      सुरी ते भद्री स्वांग ॥ मूरो पूर्यो गुज्जर रंग ॥ पठने थाय भीति भांग ॥ निःसंग साधक ॥ ६ ॥  
 च.स.      हान द या क्षमासागर ॥ जे स्वयं हत्तावतार ॥ तेषु कर्यो उपकार ॥ चरित्रसार वर्णवी ॥ ७ ॥  
 ॥८॥      धीम ता भूमी डारे क्षषु ॥ जे डे करशो नित्य पठन ॥ हेमशो ए परस्या जाणु ॥ अहं हिन न लागतां ॥ ८ ॥  
 द्वृमा त्र करे पावन ॥ सेवने यश विद्या धन ॥ पामे सुमुक्षु निर्वाणु ॥ सत्य वयन आ मारां ॥ ९ ॥  
 आम या निवित् रोगमुक्ता ॥ थशे श्रवणे एक चित्त ॥ स्वार्थ साधी परमार्थ ॥ पामशो भक्ता सथङ्क ॥ १० ॥  
 याग य जज्जप तप ॥ मूरी लजे हत बाप ॥ थारो निश्चये निःसंताप ॥ स्वातुभवे कथे रंग ॥ ११ ॥

## अध्याय १

ॐ श्रीगणेशाय नमः ॥ श्रीसद्गुरवे नमः ॥ अथ श्रीसप्तशतीगुरुचरित्रसमनुवादप्रारंभः ॥  
 नमुं श्री हत्तानेय गुरुने ॥ जे साई करे हृदखने ॥ स्वात्मज्ञयेति प्रकाशने ॥ शांत अनर्थने करे जे ॥ १ ॥  
 भूत म व्य भवत् चक्षी ॥ जन्मे छये जेना थकी ॥ लीन थाय यद्यथ्वे नकी ॥ ते ज हत चर्चीश्वर ॥ २ ॥  
 लक्षित ग भ्यनुं तेनुं चरित ॥ चित्त शुद्धयर्थ आ संक्षिम ॥ वासुदेवानं हस्तरस्वती लक्ता ॥ जनार्थं स्कुट वष्टिवे ॥ ३ ॥  
 अंथे वा सुदेव निमित्ता ॥ कर्ता कारयिता श्रीहत्ता ॥ तत्पदे राखी स्थिर चित्त ॥ सांभणो चरित संत आ ॥ ४ ॥  
 श्रद्धा नु रक्षितथी जे वांयशे ॥ अथवा लक्षिती सांभणशे ॥ ते ज लवाणिध तरशे ॥ उद्धारशे निज कुल ॥ ५ ॥  
 भन वा ल्हीने अगोचर ॥ ए स्वच्छं हे थाय गोचर ॥ कलियुगमां यतीश्वर ॥ नरसिंहसरस्वती ॥ ६ ॥  
 एतुं च दिन करी श्रवण ॥ नामधारक नामे आह्वाण ॥ गाणगापुरे करवा हर्षन ॥ आव्यो जाणु सहभक्ता ॥ ७ ॥  
 प्राणी ऊ धमालितस ३ जाणु ॥ इच्छे जेम छाया ज्ञवन ॥ तेम त्रितापे तम पूष्ण ॥ ज्ञवन हेखी आव्यो निज ॥ ८ ॥  
 जे जे धर्म अधः परिपूर्ष ॥ अंतर्भाहृव्याप्त जाणु ॥ नामधारक करे तेनुं गान ॥ कहे दर्शन हे ग्रन्थे ॥ ९ ॥

१. रोगा. २. प्रगट ३ तापथी अत्यंत तपेशो.

स.गु. ल. तुं ज मूं लिमंत प्रक्ष ॥ विभूति तुं शुरु परम ॥ कलि मांडे मंगल धाम ॥ लक्ष्माभपूरक ॥१०॥  
 च.स. विशा ल तव सत्कीर्ति ॥ सांखणीने करी भें विनंति ॥ न सांखणे केम तव श्रुति' ॥ चिता अति थायचे ॥११॥  
 ॥१३॥ ने तुं म ने न ए.जापे ॥ तने सर्वं ज्ञ डोणु भापे ॥ अथवा जाणु उपेक्षे सुपे ॥ द्वयाणुकूपे छाके शुं ॥१२॥  
 हुं अ धः पतन पाभीश ॥ ने उपेक्षा माहरी करीश ॥ शुं त्वन्मन सेवा ईच्छे ईश ॥ आपीश दान तेथी शुं ॥१३॥  
 सेवा शा करी त्याग पूर्खूं ॥ मेघमसुं आप शुवन ॥ पूर्वे ने म आप्युं दान ॥ विभीषण्य धुकादिने ॥१४॥  
 शुं सुख पडेणुं करतां ॥ भाणक पासे भागे भाता ॥ भाणक बहि भारे लता ॥ त्यागे भाता तेने शुं ॥१५॥  
 तुं ज म भ भातापिता ॥ तुं ज एक कुक्षदेवता ॥ भिन्नभाव नहि त्यां दाता ॥ डोणु त्राता भने अन्य ॥१६॥  
 नरे इव २\* सेवकवंश ॥ रक्षे न राखतां आशांश ॥ तुं असमत्पूर्वजेश ॥ सर्वेश उपेक्षे कां ॥१७॥  
 हुं ई त्यं भूत सर्व ॥ कहुं तोअे न आवे द्रव॒ ॥ जेथी पाषाणुनेअे आवे द्रव॒ ॥ तुं निर्द्वं डेम थाअे ॥१८॥  
 आवी प्रा र्थना करीने ॥ भूषित थाय, अे जाणुने ॥ दत्त चिते प्रगट थक्ने ॥ आपे स्वप्ने आधासन ॥१९॥

इति श्रीमत्परमहंसपरिवारकाचार्यश्रीभद्रासुदेवानंदसरस्वतीविर यतसमशतीयुग्मरित्रय  
 श्रीतनापादारविंदभिलिङ्गत्यारिपांडुरंगशर्मणा इतसमनुवाहे यरितानुसंधानं नाम प्रथमोऽध्यायः ॥ १ ॥ ओंनी । १६ ॥

### अध्याय २

ए अ हु लावण्ययुक्त ॥ भूति नेई उडे लक्त ॥ भणे एने सिद्ध विरक्त ॥ पूछे तात डोणु तुं ॥१॥  
 सिद्ध र भ्य ऐवे वचन ॥ विभूति शुरु अभारा जाणु ॥ जेना लक्त कहायन ॥ ताप दैन्य न हेझे ॥२॥  
 एवुं व्य क्ता करी श्रवणु ॥ नाभधारक ऐवे दीन ॥ हुं होई अनो लक्त पूर्ण ॥ किंकारण तरछाडे ॥३॥  
 विश्व य त्र चालक दत्त ॥ तेमां आतुं अस्थिर चित ॥ एवुं जाणु ऐवे व्यक्त ॥ सिद्ध मुक्तसंग ने ॥४॥

१. कान. \* राजा. २. द्वा. ३. भीनापण.

१-२

1131

स.गु. ५ तुं स्वल्ल हे करी वतैन ॥ व्यथैं देवने होष हे जाणु ॥ कौपे जे कही अन्य जन ॥ स्वल्लक्ष्मजन रक्षे शुदु ॥ ५ ॥  
 च.स. ६ यहि दां त ए कौपे जरी ॥ रक्षी न शके विधिहरहरि ॥ कहे शिष्य जर्ज वारी ॥ कहो आरे शुदुमहिमा ॥ ६ ॥  
 ॥ ७ ॥  
 कहे सि छ कलियुगने ॥ अहा कहे विस्तारीने ॥ गोदातीरे वास्तव्य करीने ॥ रहे वेदधर्म शुदु ॥ ७ ॥  
 एस्वीय करवा पातकान्त ॥ आव्यो काशीमां महंत ॥ हीपक शिष्य सेवारत ॥ स्वयं कष्ट सहे घोना ॥ ८ ॥  
 सुहा स्य मुझे सेवा करे ॥ शुदु गाणो दृढ़ मारे ॥ न माने मनमां कशीओ अरे ॥ क्षालन करे मलभूत ॥ ९ ॥  
 अंध प इगु गलतकुष ॥ शुरु सहे महाकष्ट ॥ सेवाभिषें कनडे रुष ॥ तोअे तुष्ट शिष्य सेवे ॥ १० ॥  
 अप णा पति॒ थृष्ट प्रसन्न ॥ आपे शिष्यने वरदान ॥ नथी गुर्वाज्ञा कही जाणु ॥ इखिज्ञापणु॑ पाछो काढे ॥ ११ ॥  
 एवो नि श्रव्य जाणु तृष्णु॑ ॥ वर आपे विष्णु पणु ॥ कहे शिष्य ए सर्व दान ॥ आपशे पूर्खु॑ शुदु मारा ॥ १२ ॥  
 निश्च य घेनो जाणुने ॥ विष्णु आपे लुकिमुकिने ॥ शुदुओ थया प्रसन्न घेने ॥ न्यून॑ शिष्यने शु तिहां ॥ १३ ॥  
 ने अ स्त गत भायाद्य ॥ शुदु प्रसन्न घेने थाय ॥ भजे छोडी सर्व संशय ॥ थाशे सदय त्रिमूर्ति आ ॥ १४ ॥

अ.  
२-३

ईति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीशुदुयरितस्य श्री० अ० पांडुरंगकृतसमनुवादे  
 हीपकाभ्यानं नाम द्वितीयोऽध्याय ॥ २ ॥ कुल घोंवी ॥ ३३ ॥

### अध्याय ३

एवुं वे दधर्माभ्यान ॥ नामधारक करी श्रवणु ॥ पूछे तेम ए देव पूर्खु॑ ॥ अवतीर्णु॑ अही॑ थाय ॥ १ ॥  
 कां ले द शावतार ए ॥ सिद्ध कहे सांबण तुं ए ॥ अंभरीष माटे जाणु ए ॥ नटन ए तो श्रीहरितु॑ ॥ २ ॥  
 हुर्वा॑ स नृषि द्वादशीदिने ॥ आव्या अंभरीषभारणे ॥ लगाड विलंभ कर्मने ॥ थाय भने भिन्न भूप ॥ ३ ॥

१४॥

१. सेवाने भणने. २. शंकर. ३. सत्वर. ४. कमती.

સ.ગ.  
ચ.સ.  
॥૧૫॥

લય કે જા વહી જણ્ણી ॥ રાજ પીએ અંજવિ પાણી ॥ કોંધે ઝલિ શાપવાણી ॥ વહે જનિ<sup>१</sup> નાના વૈ ॥ ૪ ॥

હોડચા દ યાળુ ત્યારે હરિ ॥ બક્તા ઠારે શાપ સ્વીકારી ॥ સર્વભ્યાપી નારાયણે ધરી ॥ નરઙ્ઘ કરી લીલા ॥ ૫ ॥

ધરી શ્રી ૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરાયતસપ્તશાળીયુસ્યરિત્રસ્ય શ્રી ૦ થ૦ પાંડુરંગકૃતસમતુવાદે  
અંબરીયાખ્યાનં નામ તૃતીયેડધ્યાય: ॥ ૩ ॥ કુલ ઓંબી ॥ ૩૮ ॥

અ. ૩-૪

## અધ્યાય ૪

મહુ વિત સિદ્ધને પૂછે દ્વિજ ॥ કહે મુજને અત્રિ કોણ્ણજ ॥ શાથી થાય એ નીશ અત્રિજ<sup>૨</sup> ॥ સુષુ અચરજ કહે સિદ્ધ ॥ ૧ ॥

ભણુ અ ત્રિ પ્રભુપુત્ર ॥ અનસૂયા તત્કલતત્ર<sup>૩</sup> ॥ દંપતી પરમ પવિત્ર ॥ તત્પુત્ર દાતાત્રેય ॥ ૨ ॥

નિર્ભા ધ અનસૂયાનું<sup>૪</sup> ॥ મત જોઈ પતિસેવાનું<sup>૫</sup> ॥ મન ધીધું સહુ સુરોનું<sup>૬</sup> ॥ અજાનાનું ધીજ એ ॥ ૩ ॥

એ નિપુંશો તદ્ધ્ય<sup>૭</sup> સુર ॥ વિમૂર્તિ પાસે હોડે સત્ત્વર ॥ આથાચી એમને વિધિહરિહર ॥ થયા ઇપધર બિક્ષુ ॥ ૪ ॥

એ જી ધ્વનિ લોક છોડીને ॥ બિક્ષુ જેવા થઈને ॥ આધ્યા ત્રણે અત્રિસદને ॥ જતાં વને મુનિવિર્ય<sup>૮</sup> ॥ ૫ ॥

કોઃ કિ મ્રયોજન આગમન ॥ પૂછે અનસૂયા કરી નમન ॥ નભબિક્ષા આપ તું તૂર્ણ<sup>૯</sup> ॥ વહે વચન હેવત્રથ ॥ ૬ ॥

જેવા સ્તુતિ<sup>૧૦</sup> છોડી ખસે સુર ॥ તેવી સતી જોડી કર ॥ કહે ધરિસત આધું સાર ॥ સ્વસ્થ ઉર કરો બિક્ષા ॥ ૭ ॥

સુત્ર તા ચિત્તે ધરે ધ્યાન ॥ અત્રિપદે કરે નમન ॥ અતિથિ બાળક કલ્પી પૂર્ણ<sup>૧૧</sup> ॥ સતી નભ થાય ત્યાં ॥ ૮ ॥

સુહુ સ્ત ર કેમની માયા ॥ સહસ્ર<sup>૧૨</sup> બાળક તેચો થયા ॥ એ જોઈને અનસૂયા ॥ વિસમયા કુલ થઈ એ ॥ ૯ ॥

સુહા સ્ય સુખે તેડે બાળક ॥ પાનંડા કૃષ્ણો સ્તને નિઃશાંક ॥ ધવડાવે એકએક તોંક<sup>૧૩</sup> ॥ જે નિઃપંક્ષ<sup>૧૪</sup> પાતિવ્રત્યે ॥ ૧૦ ॥

મન જા ન્ત થયાં એમનાં ॥ પતિવ્રતા સ્તનપાને ધણુંાં પારથામાં નાખીયાય નાના ॥ મધુરસ્વના<sup>૧૫</sup> ગીત એ ॥ ૧૧ ॥

॥૫॥

૧. જન્મ. ૨. અત્રિપુત્ર. ૩. સ્ત્રી. ૪. ટેવોનું. ૫. ડગમગે છે હિંમત જેમની તે. ૬. માર્ગ. ૭. એકદમ. ૮. બાળક.

૯. મેલરહિત. ૧૦. મીઠા અવાજવાળી.

स.गु. ए सुखा नंद गाणुं सुखी ॥ वनमांथी आ०था वेगे मुनि ॥ शाने विभूति भने जाणी ॥ स्तुति धखी करे ॥ १२ ॥  
 च.स. भाव गु ह्य अणुं सत्वर ॥ पुत्र थर्ध रह्या निर्जर\* ॥ स्वस्थानेए गया ग्यमर<sup>१</sup> ॥ निर्जरपधर छें ए ॥ १३ ॥  
 ॥१३॥ सगु ण थया निर्गुणु ॥ अत्रि पाडे नाम निपुणु ॥ चंद्र दत्ताहुर्वासा जाणु ॥ अह्या विष्णु महेश्वर ॥ १४ ॥  
 चंद्र प्रथाम करी नीसरे ॥ चंद्रलोके जर्ध ठरे ॥ हुर्वासा त्रिभुवने विचरे ॥ स्वगृहे रहे श्रीदत्त ॥ १५ ॥  
 एरनि वृत्तिमार्ग प्रसारे ॥ भजताकामना पूर्णु करे ॥ स्मर्तुंगामी<sup>२</sup> जगे विचरे ॥ अवतरे श्रीपादाभ्य<sup>३</sup> ॥ १६ ॥  
 धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितस्तशतीगुरुयरित्रस्य श्री० अ० ५० पांडुरंगकृतसमनुवादे  
 अनसयोपाख्यानं नाम चतुर्थोऽध्यायः ॥ १६ ॥ ओंनि ॥ ५० ॥

अ० ४-५

## अध्याय ५

ए था झाहे<sup>४</sup> विप्रवरे ॥ उत्तरे<sup>५</sup> आवी भिक्षा करे ॥ श्रावपूर्वे द्विजनारे ॥ अपर्युं करे श्रावान् ॥ १ ॥  
 दत्त वि प्रखीनो भाव ॥ नेई सुत स्वयमेव ॥ थया श्रीपादराव ॥ गृहभाव<sup>७</sup> न स्वीकारे ॥ २ ॥  
 विशे ष विद्यालिङ्ग थतां ॥ विवाह आरंभे पिता ॥ पुत्र कहे सर्वं स्त्री भाता ॥ वरुं ददिता<sup>८</sup> योगश्री ॥ ३ ॥  
 निश्च य सुखी थां भिन्न ॥ त्रिभूतिर्जप देखाडी जाणु ॥ भातपिताने आध्यासन ॥ आपे, हीनभंधु ने ॥ ४ ॥  
 इंके प्रभु ए पर दृष्टि ॥ पंगु यावे विना थष्टि ॥ निर्मल थर्ध अंध दृष्टि ॥ अतकर्य सृष्टि श्रीपादनी ॥ ५ ॥  
 आशीर्वाद आपी तेमने ॥ काशी क्षेत्रे जर्धने ॥ बद्रिकाश्रम नेईने ॥ जोाकर्णे आव्या श्रीपाद ॥ ६ ॥  
 ७विम लाः कीर्तयो यस्य श्रीदत्तात्रेय एव सः ॥ कलौ श्रीपादरूपेण जयति स्वेष्टकामधुक् ॥ ७ ॥  
 धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितस्तशतीगुरुयरित्रस्य श्री० अ० ५० पांडुरंगकृतसमनुवादे  
 श्रीपादावतारकथनं नाम पंचमेऽध्यायः ॥ ५ ॥ दुल ओंनि ॥ ५१ ॥

॥५॥

\* १. देवा, २. नरु देव, ३. भोक्त्रभार्ग, ४. स्मरणुमाने आपत थनार, ५. श्रीपाद नामथी ६. श्रावने द्विसे ७. उत्तर  
 देशमां भीठापुर नामे नगरभां, ८. गार्हस्थ ९. पत्नी, १०. विभव छे शर्ति नेनी। श्रीदत्त पोते एन मुनि ॥ कलिमांडे  
 श्रीपाद जानी ॥ लक्ष्मिसतपूरक ॥ ५ ॥

## अध्याय ३

२५.  
६स गु  
य स  
॥७॥

कथा अ सल सुष्ठी जाणु ॥ नामधारक करे प्रश्न ॥ सर्वं क्षेत्रो त्यजु गोकर्णु ॥ किंकारणु आव्या ए ॥ १ ॥

श्रीव ध मेरं रावणुमाता ॥ कैवासनी करी चिता ॥ मृन्मय लिंग पूजतां ॥ भिन्नता आवे पुत्रने ॥ २ ॥

ए आ अ र्थ भानीने ॥ कहे कैवास आणीने ॥ आपुं, हेंकी हे आ भाटीने ॥ एम कहीने चाहयो ए ॥ ३ ॥

भणे मूळ सह कैवास ॥ जाचा करतां कंपे भस ॥ भीहीने गौरी कहे गिरिश ॥ प्रतय धीश वार आ ॥ ४ ॥

त्यांकै ला स हावे हर ॥ चगदायो नीचे निशाचर ॥ मरणोन्मुख करे स्तोत्र ॥ तेथी हर प्रसन्न ॥ ५ ॥

त्वद न्यू नथी भने ग्राता ॥ तुंज भारी प्राणुदाता ॥ हयाणु तुं रक्ष भाता ॥ एम कहेतां होडे शंखु ॥ ६ ॥

ते अ नु भान न करी ॥ छोडयो भने महानारि ॥ एम कही स्तुतिं करी ॥ सम स्वरे रावणे ॥ ७ ॥

गाय सं गीत शाखाधारे ॥ भस्तक छेही वीणा करे ॥ रागरागिणी सुस्वरे ॥ कालादरे प्रेमथी ॥ ८ ॥

शिव त न्मय गासे थर्द ॥ भोड पाभी पासे जर्द ॥ आत्मलिंग अने धर्द ॥ कहे थर्दशतुं ज शंखु ॥ ९ ॥

हाथे ता त अमरता ॥ वर्षत्रय आ पूजतां ॥ लंका कैवास स्वयं हाता ॥ थें भाता कवेशमुक्ता ॥ १० ॥

अव नि उपर वयमां ॥ मूढतां नावे हरी करमां ॥ एवीरोते लहज्जपुरमां ॥ कैवास भा शु करे ॥ ११ ॥

हैत्य करी वेगे नमन ॥ लंकाभार्गे चालयो रावणु ॥ नारदे जर्द ईर्द्रिभनन ॥ कर्युं कथन सर्वं त्यां ॥ १२ ॥

अध मर्म त्मक ए जाणीने ॥ ईद्रकहे जर्द घळाने ॥ ए पणु विष्णुने कहीने ॥ आवे लहने शिव पासे ॥ १३ ॥

ए अ नु चित कर्मे हर ॥ पर्मात्मापे कहे शंकर ॥ थयुं विस्मरणु ढूर ॥ पा पहोर गये थयो ॥ ४ ॥

हेवा वं धने पडया छे सर्व ॥ विष्णु कहे जाणु ए तुं शर्वं ॥ तो ए कर्युं कं आवुं सावाश्रम आगणपडशेमुने ॥ ५ ॥

ने व धी नाए लुव ॥ तेने कर्ये चिरंलुव ॥ वरदान कही शिव ॥ कहे उपाय तुं कर ॥ १६ ॥

१. शंकर. २. तारा वगर खाजे. ३. शंकर.

॥७॥

करी नि श्यय अने मणी ॥ नारहने हे भोक्त्री ॥ वषषु करवा विष अणी ॥ सिद्धुरभौलिं भोंक्त्रे ॥१७॥  
 स.गु. ८५. मुनि म नो वेगे होडया ॥ पृक्ती पाडी वाते चढया ॥ रावणु संध्या करवा अडया ॥ गलस्य होडया वेगेत्यां ॥१८॥  
 च.स. ८६. १८॥ वेषा नु इपु कालु ओले ॥ अहम्यारी मानी लिंग आले ॥ न द्वे ताए रावणु ओणे ॥ अदु ओले सांखण ॥१९॥  
 ८७. वृत्पेत्य हुं अति रांक ॥ वृषु वार मारीश हांक ॥ लार लागतां भूक्तीश क्यांक ॥ न वांक काठीश तुं ॥२०॥  
 स्वगं लो के सुर विलोके ॥ अर्ध्यसभये वृषु हांके ॥ ऐलावी, न आवतां भूके ॥ लिंग सुणे भू पर ॥२१॥  
 ए तो के३ कुरुं स्थापन ॥ रावणु थीये न हालु लाणु ॥ महाअणेऽवर गोकर्णु ॥ क्षेत्र मान भूक्तीलास ॥२२॥  
 ईति श्री ५० ५० वासुदेवानं द्वसरस्वतीविरचितस्तथातीयुत्यरित्य श्री. अ० पांडुरंगकृतसमनुवादे गोकर्णु महाअणेऽवर-  
 प्रतिष्ठापनं नाम पृष्ठेऽध्यायः ॥ ६ ॥ दुल ओंनी ॥ ८३ ॥

## अध्याय ७

हुतो न रपति एक ॥ भित्रो सह तत्सेवक ॥ श्राद्धे नुमांस अपे० ४३ ॥ वसिष्ठादिक ऋषिने ॥१॥  
 रोपा रु ६ शापे मुनि ॥ अद्वैराक्षस थये नृभणि ॥ विमवधे शापे रमणी ॥ ज्ञवहानि खीसंगे ॥२॥  
 ए भू प आर साल ॥ थतां प्राग्वत् थये विमल ॥ राष्ट्रीने कडे सकल ॥ शापणोत्थ आहाणीना ॥३॥  
 हुःपे म रषु ईच्छे राष्ट्री ॥ सांत्वन आपे नृपभणि ॥ कृषुलात आपी भापो तष्ट्री ॥ द्विजथणी प्राथै० ए ॥४॥  
 ५. मन स्ये कं वयस्येकं ॥ एवो आ नहि सेवक ॥ एम जाणी द्विजलोक ॥ कडे अभ्यक्त तीर्थयात्रा ॥५॥  
 अह्न ह त्या एन न लय ॥ तेथी भूप गजराय ॥ महाअति भिथिला लय ॥ कडे हाय गौतमने ॥६॥  
 ६. करी त हुःप अवणु ॥ मुनि कडे क्षेत्र गोकर्णु ॥ तिहां देषनिवारणु ॥ थशे, पावन थाशे तुं ॥७॥

१. गणपति. २. स्वज्ञनोन्मे पाणवा योग्य. ३. भागके. ४. पहेलांनी भाफ्क. ५. मनमां एक ने वाणीमां भीजुं

સ. ગુ. સુણ થો કુંક આજ્યાન ॥ દેખયું જે તે કરું ધરન ॥ શિવહૃત હોડચા સવિમાન ॥ ચાંડાળી મરણ પામતાં ॥ ૮ ॥  
 ચ. સ. જેઈ પ ગે પડયો હું ને ॥ પૂછયું ત્યારે દ્વાં કરીને ॥ કહ્યું રાજ મને એમણે ॥ પ્રાગ્જન્મે આ વિપ્રસ્તી ॥ ૯ ॥ ૨૫.  
 ૧૮ ॥ એબા લ વિધવા થઈ જાણ ॥ જારકમે રમમાણુ ॥ સ્વજનોએ ત્યાગી તત્કષણ ॥ વૈશ્વજન વરે એ ॥ ૧૦ ॥  
 અસ ધ્ય સંગે હુષ ॥ જારકમે થઈ ભષ ॥ મધમાંસે બની પુષ ॥ બાવિ કષ્ટ ન જાણે ॥ ૧૧ ॥  
 ગાય તે ને માની મેષ ॥ માની ખાય મત્તવેષ ॥ અન્યેદું<sup>૨</sup> દેખી ગોશીર્ષ ॥ કરી કવેશ છુપાવે એ ॥ ૧૨ ॥  
 લું નાં તે એ ચાંડાલી ॥ ગોવદ્ધે થઈ ઘેલી ॥ અવિયારે એ આંધળી ॥ વણુમેદી જારકમે ॥ ૧૩ ॥  
 એવી તો કપણું<sup>૩</sup> થઈ જાણ ॥ માબાપે કીધું રક્ષણ ॥ કાળે થતાં પિતુમરણ ॥ અથાણુ થઈ છેડી ॥ ૧૪ ॥  
 એ જ ન સંઘ સાથે ચાલી ॥ વનાહે<sup>૪</sup> ગોડણેં ભલી ॥ વન્ધુહીન ભૂભી વળી ॥ માગે ખાલી બિક્ષાન્ત ॥ ૧૫ ॥  
 એયાં ચારું કરે ધરી કર ॥ કોઈ હસે થોલે નર ॥ નાખે હસ્તે બિલ્વહલ ॥ હેંકે હર સુંધી એ ॥ ૧૬ ॥  
 પડે દિ ધ્યાન<sup>૫</sup> લિંગ પર ॥ તુષ્ટ થયા ગૌરીવર ॥ કરી આને ભવપાર ॥ મોકદ્યા શીંગ અમેને ॥ ૧૭ ॥  
 પુન ને જન્મ એને ॥ તેથી લઈ ગયા વિમાને ॥ ગૌતમ કહેતુંએ નુભણે ॥ જઈ ગોકર્ણું<sup>૬</sup> ધન્ય થા ॥ ૧૮ ॥  
 નૃપ ચ મહાર માની જાણ ॥ જતાં જ થયો પાવન ॥ જ્યાં સાક્ષાત ગૌરીરમણ ॥ આવ્યા તત્ત્વથાન શ્રીપાદા ૧૯ ॥  
 ઈતિ શ્રાં ૫૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસપ્તશતીગુરુચિત્રસ્ય શ્રીં ૫૦ ૫૦ પાંકુરંગકૃતસમનુવાદે  
 ગોકર્ણશ્રીકૃતવર્ણનં નામ સપ્તમોડધ્યાય: ॥ ૭ ॥ કુલ એંવી ॥ ૧૦૨ ॥

## અધ્યાય ૮

સિદ્ધ સં ક્ષેપે કથા ગાય ॥ શ્રીપાદ ગોકર્ણુંથી જાય ॥ કૃષ્ણાતીરે સ્થિત થાય ॥ યતિરાય કુરુપુરે<sup>૭</sup> ॥ ૧ ॥  
 મૂર્ખ<sup>૮</sup> પ્ર જ સહ માત ॥ લોકનિદાથી થઈ નરસ ॥ દૂધી મરવા કૃષ્ણામંનતા ॥ અક્ષમાત હેઠે પ્રલુ ॥ ૨ ॥

૧. બીજે દિવસે. ૨. આગપણમાં. ૩. શિવરાત્રીને શતદિવસે. ૪. યાચના. ૫. દૈવમોગે. ૬. હાલ એને કૃગરી કહે છે.

३५  
 ८८  
 १०॥  
 श्रीय ति कहे सुभति ॥ आत्महत्या हुस्तर अति ॥ जन्मान्तरे सुपुत्राप्ति<sup>१</sup> ॥ थावा सती प्रार्थे ए ॥ ३ ॥  
 तप्ति छा जाणी गहन ॥ श्रीगुरु कहे आज्ञान ॥ उज्जविनीमां चंद्रसेन ॥ शिवार्थे न करे प्रदेषे ॥ ४ ॥  
 ॥२०॥  
 एनो अ भूत्य सन्मणि ॥ हरणु करवा नृपमणि ॥ लक्ष्मीसाथे अक्षोङ्किणी<sup>२</sup> ॥ उज्जविनी वेष्टे ए ॥ ५ ॥  
 हुस्तर अ रथ पदाति<sup>३</sup> ॥ हेख्या छतां नधरे लीति ॥ शिव पूजे ए भूपति ॥ करे दृष्टि गोपयुत्र ॥ ६ ॥  
 अक्ष त्थ नीचे आंगणे ॥ रमे बाणके पाखाणे ॥ पूजे, जननी घेर ताणे ॥ पूजने तो ए रमे एक ॥ ७ ॥  
 बाण मे जो ए विभेराये ॥ पूजे एकदो माए मार्थी ॥ ताणी जातां भूर्धित पडचो ॥ कर साहो शंकरे ॥ ८ ॥  
 पुष्ये नं ह अथ थर्जने ॥ भाता पामी पुत्र हृष्णने ॥ तेजःपुंज लिंग देखीने ॥ देख छोडीने गया भूप ॥ ९ ॥  
 दिव्य सु तेज्जले अंतरे ॥ शनिप्रदेष कर जा रे ॥ सती कहे अवत्सम<sup>४</sup> वरेदा ॥ जन्मान्तरे सुन पासु ॥ १० ॥  
 जे लाव को ने आपे वर ॥ तथास्तु कही भाथा पर ॥ भूर्भुत्रना भूके कर ॥ विद्वद्र ए थये ॥ ११ ॥  
 जग रु कुरे पूजन ॥ विप्रात्मज<sup>५</sup> थर्ज ए जाणु ॥ अन्य न मणे स्वसमान ॥ तत्सुत तेथी थया हत्त ॥ १२ ॥  
 ईति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसत्तशतीशुरुयरित्रय श्री० अ० ५० ५० पांकुरं गङ्कृतसमनुवादे  
 शनिप्रदेषतक्थनं नाम अष्टमोऽध्ययः ॥ ८ ॥ कुल एांवी ॥ ११४ ॥

### अर्थाय ८

सुद ठ अक्षित हतो एक ॥ श्रीपादनो लदो सेवक ॥ ए जातनो नीच रजक<sup>६</sup> ॥ एक भावे वहे सदा ॥ १ ॥  
 नित्य मूरु क वहे आर्थ ॥ वस्त्रो धोतां भूपैश्वर्य ॥ हेखी ईच्छे एतुं ऐश्वर्य ॥ शुरुराय जाणे ए ॥ २ ॥

- 
१. प्राप्ति. २. २१८७० हाथी, २१८७० रथ, ३५६१० कोडा, १०८३५० पायदण, मणी २१८७०० ल२५२  
 ३. पायदण. ४. पुत्रनी ईच्छा. ५. आपना ज्वेता. ६. वरदानथी. ७. जायत. ८. आलिषुकन्या. ९. धोआई.  
 ॥१०॥

३। रे ए। ल क्षेत्र भक्त। अधि पधी वा आपुं तथा। क्षोगव राज्य अनासक्त। थये। वृद्ध क्षेत्र ए॥  
 ४। पधी म ने आपो यौवने। रहेजे भवत्मृति मने। गुरु क्षेत्र भवेच्छसहने। था राज ने भणीश हुं॥  
 ५। धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीभुव्यरित्रयस्य श्री० ५० भांडुरं गृहतसमन्तुवाहे  
 ६। २७क्षवरप्रदानं नाम नवमोऽन्यायः॥ ६॥ कुल एती॥ ११८॥

અદ્યાય ૧૦

सत्य सं कृष्ण आपे अति ॥ स्वयं अवतार धरी यति ॥ मणे कुरुपुरे संप्रति ॥ सांबण श्रेष्ठि विप्र एक ॥ १ ॥  
करे ग रीभ ए वेपार ॥ भाधा अे बने शाहुकार ॥ यात्रा अे जतां भागे चोर ॥ भारे ठेर एहने ॥ २ ॥  
श्रीश श स्त्रे भारे चोर ॥ लुवाडे ए द्विजवर ॥ लुवतो राणी एक चोर ॥ यतीक्षर गुप्त थाय ॥ ३ ॥  
एश से भर्या लाखी ॥ धन साथे द्विज हानी ॥ आधे कुरुपुरे धर्षी ॥ भाधा छोडी आनहे ॥ ४ ॥

धर्ति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसंपत्तशतीयुस्यरित्रिस्य श्री० अ० पांडुरंगाकृतसमनुवादे  
भूतविप्रसंज्ञवनं नाम दृशमोऽध्यायः ॥ १० ॥ कुल अंती ॥ १२२ ॥

અદ્યાત્રા ૧૧

ધાર્ઘ ણ સ્વી કરંજપુરે ॥ અંબા નામે એક વિચરે ॥ પાઈ સંસ્કારે પ્રહોષ કરે ॥ એને વરે માધવદ્વિજ ॥ ૧ ॥  
 થઈ હ દ્વીપ ગલિણી ॥ એલે મુખે તત્ત્વવાણી ॥ શોલે સંસ્કારેથી ધણી ॥ આપે જનિ શુભ લગે ॥ ૨ ॥  
 એ પ હે પુત્ર એંકાર ॥ પિતા કરે તત્ત્વસંસ્કાર ॥ થાય સર્વ હૃષ્ટતર ॥ અવતાર આ કહે ॥ ૩ ॥  
 સ્વર્જ ન કરે નામકર્મ ॥ પાડે નામ નૃહરિશર્મ ॥ પિતા કરે દાનધર્મ ॥ ચિત્રનમ્ભો રમે સુત ॥ ૪ ॥  
 કહે છિ, તો હુસે પોતાપ ॥ કેમે કર્યો ન એલે બત ॥ ભૂક માનીને જુરે માત ॥ કરી સંકેત વારે શિશ્ય ॥ ૫ ॥  
 મુક ત્વા ન્ત થશે ત્યારે ॥ મૌંલુખંધન કરશો જ્યારે ॥ એમ કહી સુષ્પર્ણ કરે ॥ લોહનું કરે તત્કાળ ॥ ૬ ॥

१. पूर्वना, २. ददनिश्चयी, ३. पुंसवनादि, ४. लीला, ५. पुत्र & अक्षेसो ! ६. हाथरी,

એ વા ત માની તત્કષ્ણુ ॥ કરે તાત પ્રનાયંધન ॥ માતા પાસે બિક્ષાદાન ॥ માગે, ત્રણ વેદ પઢે ॥ ૭ ॥  
 જ્યાં પ્રાતઃ કાલ થાય ॥ અંધકાર સમૂળ જાય ॥ તેમ ભાગક વેદ ગાય ॥ સુણી જાય મર્ત્યાખુદ્ધિ ॥ ૮ ॥  
 ॥૨૩॥ સર્વે પરમ થયા હૃષિત ॥ ત્યાં તો પ્રાર્થે બદુ માત ॥ સ્વીકારું કહે સંન્યસ્ત ॥ થશે પુત્રપુત્રી તને ॥ ૯ ॥  
 માતા દે લેલિપાતા<sup>૧</sup> શુ સુણી ॥ મેશુદ્ધ થધ પડે ધરણી ॥ આન આવતાં વહે વાણી ॥ કહે જાની ક્રમસંન્યાસ ॥ ૧૦ ॥  
 નિય ત પ્રક્ષયર્થે રહી ॥ ગૃહસ્થાહિકમે કહી ॥ સંન્યસ્તહીક્ષા વેહેમાંહી ॥ અન્યથા તહી અધઃપાત ॥ ૧૧ ॥  
 ધતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં હસ્તરસ્વતીવિરચિતસપ્તશતીગુરુરિત્રસ્ય શ્રી૦ અ૦ ૫૦ પાંકુરંગૃતસમનુવાદે  
 નૃસિહાવતારો નામ એકાદશીઽધ્યાય: ॥ ૧૨ ॥ કુલ ઓંની ॥ ૧૩ ॥

## અધ્યાય ૧૨

સંચિય ત્વ રઘુનું અવણુ ॥ ન થાએ સંન્યાસ વિષુ ॥ તદેતુ વૈરાગ્ય કરુન ॥ આળસ ન ઘટે અહીં ॥ ૧ ॥  
 મા !<sup>૨</sup> વારે ખુદુફુદસમ ॥ કષણુભાંગુર હેહ પરમ ॥ આયુ જાય બીજળી જેમ ॥ મૃત્યુ નેમ ચૂકે ના ॥ ૨ ॥  
 કેણુ મા નવો બાપડા ॥ મૃત્યુ આગળ હેવો મડાં ॥ ઇટોઇટ હુટે ઘડા ॥ કેમ વારે સુને મા ॥ ૩ ॥  
 નેસ રીં ક માતૃસ્તેહ ॥ કેમ છુટે પુત્રમોહ ॥ મૂડી હાથ માથે એહ ॥ પૂર્વહેહસમૃતિ અર્પે ॥ ૪ ॥  
 કહે ત નય<sup>૩</sup> શ્રીપાદ તું ॥ એક પુત્ર થતાં જા તું ॥ કહે એ પૂર્ણ થતાં હેતુ ॥ આજા હે તું કહી રહે ॥ ૫ ॥  
 જેનું નય ગ અધ્યયન ॥ જે પ્રસિદ્ધ જાનસંપત્તા ॥ તે પણ એની પાસે જાણુ ॥ અધ્યયન કરે નિત્ય ॥ ૬ ॥  
 મા ત્યાં ય ગંભીરું થાય ॥ પ્રસ્તે કાળે પુત્રદ્ય ॥ આજા લઈ પ્રથમ ધાય ॥ યતિરાય થવા કાશી ॥ ૭ ॥  
 એ સ સ્મિ ત એલે વચન ॥ પુનઃ મળીશું કહી જાણ ॥ કાશી માંહે આની નિપુણુ ॥ ચોગસાધન કરે ધૈર્યે ॥ ૮ ॥  
 મહા ના તસમય<sup>૪</sup> એને ॥ સંન્યાસમાર્ગ સ્થાપણો જાણીને ॥ વિપ્રોએ પ્રાર્થના કરી તેણુ ॥ સંન્યાસી ક્ષણે એ થયા ॥ ૯ ॥  
 જેહ તા તત્સ્થાને થતિ ॥ વૃદ્ધ કૃષ્ણસરસ્વતી ॥ એમને વરી ચુરુ શ્રીપતિ ॥ થયા નૃસિહસરસ્વતી ॥ ૧૦ ॥

૧. વજપાત. ૨. પાણીના પરપોદા. ૩. પુત્ર. ૪. મદહીન. ૫. સંન્યાસમાર્ગ.

નાને ન ૨૩૫ ધારણુ ॥ કરી રામકૃષ્ણ સમાન ॥ ગુરુના ગુરુ છતાંએ જાણુ ॥ કરે નિર્વાણ શુકુ પોતે ॥૧૧॥  
 અતિ નિ પુણુ શ્રૌતધર્મે ॥ સ્થાપી ઇરે તીર્થશ્રદ્ધમ ॥ આપી ભાધવને આશ્રમે ॥ જન્મમભૂમિએ વળે એ ॥૧૨॥  
 ૧૨૩ ॥ ધતિ થ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસંતશતીગુરુસ્વરિતસ્ય થ્રી૦ ૫૦ પાંડુરંગકૃતસમતુવાદે  
 સંન્યાસિકાયણાં નામ દાદશોદ્ધયાય: ॥ ૧૨ ॥ કુલ એંતી ॥ ૧૪૫ ॥

અધ્યાત્મ ૧૩

બાલ વ ર્થ જ્ઞાનજ્ઞયેણિ ॥ કૃષ્ણ માધવ સરસ્વતી ॥ વળી સહાનં દોપેં દ્રયતિ ॥ સાતમો હું એ મુખ્ય શિષ્ય ॥ ૧ ॥  
 અધ્ય ત સર્વ શાંતિ ॥ ગુરુ એવા શિષ્યો સહિત ॥ આંધ્રા જન્મભૂમે તુરત ॥ ધન્ય માત યતિવંધ ॥ ૨ ॥  
 વિન ન્તિ કરી નારીનર ॥ વિશ્વરૂપને ઘેરઘેર ॥ લઈ જય, અર્પે ગુરુવર ॥ પરપાર<sup>૩</sup> માખાપને ॥ ૩ ॥  
 એ પ્ર મૂળ કહે લગિનીને ॥ દંપતીલેદ કર્યો તેં ને ॥ લતાપ્રહાર કર્યો ધેતુને ॥ થઈશ કુદ્ધી ને પતિત્યક્ત ॥ ૪ ॥  
 એ ભૂ ય<sup>૪</sup> પ્રાર્થે, કહે યતિ ॥ વાર્ષક્યે થાશે યતિ પતિ ॥ કુષ્ટની કીશ હું શાંતિ ॥ સ્ત્રીને ગતિ પતિ એક ॥ ૫ ॥  
 એવું ત ત્કષ્ણે કહી એને ॥ લઈ શિષ્ય મંડણીને ॥ આંધ્રા તીરે ગોદાવરીને ॥ ભૂગોળને ઉદ્ધરે ને ॥ ૬ ॥  
 શિષ્ય મે ગવે અન્ય એક ॥ માધવારણ્યસંજ્ઞક ॥ જાન આપીને સમ્યક્ર ॥ વિશોક<sup>૫</sup> કીધો ગુરુએ ॥ ૭ ॥  
 ગુરુ વ ર્થ આગળ જાય ॥ ત્યાં એક વિગ્રહેખાય ॥ મરવા આવે ગોદા માંદ્ય ॥ પતથર પેટે આંધીને ॥ ૮ ॥  
 મંદ ચા લે જાણી ભાવ ॥ કહે રૈ શિષ્યો દોડા સર્વ ॥ દોડયા શિષ્યો મૂદી ગર્વ ॥ એને સજવ<sup>૬</sup> આણ્યો ત્યાં ॥ ૯ ॥  
 એ સા હું ત પૂછતાં જાણુ ॥ કહે શૂલાર્ત<sup>૭</sup> ત્યનું પ્રાણુ ॥ કર્યાં કુકર્મ ભૂતી ભાન ॥ ઇણ ગહન તેનું આ ॥ ૧૦ ॥  
 નથી પુ ઇય પૂર્વાપર ॥ થયો હું આ ભૂમિકાર ॥ શ્રીગુરુ કહે અનિવાર ॥ દોષ અજર આત્મધાતે ॥ ૧૧ ॥  
 આ ચા રૂઢ દેહ હુર્બભતર ॥ કર કહું ઓષધોપચાર ॥ મા પાડ કહે ગુરુવર ॥ આંધ્રો વિગ્રહ ત્યાં સાયં દેવ ॥ ૧૨ ॥

१. वेहधर्म. २. सन्यास. ३. भोक्ष. ४. इरीथि. ५. शेकरहित. ६. वेगे. ७. शूण्थि पीडित. ८. सुंदर.

संतो व पामी करे दर्थन ॥ कहे हुं कांचीवासी जन ॥ शुडे कहे आ भूम्यो जाण ॥ दिजजन एने जमाइ ॥ १३ ॥  
 स.गु. १३-  
 आ साम्र तँ कार्य कर ॥ सायंदेव कहे जोडी कर ॥ अन्नवेरी आ दिजवर ॥ मरतां होष मने आजे ॥ १४ ॥  
 च स १४-  
 अपू पृ आप कहे एने ॥ ए मानीने शुकुशीने ॥ बिक्षार्थ तेडे प्राथीने ॥ शिष्योनेए दिज साथे ॥ १५ ॥  
 ३ सुपा द्ये धोवे शुरुपाद ॥ पूल विधिथी वंदे पाद ॥ जमाडे, सर्वने आनंद ॥ थये विगहै विप्र ए ॥ १६ ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचित्सप्तशतीशुरुस्यरिनस्य श्री० अ० ५० पांडुरंगदृतसमनुवादे  
 विप्रशूलहरणं नाम त्रयोदशोऽध्यायः ॥ १३ ॥ दुल ओंवी ॥ १६१ ॥

### अर्धयाय १४

ए साय न्हेव अद्वकर ॥ कहे हुं तो भेदेन्छकिंकर ॥ लागे आजे हुण्यो शिर ॥ ओलाव्यो हेर मोक्ती ॥ १ ॥  
 न अ तः पर भुने डर ॥ शुडे कहे तुं ला सत्वर ॥ मोक्तशो पाछो ससत्कार ॥ कही कर ईरवे ॥ २ ॥  
 आज प्र साद मानी भने ॥ सायंदेव ज्ञातां यवने ॥ भृतप्राय थह डरीने ॥ सत्कारीने मोक्तये ॥ ३ ॥  
 वंश वृ छि ने शुकुभक्ति ॥ आपी पुनर्दर्शन गति ॥ आपीश कही श्रीपति ॥ शुभत यति थया पोते ॥ ४ ॥  
 निवृत्तिः श्रीगुरुपदैः सर्वत्रात्र प्रकाशिता । प्रस्थाप्य तीर्थयात्रायै स्वान्गृहीताऽप्रकाशिता ॥ ५ ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचित्सप्तशतीशुरुस्यरिनस्य श्री० अ० ५० पांडुरंगदृतसमनुवादे  
 सायंदेववरप्रदानं नाम चतुर्दशोऽध्यायः ॥ १४ ॥ दुल ओंवी ॥ १६६ ॥

१. हुमणां. २. एक जलतुं खाद. ३. सुंदर पादथी. ४. रोगमुक्ता.

५. निवृत्ति यतावी सर्वत्र ॥ श्रीगुरु थया शुभ अत्र ॥ मोक्ती शियो अन्यत्र ॥ तीर्थयात्राभिषे ए ॥ ५ ॥

## અધ્યાય ૨૫

સ. ગ.  
 ચ. સ. ૧. શિષ્યો પ્રત્યે શ્રીગુરુવર || કહે તીર્થો કૃતી સત્ત્વર || આવો સર્વ શ્રીશૈલ પર || બદ્ધકર કહે તેઓ || ૧ ||  
 ૧૧૫॥ ૨. આ ૧સંસ્તિહર પાદ || એજ સર્વ તીર્થાસ્પદ્ || ગુડુ કહે નિવિવાદ || જાઓ ખેદ છોડિને || ૨ ||  
 ૩. વાક્ય તા દશ સંભળીને || શિરસા વંધ એ માનીને || કહે જઈએ કથે સ્થાને || સુણી કાને એદે શુરુ || ૩ ||  
 ૪. સાત પુરી ધામ ચાર || જથેતિર્થિંગો વળી બાર || આચરતાં ઇણ અપાર || પાપ હુર નાસે સહુ || ૪ ||  
 ૫. એંકા રાહિ તીર્થો ક્ષૌર || કેવો કેનો સ્વાધિકાર || તેમ શ્રદ્ધાહિ પ્રકાર || કરતાં હુર ક્ષેમ ન || ૫ ||  
 ૬. જે ગ જી શાખ પ્રમાણુ || તીર્થો કૃતે આભપ્રમાણુ || તેટલું કુચ્છિઇણ માન || પૂર્વજ પણ સહુ તરે || ૬ ||  
 ૭. તીર્થો નિત્ય ત્રિખવણુ<sup>૩</sup> || સંગમસ્તાને પુષ્ય જાણુ || ટળતાં અરીષમ અતુ પૂણુ<sup>૪</sup> || તીર્થસ્થાન વટાળે || ૭ ||  
 ૮. સ્વધ ર્માત્ર આઠ માસ || ફરો, ઠરો ચાર માસ || નવા જળો નદીને ખાસ || દસ દિવસ અસપૃશ્યત્વ || ૮ ||  
 ૯. દેખ ન હીં તીરસ્થીને || દિન ત્રણુ મહાનદીને || અહોરાત્ર છદ્રૂપોને || એકમને કરો યાત્રા || ૯ ||  
 ૧૦. પાપ મો ચન થાએ જ્ઞાન || બહુધાનાન્ય વખે<sup>૫</sup> હું પણુ || શ્રીશૈલ પર મળીશ જાણુ || કરી નમન ગયા સહુ || ૧૦ ||

ઇતિ શ્રી ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્તેતશાયુદ્ધરિત્રય શ્રી. અ૦ પાંડુરંગકૃતસમતુવાદે  
 તીર્થયાત્રાનિરઘણું નામ પંચદરોડધ્યાય: || ૧૫ || કુલ એંદી || ૧૭૬ ||

## અધ્યાય ૨૬

એ મ હા તમા શિષ્યો મોકલી || રહ્યા કહો કચાં પુષ્યશાળી || એકાડી<sup>૬</sup> કરે શું વળી || સિદ્ધ ખળી કહે વિપ્ર || ૧ ||  
 ૧. સાથે જિ તાત્મા હું એક || વૈજનાથે હતા ગુરુનાયક || વિપ્ર આંધો ત્વારે એક || કહે હુઃખ ગુરુકૃત || ૨ ||  
 ૨. ગુડુ ત ને કહે ધિક્કાર || જા તું હુર અહીંથી ખર || ચેવો થહી ચરણુ સત્ત્વર || સેવા પ્રકાર કહે || ૩ ||

૧. સંસાર. ૨. સ્થાન. ૩. નિકાળસ્તાન. ૪. ધરો. ૫. એકલા.

१. गुरु सं तोषे योक्षे अति ॥ अहम् विष्णु शिवभूतिं ॥ साक्षात् अहम् शुद्धभूतिं ॥ कामनापूर्ति लक्ष्मीनी ॥ ४ ॥  
 २. सेवा ग हन लागे तने ॥ शुद्ध तारे निज शिष्यने ॥ पूर्ववृत्त कहुं तुझने ॥ सुख बन्युं जे द्वापरे ॥ ५ ॥  
 ३. ॥२३॥ धौम्य दो पज्जे शुद्ध अने ॥ त्रिष्णु शिष्यो हता मुने ॥ कठधृ सेवा कहे अमने ॥ न वेदने तत्पूर्वे ॥ ६ ॥  
 ४. विशे वा थं न कहेता ॥ हृच्छुद्धयर्थ सेवा लेता ॥ भाव एोणभी प्रसन्न थता ॥ एवी रीति शुद्धनी आ ॥ ७ ॥  
 ५. एक अ रुष्ट धौम्य शिष्य ॥ तेने कहे ऐतरे तोथे ॥ वाण करतां वाणे तोथे ॥ न यहे हाय ऐतरे ॥ ८ ॥  
 ६. भने ध्या य शुद्धपद ॥ जग वच्चे पडे सभेह ॥ ऐतरे यहे जग स्वद्धांह ॥ शुद्ध प्रसादे करे त्यारे ॥ ९ ॥  
 ७. अध्या त्म ज्ञानी ए थये ॥ धौम्ये अने घेर मोक्षये ॥ शुर्वज्ञाती ऐह रह्यो ॥ यतने ऐतर साचये ॥ १० ॥  
 ८. करी नि श्वेते लेगुं धान ॥ जर्ज शुद्धने कहुं कथन ॥ पाडो गाडुं एक लुर्ख ॥ आपी धान लाव कहे ॥ ११ ॥  
 ९. सुरी त्या लरी धान्ये गाडी ॥ लावतां वच्चे ४५ के पडी ॥ शुद्ध तत्क्षण आ०या होडी ॥ काढी थया प्रसन्न ॥ १२ ॥  
 १०. सर्वं वि धा आवडी अने ॥ एनेए घेर मोक्षीने ॥ शुद्ध कहे उपमन्युने ॥ तुं धेनुने चार वने ॥ १३ ॥  
 ११. नित्य नि यमे वने ढोर ॥ यरावी, भिक्षाने स्वोदर ॥ भरे जाणी भागे शुद्धवर ॥ भने अपेक्षु कर भिक्षा ॥ १४ ॥  
 १२. द्विरा कृत्ति५ भिक्षा करे ॥ अर्पे शिष्य एक ज धरे ॥ ए जाणी यीलुअे शुद्धवरे ॥ आज्ञापी घेर लाववा ॥ १५ ॥  
 १३. हुक्कि त अथी न थाय ॥ अन्ने भिक्षा लह लय ॥ पीअे वत्सेचिछाई६ पय ॥ शुद्धवाय वारे ए ॥ १६ ॥  
 १४. पीतां का ढी ७अक्कहुग्ध ॥ कूपे पड्यो थह अंध ॥ हेडी होडया शुद्ध हयाअध ॥ थह मुग्ध दहि आए ॥ १७ ॥  
 १५. सतडा माः८ इतन्तु तेहे ॥ एवुं कही मोक्षयो गेहें ॥ थये धन्य शिष्यसभूहे ॥ कीर्ति सनेहे संपादी ॥ १८ ॥  
 १६. जग हृद्ध शिष्य थये ॥ सतक्षडेंद्र नीचे पाज्यो ॥ शुद्धपामहिमा कह्यो ॥ कां वह्या, ज सेव शुद्ध ॥ १९ ॥  
 १७. एत हृदे अनुत्स ॥ थतां तारे शुद्धसमर्थ ॥ भिल्लवडी आ०या शुद्धनाथ ॥ भास चतुष्य रह्या त्यां ॥ २० ॥

१. विद्वान्. २. पाणी. ३. कृपा. ४. कादवमां. ५. ऐ वार. ६. वाघरडानुं एंकु हृद्ध ७. आकडो. ८. शुभेच्छाए. ९. घेर

संग.  
च.स.  
॥१६॥

धृति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीयुरुचित्रस्य श्री० अ० पांडुरंगकृतसमनुवाहे  
शिष्यत्रयाभ्यानं नाम षोडशोऽध्यायः ॥ ६ ॥ कुल एांवी ॥ २०० ॥

अ०  
१७  
१८

### अध्याय १७

ने च विं तथवष्टु जेवा ॥ लोगवे विषय इने तेवा ॥ एवा भूठ जनो तारवा ॥ कर्म आगवां करे गुरु ॥ १ ॥  
विष्म मु अ्यनो सुल एक ॥ डॉल्हापुरे हतो भूर्भु ॥ पशु कहे सबै क्लाइ ॥ निंदां हःभी करे ए ॥ २ ॥  
विर का र्त करे गमन ॥ भुवनेश्वरी प्रार्थ जाणु ॥ न थतां ए सुप्रसन्न ॥ लहुवा जूही करी अर्पे ॥ ३ ॥  
शिर सु भनार्पणमति ॥ जाणी देवीए शुरुप्रति ॥ भोक्लयो, आपे लहुवा यति ॥ करी सुमति गया गुरु ॥ ४ ॥

धृति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीयुरुचित्रस्य श्री० अ० पांडुरंगकृतसमनुवाहे  
छिन्नलहुवादानं नाम स्तोतशोऽध्यायः ॥ १७ ॥ कुल एांवी ॥ २००

### अध्याय १८

ए सुख ह क्षेत्र मांडे ॥ जयां कृष्णा पंचगंगा वडे ॥ द्वादशाष्टै श्रीगुरु रडे ॥ शुभे रडे हजुओ त्यां ॥ १ ॥  
एक हुः भी विग्रधरे ॥ शाकबिक्षा श्रीगुरु करे ॥ वालोगवेल तोडे करे ॥ हुःभ करे प्राह्णाणी ॥ २ ॥  
तद्वहःख करवा हरणु ॥ वेल नीचे आपे जाणु ॥ धनकुंभ शुरु करणु ॥ प्रगट न करे कहे ॥ ३ ॥

धृति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीयुरुचित्रस्य श्री० अ० पांडुरंगकृतसमनुवाहे  
धनकुंभप्रदानं नाम अष्टादशोऽध्यायः ॥ १८ ॥ कुल एांवी ॥ २०३ ॥

॥१७॥

१. शिरकमा. २. खार वरस.

## अध्याय २८

१६-  
२०

स.यु. ३८ सं न्यासी इपे जाणु ॥ लिक्षा भागे विधि उर पणु ॥ हिरण्यकशिपु दारणु ॥ करतां नभ तस थयां ॥ १ ॥  
 च.स. ॥१॥ ने॑ वि ज्ञे कगम्य छुरि ॥ औहुँभरे रहे नुहरि॒ ॥ शांत थतां तहुपरि ॥ वास करे श्रीसह ॥ २ ॥  
 हे भा र्ग कृष्णा नेने ॥ द्वीपस्थ योगिनी एने ॥ आये लिक्षा पूजने ॥ न जाणीने कहे विम ॥ ३ ॥  
 आ स्वच्छं ही आभे न जय ॥ लेई ए अही ए शु खाय ॥ एवुं कही रहेतां त्यांय ॥ लागे जय एमने ॥ ४ ॥  
 तत्र त्य नर गं गानुज ॥ लावे आव्यो त्यां शुदुराज ॥ देखाडीने ए अचरज ॥ अपै॑ निज प्रीतिवर ॥ ५ ॥  
 शुरु मू तिने नभी पूछे ॥ विस्थली॑ शुरु कहे ने छे ॥ जावा शुरु विचारे पछे ॥ योगिनीने खूचे ए ॥ ६ ॥  
 \* न गूढः केऽपि मे चेष्टा विहुरित्येष पादुके । विन्यस्याभ्वास्य ताः प्राप श्रीगुरुर्गाणगापुरम् ॥ ७ ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीशुरुचरित्रस्य श्री० अ० ५० ५० वासुदेवानं नाम एडेनविशेषाऽध्यायः ॥ १६ ॥ दुख एांवी ॥ २१० ॥

## अध्याय २०

सुखी प रम कथा नर ॥ कहे तिहां केषु वर ॥ पाभ्ये प्रभु कहे विस्तर ॥ सुख उत्तर कहे सिद्ध ॥ १ ॥  
 एक द शब्दं श्वी विप्र ॥ शिरोण आभे भृत पुत्र ॥ तद्वार्याने एक विप्र ॥ कहे उथ कमंविपाक ॥ २ ॥  
 हर्युं म हङ्गन विप्रतुं ते॑ ॥ थयो तेथी पिशाच ते ॥ एहे भायां त्वत्सुत पौते ॥ कमै॑ हाथे कर एतुं ॥ ३ ॥  
 ए द्रव्य तद्वेगात्रजने ॥ आपी भास भज शुरुने ॥ श्री कहे नथी सुज कने ॥ द्रव्य, शुरुने सेवीश हुं ॥ ४ ॥  
 अभ यं कर भानी भने ॥ सेवा करे भावे करीने ॥ स्वज्ञे लूत भारे झीने ॥ रक्षे एने शुरु त्यां ॥ ५ ॥  
 कहे तत् परिहार जेम ॥ जाग्रत थर्ज करे तेम ॥ मुक्ता थयो पिशाच अह्व ॥ प्रसाद क्षेम आपे शुरु ॥ ६ ॥

१. अनुबवत्तानगम्य. २. नरसिंह. ३. काशी, प्रयाग ने गया.

४. ( गूढ चेष्टा भाही न ॥ जाणी शके धारी जाणु ॥ आपी पादुका आश्वासन ॥ गाल्गापुर गया शुरु ॥ ७ ॥ ) ५ द्वितीया ॥ १८ ॥

संता न ऐ प्रसवे सती ॥ पुत्रदय सुंहर अति ॥ भोटा थतां प्रत दंपती ॥ आरंभे अति आनंदे ॥ ७ ॥  
 स.गु. श्रेष्ठ त नयनुं 'वत ॥ मारंभतां धनुर्वाट ॥ थईने ऐ अति डंपत ॥ सनियात थत्ने न शमे ॥ ८ ॥  
 च.स. ॥१६॥ एत द्वा वे द्वे नेत ॥ भरे थतां अर्धंश्रात ॥ भाता रडे भीटे गात्र ॥ बोधमात्र न सांभणे ॥ ९ ॥  
 अ. २०  
 २१ ॥ हिव स चढो अडधो तोआ ॥ भडहुं भाणवा न आपे ए ॥ अह्नाचारी स्पष्टवक्ता थाए ॥ प्रगट एकाएकत्यां ॥१०॥  
 २२

धति श्री० ५० ५० वासुदेवानंदसरस्वतीविरचितसप्तशतीयुग्मरित्रय श्री० अ० पांडुरंगकृतसमतुवाहे  
 पिशाचपरिहारो नाम विशेषज्ञायः ॥ २० ॥ कुल आंवी ॥ २२० ॥

### अध्याय २१

ऐडा य शुदुनाथ ॥ सती प्रत्ये कडे हित ॥ कौणु कैनो कडे सुत ॥ वह ज्ञात होय तो ॥ १ ॥  
 पृथग्यप्ते जे वाताकाश ॥ एज थया व्याकृत खास ॥ भायामय संबंध खास ॥ रडी ग्रास करे कां ॥ २ ॥  
 सत्य सू तु<sup>३</sup> जे आ तारो ॥ पूर्वोपर एनो खरो ॥ कडे पूर्वे ए कौणु तारो ॥ भाता स्त्री वा कौनी तुं ॥ ३ ॥  
 जे सू चेर्चा द्यास्ते करी ॥ जेम थाय हिन शवंरी<sup>३</sup> ॥ जन्मभरणु कर्मे करी ॥ थाय वणी सुखदुःख ॥ ४ ॥  
 कौर्ध न आ वारी शडे ॥ गुण्यमय न छटडे ॥ देवाहि ए न आ चूडे ॥ भृत शोडे जुवे ना ॥ ५ ॥  
 आप श अ भाणीए एने ॥ ए कडे अक्षय हे तेने ॥ आध आवे एना वाक्यने ॥ कौणु एने जेपधी ॥ ६ ॥  
 कडे शां त अह्नाचारी रे ॥ जर्ध पूछ आ औहुं भरे ॥ पेली शव भांधीने उद्दरे ॥ पाहुडा पर कूटे शिर ॥ ७ ॥  
 भोट को धनो सांभणे ना ॥ लोक गया घेर त्याना ॥ पति सह ए अंगना<sup>४</sup> ॥ रडे नाना आङ्कोशे ॥ ८ ॥  
 स्वप्ने न करीश तुदन ॥ आपे स्वामी आध्यासन ॥ जुआ जन्मत थातां जाणु ॥ सज्जवन थयो पुत्र ॥ ९ ॥  
 ॥१७॥

१. प्रतशंध, जनोर्ध. २. छोकरो. ३. रात्री. ४. खी.

સ. ગુ. ૧ જયાં 'ક્ષપા થઈ સુક્ષીણુ ॥ આંદ્રા વિપ્રો કંદ્રુ' એ શ્રવણુ ॥ સુણી નવલ આશ્રમભાગ ॥ થયા જન સર્વ એ ॥૧૦॥  
 ચ. સ. ૨ ધતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પતીશતીયુદ્ધાયિત્રસ્ય શ્રી૦ અ૦ પાંડુરંગફૃતસમનુવાદે  
 ૧૧૦॥ ૩ મૃતપુત્રસંજીવનં નામ એવિશોઽધ્યાય: ॥ ૨૧ ॥ કુલ એંતી ॥ ૨૩૦ ॥

અ.  
૨૨  
૩૩

### અધ્યાય ૨૨

ગુરુ વ સે ગાણુગાપુરે ॥ લીલા તિછાં શી શી કરે ॥ વિપ્રે પૂછતાં કહે આહરે ॥ સિદ્ધ તારે સુણતાં એ ॥ ૧ ॥  
 હું તો ક: પદાથ' તત્ ॥ ગાવા મુખે સર્વ ચરિત ॥ થયા અદ્ધાદિએ કુંદિત ॥ કહું સંક્ષિપ્ત સંબળ ॥ ૨ ॥  
 અમે ય ઝીતિ ગુરુ આંદ્રા ॥ લીમાઅમરન સંગમે રહ્યા ॥ ગાણુગાપુરે પ્રસિદ્ધ થયા ॥ બિરાન્યા એ અર્થવત્થે ॥ ૩ ॥  
 રે ય દ્ર તિ ગૃહ પાવન કરે ॥ નય એ કદાચિત् વિપ્રધરે ॥ દેખી વંધ્યા મહિષી દ્વારે ॥ બોલે પ્રાણીએ કીને એ ॥ ૪ ॥  
 સુસત્તા તું આપ ક્ષીર ॥ સતી બોલે વચન ધીર ॥ વંધ્યા દ્વારે ન એ લગીર ॥ ગુરુ શેઠ કાઠ કહે ॥ ૫ ॥  
 વચ ન માની દોહે સત્તવર ॥ દોહી કાઠથું એ ઘડા ક્ષીર ॥ ગુરુ પીઈને આપે વર ॥ દારિદ્રય ફર થાએ । કહે ॥ ૬ ॥

ધતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પતીશતીયુદ્ધાયિત્રસ્ય શ્રી૦ અ૦ પાંડુરંગફૃતસમનુવાદે  
 વંધ્યામહિષિદોહનં નામ દાવિશોઽધ્યાય: ॥ ૨૨ ॥ કુલ એંતી ॥ ૨૩૧ ॥

### અધ્યાય ૨૩

સુણી નિ જ દૂતોથી ભૂપ ॥ આવી પૂછે સત્ય વા ગપ ॥ સુણી ગુરુમહિમા વિદ્ધ્ય<sup>૪</sup> ॥ આવી પ્રાર્થે સસૈન્ય ॥ ૧ ॥  
 કહે વ સ્તીમાં આવી તાત ॥ ઉદ્ધાર અમને હે હૈવત ॥ હકાર ભણે ગુરુનાથ ॥ પાલખી તૂર્ત આણે નૃપ ॥ ૨ ॥

૧૨૦॥

૧. રાની. ૨. હે તાત ! ૩. ન મારી શકાય એની. ૪. ગર્વરહિત.

स.गु न न व र्तं ते प्रभुधियः परतंत्रास्तथापि हि । भक्तिप्रियो भक्तिगम्यो भक्ताधीन त्वमेत्यजः' ॥ ३ ॥  
 च.स. भू पे ते मने अत्याहरे ॥ पादभीमां आएयां नगरे ॥ अर्थत्ये आवतां नजरे ॥ अल्लराक्षस देखे ए ॥ ४ ॥  
 ॥२२॥ वहे त त्यह राक्षस ॥ गुरु कडे रे नृशंस ॥ संगमे न्हातां बेगे आस ॥ मुक्तामास थर्थि तु ॥ ५ ॥  
 ए त द्वा मे शीघ्र पहेंचये ॥ आमे गुरुने मठ आय्ये ॥ सांभणी गुरुनी लीला कोय्ये ॥ यद्यो निंदाए थति एका ॥ ६ ॥

अ.  
२४  
२५

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीगुरुयरित्रस्य श्री० अ० ५० पांडुरंगदृतसमनुवादे  
 अल्लराक्षसोद्धरणं नाम नयेविशेषध्यायः ॥ २३ ॥ कुल एंवी ॥ २४२ ॥

### अध्याय २४

ऐ कु म सीथामे करे वस्ती ॥ सैसैन्य आवे गुरुभूर्ति ॥ ध्याने देखे त्रिविक्षम थति ॥ नहीतीरे आवे देव ॥ १ ॥  
 तिहां प गे देइयो थति ॥ देख्युं कौन्य गुरुभूर्ति ॥ हतगवं थये सुमति ॥ देखाडे विश्वदृप गुरु ॥ २ ॥  
 ऐ कु र लेडी प्राय॑ थति ॥ श्रीगुरु आपे एने गति ॥ आवे सौन्य श्रीपति ॥ गाणुगापुरे पश्चात् ॥ ३ ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीगुरुयरित्रस्य श्री० अ० ५० पांडुरंगसमनुवादे  
 विश्वदृपदर्शनं नाम यतुविशेषध्यायः ॥ २४ ॥ कुल एंवी ॥ २४५ ॥

### अध्याय २५

चार मं दधी अर्क्षण ॥ भवेच्छ शाज आगण जाण ॥ करी सार्थ वेदपठन ॥ लेता धन उनमता ए ॥ १ ॥  
 कडे म होन्मत्त विप्र ॥ नृपते आज्ञा आपो क्षिप्र ॥ वाहे जुतीये सर्व विप्र ॥ हारपत्र लध्ये वा ॥ २ ॥

॥२२॥

१. प्रभुभूष्मि न परतंत्र ॥ तथापिन वर्तं स्वतंत्र ॥ लक्षितगम्य लक्षितमित्र ॥ लक्षिताधीन सर्वदा ॥ १ ॥ २. दुष्ट.

२३७ म हानहेआपतां ॥ आज्ञा पालभीमां डोलता ॥ विप्रो राज्ञ कहेवडाचता ॥ भूमि लुतता आवेत्यां ॥ ३ ॥  
 स गु अे कु म सीमां शीघ्रगति ॥ जिहां त्रिविकमभारती ॥ आव्या जाणी त्रिवेदी यति ॥ कहे कुभति वाद कर ॥ ४ ॥  
 च.स. २४  
 ॥२२॥  
 २५  
 हेय मे त्र द्विज ज्यारे ॥ करे शु ए आतुं त्यारे ॥ कुखुदि आ विष छारे ॥ एतुं अत्यारे कुं हुं ॥ ५ ॥  
 २६  
 गुरु वां छा पूरी करशे ॥ एतुं कही यति असे ॥ लावी एमने गुरु पासे ॥ कहे सकण त्रिविकम ॥ ६ ॥  
 २७  
 वाही शो धता आव्या अल । माइं न सांझो हे गाण । आएया तेथी अहों तत्काल । एमने कृष्ण शिक्षा धरो ॥ ७ ॥  
 २८  
 गुरु जी कहे, शो एमने ॥ ज्य पराज्य अमने ॥ अमारी साथे वाह शाने ॥ व्यथै मरण वरो कां ॥ ८ ॥  
 २९  
 विप्र व चन ओवे रीसे ॥ विधा केटली तमारी पासे ॥ ए सांझणी श्रीगुरु हुसे ॥ गर्व जशे कहे आ ॥ ९ ॥  
 ३०  
 गवे लो क केटला पडया ॥ आयु रावण अते रडया ॥ कौरवाहि काणे झूडया ॥ आरंभुं आ शु तमे ॥ १० ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसप्तशतीगुरुयरित्यस्य श्री० ५० ५० पांडुरंगकृतसमनुवादे  
 भत्तविप्रभोधनं नाम पञ्चविंशाऽध्यायः ॥ २५ ॥ कुल एांनी ॥ २५५ ॥

### अध्याय २५

वेद के वण पठन भाव ॥ करतां ऋषि क्षीण्यगात्र ॥ अद्यायु ज्यां कलि तत्र ॥ वेद चित्र कौणु जाणु ॥ १ ॥  
 चिरं जी व भरद्वाज ॥ पूछे अद्वाने वेद काज ॥ त्रणु राशि<sup>१</sup> हेखाडे अज<sup>२</sup> ॥ ऋषि लाजे ए हेखी ॥ २ ॥  
 विधि<sup>३</sup> वदे देव मुष्ठि त्रष्ण ॥ हलुओ न जाणु ए पूर्ण ॥ एम वेद अनंत जाणु ॥ विभाग करीने राख्या ए ॥ ३ ॥  
 विष्णु भू तणे व्यासद्वे ॥ चार शिष्योने चार आपे ॥ वेद शाखा विभाग द्वे ॥ पैलने आपे नङ्गवेद ॥ ४ ॥  
 शुद्धां तः करणु हे पैल ॥ सुणु नङ्गवेद कहुं विभल ॥ न्धरत्निमात्र द्वे अमल ॥ व्यक्तागत हीर्घदृष्टि ॥ ५ ॥

स.गु रवि स मान कांति एनी ॥ अनि गोत्र देवता जेनी ॥ अह्मा गायत्री छंद वर्णी ॥ आयुर्वेद उपवेद ॥ ६ ॥  
 च.स. शाखा ना भे लेद पांच ज ॥ छ अंग प्राहसु सहज ॥ अरण्य सह ए वेद ज ॥ पैतने ज व्यास कहे ॥ ७ ॥  
 ॥२३॥ शिष्य त रघु<sup>१</sup> जेवो आन ॥ थीजे नामे वैशंपायन ॥ एने यजुर्वेद थीजे जाण्यु ॥ करे कथन विभागीने ॥ ८ ॥  
 सुम नः प्रीते जे यज्ञन ॥ करे पंचारत्नी मान ॥ भरद्वाज गोत्र जाण्यु ॥ कृशपाणु त्रिष्टुप् छंद ॥ ९ ॥  
 हैव म हाविष्यु जेना ॥ उपवेद धनुर तेना ॥ सूर्योर्क<sup>२</sup> जे लेद तेना ॥ जाण्यु एना छाशी ज ॥ १० ॥  
 सुम नः प्रीति आपे स्तवने ॥ सामवेद अक्षिधाने ॥ घडरत्नी भित भाने ॥ जैमिनि आप्यो ए ॥ ११ ॥  
 विशे व ए शांत दांत ॥ दीसे चर्म दंडहस्त ॥ गोत्र काश्यप हैवत ॥ रुद्र ध्यात जगती छंद ॥ १२ ॥  
 जे ए घारक्त दीसे ॥ लेह एमां अभित वसे ॥ उपवेद गंधर्व बासे ॥ व्यास रसे कहे एहुं ॥ १३ ॥  
 अव नी मांडे गणु कौण्यु ॥ लेद एहना संपूर्णु ॥ सांगोपांग वदतां वाण्यु ॥ कुंठित जाणु शेषनीये ॥ १४ ॥  
 अतीन्द्रि य जाता व्यास ॥ कहे सुखु सुमंतु आस ॥ कहु अथवं वेद आस ॥ छे हैवेश हैव एनो ॥ १५ ॥  
 एथ या चार वेद ॥ अख चोथानो उपवेद ॥ गोत्र ऐजन छंद स्वच्छंद ॥ नव लेद कदप पांच ॥ १६ ॥  
 जमणि कौर्ध चारे पूर्णु<sup>३</sup> ॥ न जाणु आटला संपूर्णु ॥ एक शाखाए अपूर्णु ॥ तमे सवंज एकला ॥ १७ ॥  
 जे वि प्र धर्माचारयुत ॥ विष्यु भाने एमने हैवत ॥ वेदभणे हस्तागत ॥ हैवादि थात एमने ॥ १८ ॥  
 जे स्व कृ त्य त्यज्ञने जाण्यु ॥ चैत्रेय पासे वेद पठन ॥ करी वाहे जुते अ ह्यशु ॥ थायै तूष्णु<sup>४</sup> अह्मानक्षस ॥ १९ ॥  
 श्रीप ति शुदु आवुं कहे ॥ तोअे उन्मत्त वाह चहे ॥ ज्यपत्र वा आपो कहे ॥ नहि तो न हे प्रतिष्ठा ॥ २० ॥

धाति श्री० ५० ५० वासुदेवानं हसरस्वतीविरचितस्पतशतीयुस्यरित्यश्य श्री० अ० ५० पांडुरंगकृतसमनुवादे  
 चतुर्वेदकथनं नाम प॒श्विंशोऽध्यायः ॥ २५ ॥ कुल एंवी ॥ २५ ॥

१. सर्व. २. सर्व जेवा कांतिभान् ३. विदानोभां श्रेष्ठ. ४. सत्वर.

२५  
२६

॥१३॥

ମୁଦ୍ୟାୟ ୨୭

સં.ય.  
 ચ સ.  
 ॥૨૪॥ હું આ સ્થા કરું વાદે પૂર્ણું ॥ એમ કહેતાં શ્રીગુરુ જાણુ ॥ આવે દ્વારથી ભંગી તુણું ॥ શિષ્યજનને લાવો કહે ॥ ૧ ॥  
 આએયે ॥ તિ જ સંનિધ એને ॥ ગુરુ સાત લીટી કાઢીને ॥ કહે એ ઉપર થઈને ॥ એણંગીને આવ રે ॥ ૨ ॥  
 એ એ ક એક લાંઘે જેમ ॥ કહે સૃપત જન્મ વાર્તા તેમ ॥ અંતે વિદ્વાદ્વિજ હું એમ ॥ કહેતાં પેરે વાદે ગુરુ ॥ ૩ ॥  
 સામ ર્ં એ આંગણ થતાં ॥ આવી વિપ્રોને એ મૂઠતા ॥ દ્વારથાપદ રાક્ષસતા ॥ મળી મુક્તતા એ પછી ॥ ૪ ॥  
 હર્ગ તિ થઈ ઉન્મતોની ॥ બલિહારી ગુરુકૃપાની ॥ ટળી હીનતા ભંગીની ॥ કરે વિનંતિ ગુરુને એ ॥ ૫ ॥  
 સદ્ગ શ જ હું દ્વિજ પૂર્ણ ॥ છતાં થયો શે જાતિહિન ॥ સબિસ્તર કરો કથન ॥ કર અવણુ કહે ગુરુ ॥ ૬ ॥  
 ધતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુહેવાન દ્વસરસ્વતીવિરચિતસ્પેતશતીગુરુચરિત્રસ્ય શ્રી૦ ૫૦ પાંડુરંગકૃતસમતુવાદે  
 દ્વિજર્ગવ્યપરિહારો નામ સતેવિશેડધ્યાય: ॥ ૨૭ ॥ કુલ એંવી ॥ ૨૮૧ ॥

અધ્યાય ૨૮

ਜੇ ਕ ਰੀ ਸਾਡਮੈਂ ਛੂਰੁ ॥ ਦੇਵ ਗੁਰੂ ਮਾਖਾਪ ਛੂਰੁ ॥ ਨਿਹੌਥ ਤਖੇ ਲੀਕੁਮਰੁ ॥ ਚੋਵ ਅਸਤਿਵਾਹੀ ਜੇ ॥ ੧ ॥  
 ਜੇ ਨਿ ਰੰ ਤਰ ਅਥੁਛੁ ॥ ਸ਼ਿਵਵਿ਷ਣੁਮਾਂ ਮਾਨੇ ਲੇਹੁ ॥ ਛੋਥ ਪਾਖਾਂਡੀ ਹੁਵਾਹੁ ॥ ਪਾਂਛਿਲੇਹੁ ਕਰੇ ਘਣੁ ॥ ੨ ॥  
 ਮਾਰੇ ਯ ਤਨੇ ਲਿਵੋਨੇ ਛੂਰੁ ॥ ਆਗੇ ਬਨ ਆਮ ਘੂਰੁ ॥ ਬੇਚੇ ਫਨਿਆ ਗੋਰਚ ਅੰਤੁ ॥ ਕਾਢੇ ਵਿਸ ਅਤਿਥਿਨੇ ॥ ੩ ॥  
 ਜੇ ਨਿ ਦ ਕ ਕਹਿ ਸ਼ਾਖਨੇ ॥ ਨ ਕਰੇ ਘਗਾਡੇ ਛੂਪਨੇ ॥ ਤੋਝੇ ਮਾਗ੍ਸਥ ਵੁਕੋਨੇ ॥ ਤਖ਼ਲੁ ਪਰਨੇ ਜਮੇ ਜੇ ॥ ੪ ॥  
 ਜੇ ਰਿਹੁ ਜਾ ਪਰੰ ਵਾ ਲੀਨੇ ॥ ਲੋਗਵੇ ਰਮੇ ਪਰਖੀਜਨੇ ॥ ਕਦੇ ਵਿਖਾਸਦਾਤਨੇ ॥ ਦਤਾਵਾਨੇ ਕੇ ਪਾਂਛੁ ॥ ੫ ॥  
 ਜੇ ਸਵ ਪ੍ਰਸੋ ਪਮ ਸੁਆਥੁ ॥ ਮਾਰਣੁਛਿ ਕਰੇ ਬਧਥੁ ॥ ਪਰਖੀਡਕ ਕਰੇ ਅਨਥੁ ॥ ਨਾਡੀ ਨ ਜਾਣ੍ਹੀ ਵੈਹੁੰ ਕਰੇ ॥ ੬ ॥  
 ਏ ਪ ਤਿ ਤ ਥਾਧ ਭਾਂਗੀ ॥ ਜੇ ਛੋਥ ਵੁਖਲੀਸਾਂਗੀ ॥ ਝੇਰੇ ਸਨਾਨਸਾਂਧਾ ਤਾਗੀ ॥ ਪਾਂਚਧਾਗ ਤਖ਼ਲੁ ਜਮੇ ॥ ੭ ॥  
 ਜੇ ਛੋ ਯ ਵੁਤਿੁੰ ਰਤਨਹੁਰੀ ॥ ਝੁਧਪਤਿਥਹੀ ਹੁਕੋਇਤਾ ॥ ਮਧ ਪੀਤਾਂ ਆਵੇ ਛੀਨਤਾ ॥ ਅਨੁਤਪਤਨੇ ਅਵਧ ਦੋਧੁ ॥ ੮ ॥

१. संकेत. २. दिवसे ३. आशुविका.

સ. ગુ. ૨૪. જે લુ જા જીને વિપ્રોને ॥ હું તું કરે પિતૃગુરુને ॥ એ થાય અક્ષરાક્ષરસ જને ॥ નિમંત્રાશીને બાયસત્વ ॥ ૮ ॥  
ચ. સ. ૨૫. એ તે પ્રયુહરે જનમ લે ॥ ચોરીને ને ઇળપત્ર લે ॥ જે ધન ચોરીને લે ॥ જનમ લે એ જાંટનો ॥ ૧૦ ॥  
॥ ૨૫ ॥ એ ઉ લક્ષ નિત પછી થાય ॥ પ્રથમ ઘોર નરક ધાય ॥ એ થોનિમાં પછી જાય ॥ દંસકર બગડો થઈ ॥ ૧૧ ॥

માખી મ ધુહર, ઉદર ॥ ધાન્યહર, જળહર ॥ ચાતક, પણ તૃણહર ॥ સ્વધુહર કુમિકીટ ॥ ૧૨ ॥  
હુગં તી લોગવી ક્ષીણુ ॥ થતાં પાપપુણ્ય સમાન ॥ અંધપંગચાદધચિહ્ન જાણ ॥ લઈને ઇરી જનમ અહીં ॥ ૧૩ ॥  
કુમિ શ્વ અર જારકમે ॥ થાય ખી પુરુષ ફુષ્કમે ॥ જે વર્તો સદા સત્કર્મે ॥ સ્વધર્મે તરે એ ॥ ૧૪ ॥  
ને પ ર: સ્પર હોય દંપતી ॥ અન્યોન્યહોએ પાસે કુગતિ ॥ પૂછે ત્રિવિક્રમ નિષ્કૃતિ ॥ યંત્રપતિ કહે એને ॥ ૧૫ ॥  
વિપ્ર ગૃ હૃતથ્યશુદ્ધ ॥ શરણે થાએ પાપખંડ ॥ થતાં પાપ અતિ ઉદંડ ॥ મુંડપૂર્વક કહું કૃદ્ધ ॥ ૧૬ ॥  
શક્તિ હીને આપવું ગોધન ॥ જય યાત્રા હોમ યજન ॥ શક્તો કરવું ચાંદ્રાયણ ॥ ગંયપ્રાશન અનુતાપે ॥ ૧૭ ॥  
સ્વાતમ ત્વ ખ્યાંયુક્ત ॥ શુરુ વારે સર્વ દુરિત ॥ પિતૃત્યાગે થાય પતિત ॥ થાય પૂત્ર માસસ્તનાને ॥ ૧૮ ॥  
ભાંગી તા દંક કરી શ્રવણ ॥ કહે થયો હું પાતન ॥ દો વિપ્રોમાં ગણી સમાન ॥ કરે કથન સુણી ગુરુ ॥ ૧૯ ॥  
નૃપ નિ યમે વિશ્વામિત્ર ॥ સાયાસે થયો એ પવિત્ર ॥ તું તો હીન વેદાપાત્ર ॥ વિપ્ર પરજ થા સુખે ॥ ૨૦ ॥  
આવી સં નિધહેખી સ્વીને ॥ કાઢે સ્પર્શભયે મારીને ॥ શુરુ કહે મા ત્યજ ખીને ॥ કહે એ હીન થાઉં શું ॥ ૨૧ ॥  
એ ગ યા થતિ મને ચેતી ॥ ધોવડાવે તદંગભૂતિ ॥ ગયું જાન એ પામ્યો ભાંતિ ॥ સસીક ગયો ઘેર ॥ ૨૨ ॥  
પ્રણ તિ કરે ત્રિવિક્રમ ॥ કહે નિવારો મારા ભ્રમ ॥ અંગ ધોતાં જાન ઉત્તમ ॥ જઈને ભ્રમ થયો શાથી ॥ ૨૩ ॥

ધતિ શ્રી ૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પતથતીયુદ્ધરિત્રયસ્ય શ્રી ૦ અ૦ ૫૦ પાંડુરંગકૃતસમનુવાહે  
કર્મવિપાકથન નામ અષ્ટાવિંશોડાયાઃ ॥ ૨૮ ॥ કુલ ઓંતી ॥ ૩૦૪ ॥

૧. સામું બોલે. ૨. કાગડાપણું. ૩. વાંદરાને પેટે. ૪. મુંડન. ૫. પવિત્ર. ૬. અમે. ૭. વેદને અપાત્ર.

૨૪.

૨૮

૧૨૫॥

## अर्धयात्र रह

स.गु.  
य.स.  
॥२३॥ सुखी वा हथस्त प्रक्ष ॥ गुरु कहे भस्मै ज्ञान ॥ आपेहुं ते धोतां जल्लु ॥ जर्द अज्ञानी थयो ए ॥ १ ॥  
पूर्व यु गे वामदेव ॥ कौंचवने रहे सुहैव ॥ लेई ओने होडे सज्व ॥ हुर्भाव ए राक्षस ॥ २ ॥  
ए हु र्गं धी ज्यारे दानव ॥ धसे लक्ष्मा वामदेव ॥ भस्म स्पर्शां हुर्भाव ॥ त्यजु भव पूर्व स्मरे ॥ ३ ॥  
तृदक्षु धा शांत थयां एनां ॥ स्मरे परीस जन्म पूर्वना ॥ कहे कुकम' ए पेतानां ॥ हुर्ज्य हुं नुपुकुले ॥ ४ ॥  
लोगुं नि त्य पकडी खीओ ॥ राज्यमहे भत्त बन्यो ॥ चारे वर्णनीमे खीओ ॥ वेश्याओ असंभ्यात ॥ ५ ॥  
अवि वा हितओ बोगी ॥ रजस्वलाए न त्यागी ॥ पछी हैव थयो रोगी ॥ शनु वेगे हुरे राज्य ॥ ६ ॥  
हुरा श ये पापे झीधां ॥ खीओये बहु शाप हीधा ॥ क्षये क्षीणु थया सांधा ॥ आ०या हादा यमहृत ॥ ७ ॥  
अप यात् क्षय आयुषः<sup>१</sup> ॥ ए समजायुं निर्देष ॥ भरतां हुं यमपुरुष ॥ लर्द लय होष धावा ॥ ८ ॥  
भूये श्रो त्रने ए यातना ॥ पितृ सह जे बोगवी नाना ॥ अंगे शिक्ष थयां धयां ॥ आवी मुने प्रेतगति ॥ ९ ॥  
ए गा त्रये छोडीने ॥ चावीस योनि बोगवीने ॥ अद्वाराक्षस थर्ने ॥ रहुं वने सदा भूझ्यो ॥ १० ॥  
आ प छ विश्वितमे जन्मे ॥ हाथी आतांये भूख हमे ॥ स्पर्शमाने आपनाशमे ॥ साक्षात् तमे हेव भासे ॥ ११ ॥  
गयां लु तिपासाहि कैम ॥ एनो हेतु कहे ॥ प्रथम ॥ वामदेव कहे परम ॥ भस्मस्पर्शे गर्द आधि ॥ १२ ॥  
भस्म स्पर्शे एक जल्लु ॥ द्राविड जर आहाल्लु ॥ त्यन्ये शूद्र भारी वन ॥ आवे ज्वान आवा त्यां ॥ १३ ॥  
श्वस्पर्श थी तदंगस्य ॥ भस्म लागी थयो भूत ॥ लर्द जतां यमहृत ॥ शिवहृत छोडवे ॥ १४ ॥  
ए सा नं हे लर्द उदाम ॥ जतां कैलासे होउयो यम ॥ उपदेशी विप्रने धर्म ॥ शिवधाम गया द्रूत ॥ १५ ॥  
शंखु च चैं जल्ली भहिमा ॥ हु ए करु भस्मतनमां ॥ स्पर्शुं किचित् तरा भहेमां ॥ तन्महिमाथी ज्ञान आ ॥ १६ ॥  
कहे र क्षरू राज्य हीपवा ॥ निर्जन पंथे झीधा कूवा ॥ आप्युं विप्रोने साधन आवा ॥ इण<sup>३</sup> हावां भज्युं तेनुं ॥ १७ ॥  
कहे स विस्तर भने ॥ भस्मधारणु विधि मुने ॥ वामदेव कहे शंखुने ॥ कर्यो प्रश्न कुमारे आ ॥ १८ ॥

१. आयुषो अक्षरमात् क्षय थरे. २. राक्षस ३. हमणां.

स.गु १५ पछी नं ही गौरी युक्ता ॥ शिव ऐसे देवो सहित ॥ सनत्कुमार वंहन करत ॥ छेडे वात आ तिहां ॥१६॥  
 च.स. १६ हे व्या ग्रा जिनवास तात ॥ चतुर्विध पुमर्थ प्राप्त ॥ थाय शीघ्र एवुं आप्त ॥ साधन स्वदृप कडे कंध ॥२०॥  
 ॥२७॥ १७ श्रव ण करै कडे धर्श ॥ भस्मधारणे थयो आस ॥ चतुर्विध पुमर्थै हास ॥ विना त्रास साधे ए ॥२१॥  
 न ग मे डोने आवुं साधन ॥ गो मधे अभिष्ठोत्रथी जाणु ॥ भस्म लहु करै धारणु ॥ भूसमान त्रिपुरे शुं ॥२२॥  
 छे न व हेवाहिक ॥ एक एक पुरु देख ॥ भद्यांगुष्ठ अनाभिक ॥ काढो रेखा शीर्षादि ए ॥२३॥  
 भस्म च चय्ये शमे पाप ॥ कडे वामहेव निष्पाप ॥ भारे भस्मधारणु छाप ॥ राक्षस पाप थयो मुक्त ॥२४॥  
 एवुं अ ति रसाण ॥ सुणी थया हुष्ट सकण ॥ गथा त्रिविक्तम विमण ॥ कथा आगण कहुं सुणो ॥२५॥  
 धति श्र० ५० ५० वासुदेवानं दस्तीत्वविरचित्सप्तशतीयुत्यरित्रस्य श्र० ५० पांडुरंगसमन्तुवादे  
 भस्मभिमावर्णन नाम एडोनत्रिशोऽध्याय ॥ २६ ॥ कुल एंवी ॥ ३२६ ॥

अ४.  
१८-  
३०

## अध्याय ३०

दता धि प्रित माहुर ॥ त्यां एक गोपीनाथ विप्र ॥ एने धधने भरे पुत्र ॥ दतवर ज्ञवाडे एक ॥ १ ॥  
 ए नि छा दता उपर ॥ राखीने करे संस्कार ॥ एनो विवाह कर्यो घेर ॥ हें साहर भाखापे ॥ २ ॥  
 अंने य इपे समान ॥ शेले जेडु देव समान ॥ कटिये पतिसेवा विषु ॥ सती क्षणु न काढे ॥ ३ ॥  
 वधू म हा पतिवता ॥ छपं थाय एने जेतां ॥ त्यां तो आवी हुई वता ॥ रोगे सूतां हा सुत ॥ ४ ॥  
 नूत न क्षय रोगे पति ॥ क्षीणु थया अंगे अति ॥ जमे ना ए तेवी सती ॥ रोगप्राप्ति न थतांचे ॥ ५ ॥  
 ए ५ श्वा ताप करे पति ॥ कडे व्यथै वरी सुहती<sup>२</sup> ॥ कुटयुं कडे प्रारण्य सती ॥ शीघ्रगति पियेर ज ॥ ६ ॥  
 ए अ यं कर वाणी सुणी ॥ कडे हुं अर्धांगी आपनी ॥ हेह तमारो त्यां तम ताणी ॥ रहेशे रमणी निश्चये ॥ ७ ॥

॥२७॥

१. पुरुषैर् २. सुन्दर दांतवाणी.

थाय कि बोग न मने ॥ धारी श्वश्रवाहि प्रार्थीने ॥ डोणीमां नांगीने पतिने ॥ गाणुगालुबने आवी ए ॥ ८ ॥  
 स.गु. त्रिहो प वधी भार्ग जाणु ॥ थयो दिन ए गतप्राणु ॥ सती उठे त्यजवा प्राणु ॥ निवारणु करे जन ॥ ९ ॥  
 च.स. ए ३ ल या स्मरे पतिगुण ॥ रडे शीर्पं पछाडी जाणु ॥ कडे रुहचो गौरीरमण ॥ औलाभ्युहरणु को करे ॥ १० ॥  
 ॥२८॥ नयां धे नु जय शरणु ॥ त्यां यवन राखी हरे प्राणु ॥ देवदर्शने जतां जाणु ॥ मंहिर चूर्णु करे पडी ॥ ११ ॥  
 तहु पम<sup>३</sup> थयु आजे मने ॥ प्रखो शरणु जतां तने ॥ लाज न राखे तुं हणु ॥ प्रखो तने नावे दया ॥ १२ ॥  
 अव से तु विलाप सुखी ॥ आवो होडी जगनो धखी ॥ दीनानाथ गुरुभिंषु ॥ दृपद्वनि वहली ए ॥ १३ ॥  
 एने व हे कां रडे लाडी ॥ लव आवे शुं पाछो रडी ॥ भायामय संबंध कडी ॥ अमे पडी व्यर्थ तुं ॥ १४ ॥  
 देव तेए कालाधीन ॥ तमे भर्ती किप्रभाणु ॥ जेवा जतां विचारी जाणु ॥ भर्ती कौणु कौणु जन्मये ॥ १५ ॥  
 देह उ त्यज थर्जाणु ॥ भरे, अथी ए विलक्षणु ॥ आत्मा नित्य विकारहीन ॥ संबंधी न कोई ने ए ॥ १६ ॥  
 रे ६ त्वा नित शी व्यापकने ॥ वार्ता न संबंधनी एने ॥ नहीकाष्ठवत् ए हेहने ॥ कर्म करीने संबंध ॥ १७ ॥  
 आ अ मे गल हेहना जाणु ॥ तादात्मे कर्मभ्रम भान ॥ गुणमूल जाणु अज्ञान ॥ अनु परिणाम ए ॥ १८ ॥  
 तुं अ तं द्रित थर्ज सती ॥ त्यज संबंध आ सुभति ॥ जेथी थाय उद्धारगति ॥ वेगे अति साध जे तुं ॥ १९ ॥  
 रक्ता स्थि भांसने कां रडे ॥ ए सांखणी ए पगे पडे ॥ कडे पिता शोडे तड़इडे ॥ मन काडे कौणु वहार ॥ २० ॥

धति श्री० ५० ५० वासुहेवानं दसरस्वतीविरचितस्पतशतीभुग्यरित्रस्य श्री० अ० ५० पांडुरंगदृतसमनुवादे  
 प्रेतांगनांशोडो नाम विशेषाध्यायः ॥ ३० ॥ दुल आंवी ॥ ३४० ॥

### अध्याय ३१

कडे तं द्रा छोडी सुख सती ॥ वधे विध्य व्यापी गजन्ति४ ॥ गया हेवा सत्वरगति ॥ काशी प्रति तहु गुरु पासे ॥ १ ॥  
 ॥२९॥

१. सासू वगेरे. २. ल्ली. तेना गवे. ४. सर्व.

अ५  
३०  
३१

स्तवे १५५ पति अगस्त्यने काढ़े लोपासुद्राक्षाधीने ॥ त्वत्सम नान्य पतिव्रताने ॥ देखी नयने धन्य तु ॥ २ ॥  
 अ. ३५  
 च. कहा पि न स्वतंत्रता ॥ पतिसेवननिरता ॥ छायासम पतिहेवता ॥ पतिव्रता ए पतिचिता ॥ ३ ॥  
 स. ३६  
 ॥२८॥ ४८ मे भु जन उर्धे पति ॥ पतिपूर्वे स्नान करती ॥ पहेलां जीठी पधी सूती ॥ न ऐसती पतिरक्षामे ॥ ४ ॥  
 ३७  
 के न जा य धर बहार ॥ करे पत्युचिद्धाहार ॥ पतिवयने के साहर ॥ निरंतर अनुदृश ॥ ५ ॥  
 ३८  
 के आ न हे देवताभे ॥ वस्त्राभूषणे न शोले ॥ धर्म त्यजे न हेहेले ॥ एवी शोले निरधर्मे ॥ ६ ॥  
 ३९  
 काढे वा र्ता न श्रीमंतनी ॥ मर्यादा राखे वडीलोनी ॥ स्वातं गे व्रतपूर्तिनी ॥ हठ भने न धरे ॥ ७ ॥  
 ४०  
 है गु रे सर्व पति ॥ मानी वाह न करे सती ॥ के पति साथे लडे अति ॥ शियाण थर्द भूंके ए ॥ ८ ॥  
 ४१  
 के हा णा पतिथी छाना ॥ देचे, आय पति विना ॥ लटके वागेण थर्द नाना ॥ आय निर्ज भजभूत ॥ ९ ॥  
 ४२  
 धर्म निव त स्त्री रहेतां ॥ हैवे पति भरी जतां ॥ साथे जय पतिव्रता ॥ न वियुक्ता छायासम ॥ १० ॥  
 ४३  
 धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसंप्रतीतिशीघ्रस्य श्री० अ० पाठूरं गृहतसमनुवादे  
 पतिव्रताधर्मनिरूपणं नाम एकविशेषाध्यायः ॥ ३१ ॥ कुल ओंनी ॥ ३५६ ॥

## अध्याय ३२

पर तं त्र न रहेवुं ॥ पति साथे सतीए जवुं ॥ पहे पहे 'मेघदण लेवुं ॥ स्थान लेवुं' पतिव्रताके ॥ १ ॥  
 १. ४४ पाणे वि धवा यहि धर्म ॥ तोए थाय एथी 'शर्म' ॥ हेय बाणा करे सुकर्म ॥ अद्वयारी सम रहे ॥ २ ॥  
 २. ४५ शव मूण न भणतां ॥ अथवा पेटे गक्ष छतां ॥ के बाणक धावलुं हेतां ॥ साथे जतां हौप खहु ॥ ३ ॥  
 ३. ४६ के भूढा भरतां पति ॥ राखे वाण माथे हुमंति ॥ ए पतिसह पामे हुर्गति ॥ करे सती केशवपन ॥ ४ ॥  
 ४. ४७ सूचे ना री खाटवा पर ॥ विधवा जय ए सत्वर ॥ नरके, तेथी भूमि पर ॥ सूचे नार एकाहार ॥ ५ ॥

अ.  
३१  
३२

॥२८॥

१. अर्थमेव. २. कल्पाणी

स.गु लूषा नु वेप तांभूल ॥ त्यज्ञने राख्युं शील ॥ पहेरवुं शुभ्र चैक ॥ मंगलस्तनान त्याग्युं ॥ ६ ॥  
 च.स. विष्णु प ति सभ मानी मन ॥ करे वैध०य आचरणु ॥ न करे परनरवीक्षणु ॥ चांद्रायणु करे शक्ता ॥ ७ ॥  
 ॥३०॥ अव इय भावि थयो जाणु ॥ एनो शोङ्क न करे मन ॥ माध रेज वैशाखस्तनान ॥ मास पूर्णु करे ए ॥ ८ ॥  
 सुम ति वर्ते आतुं तेने ॥ सहगमनवत् इण एने ॥ जय पतिने लक्ष्मि ॥ स्वगंस्थाने गुडिता आ ॥ ९ ॥  
 कहे प तिवता एमने ॥ वैध०य आ न गमे मने ॥ तारुष्य अनेक विधोने ॥ आणु एवुं लागे मने ॥ १० ॥  
 अव इय कुरु<sup>३</sup> एवुं कहीने ॥ रुद्राक्ष चार आपीने ॥ तेमज भस्म अपीने ॥ कहे सतीने तुं हवे ॥ ११ ॥  
 आ भू ति शिरे लगाडीने ॥ पति क्षें अक्षै बांधीने ॥ गुरुनुं दर्शन करीने ॥ सहगमन कर पधी ॥ १२ ॥  
 ए आ झा आवी आपीने ॥ गया, साधी दानो दृष्टि ॥ पतिशब्द उपडावीने ॥ अग्नि लौहने चाले एये ॥ १३ ॥  
 कहे न रनारी सती ॥ डेश साडा त्रष्ण कौटि ॥ डेमी छरशे स्वगों स्थिति ॥ वर्ष कौटि प्रतिकौटि ॥ १४ ॥  
 सर्व च भत्कार हेये ए ॥ समराने आवी मंहंगति ए ॥ अग्नि सिद्ध करीने ए ॥ समरे चित्ते उपदेश ॥ १५ ॥  
 स्वय क्षु थी गुरुहथांन ॥ करी कड़ सहगमन ॥ कही विप्राजाथी जाणु ॥ मनस्तिवनी गर्ह वेंगे ॥ १६ ॥  
 ज्यां उ षः काणे विजन<sup>४</sup> ॥ गलुं उडे तेवा जन ॥ साथे आवे ए सगर्जांन ॥ गुरुस्तवन मार्गे करे ॥ १७ ॥  
 सती य तीशदशांन ॥ करी करे साषटांग नमन ॥ पंचपुत्रा लव एवुं जाणु ॥ आशीर्वचन वहे गुरु ॥ १८ ॥  
 एस्व तं त्र ऐालतां जन ॥ करे साद्वंत वृत्तकथन ॥ गुरु प्रेत मंगावी जाणु ॥ करे स्नपन रुद्रतीर्थे ॥ १९ ॥  
 एत्यां तो जीठीने ऐसे ॥ नग्न जाण्डी शरमे नासे ॥ सर्व लोक नाथे हुधेरे ॥ हुधेत्सेके स्तम्भ सती ॥ २० ॥  
 हैव यो गे स्वर्णधट ॥ मणतां रंक धीयवाट ॥ नाचे हुधेरे तद्वत् स्पृष्ट ॥ हुधेरे उत्कटे थये एने ॥ २१ ॥  
 प्रेम गि रा अंने स्तवन ॥ करे, श्रीगुरु वरदान ॥ आपे, गया होष पूर्णु ॥ लोह स्वर्णु जेम स्पर्शेर्ष ॥ २२ ॥  
 अने न शु विधिलिभित ॥ पूछे गुरुने एक धूर्ते ॥ कहे आगामी तूर्ते ॥ माणी भित आप्युं मे ॥ २३ ॥

१. वख. २. कार्तिक. ३. कृ. ४. रुद्राक्ष. ५. पक्षी. ६. अत्यंत. ७. पारसमणिथी. ८. भविष्यतुं.

अ५.  
उ२

॥३०॥

मन औत्ये<sup>१</sup> गुरु आहुं वहे ॥ लैआडै जय जय शण्हे कूहे ॥ ६ पती स्नान करे ॥ मोहे<sup>२</sup> गुरु तत्सङ्ख मठे आऱ्या ॥ २४ ॥

४० ५० वासुदेवानं दसरस्वतीविरचितसत्तेतशतीगुरुयरित्रस्य श्री० अ० पांडुरंगकृतसमनुवाहे  
प्रेतसंज्ञवनं नाम दानिशोऽध्यायः ॥ ३ ॥ ३२ ॥ कुल ओंवी ॥ ३२३ ॥ ३३

स. गु.  
य. स.  
॥३१॥४०.  
३२  
३३

## अध्याय ३३

ऐ आ ने करी नमन ॥ कहे कावे भज्या मुनिजन ॥ गुरु ऐवे सहारण जाणु ॥ ३ प धारणु में कथु<sup>३</sup> ए ॥ १ ॥  
तारा प रम ग्रेम हेणीने ॥ रुद्राक्ष आध्या में ज तने ॥ दुष्टीर्थे में ज पतिने ॥ सज्जन कर्या बाले ॥ २ ॥  
अब इय आ धारणु कर ॥ पूर्वे काशभीरेशकुमर ॥ प्रधाननो ए कुमार ॥ अलंकार हैंडी हे ॥ ३ ॥  
ऐ भान्त्या गांडा कहे जन ॥ असम रुद्राक्ष करे धारणु ॥ पूछे पराशरने कारणु ॥ कहे मुनि सुषु भूप ॥ ४ ॥  
सर्वा त्वं शिव अके सुभति ॥ नंही आमे वैश्यासती ॥ वैश्यदेपे गोरीपति ॥ आवे ए प्रति परीक्षणा ॥ ५ ॥  
अन न्य खी ग्यहु<sup>४</sup> थर्हने ॥ लै लिंग कंडणु रतिहाने ॥ ए कहे लिंगनाशने ॥ त्यज्ञश प्राणु हु नकी ॥ ६ ॥  
ऐनुं व चन ए भानीने ॥ मंडपे रत्नलिंग भूकीने ॥ रमे वैश्य गृहे तेडीने ॥ अणे मंडप लिंग सह ॥ ७ ॥  
वैश्य स्थि २ करी मन ॥ होणी हग्ध लिंग जाणु ॥ करे अजिनप्रवेशन ॥ सर्व हान आपी वेश्या ॥ ८ ॥  
त्यज्ञ तं द्रा आवे भङ्गार ॥ कहे लैआडै तु डानी नार ॥ केटलाए आवे वेश्या घेर ॥ खणी भरे न सुषुतांणे ॥ ९ ॥  
त्यां था य शिव प्रसन्ना ॥ लह जय उद्धरी जाणु ॥ करावी एणे रुद्राक्षधारणु ॥ कुङ्कुट<sup>५</sup> मर्कट पाज्या जे ॥ १० ॥

४० ५० वासुदेवानं दसरस्वतीविरचितसत्तेतशतीगुरुयरित्रस्य श्री० अ० पांडुरंगकृतसमनुवाहे  
रुद्राक्षमहिमावर्णनं नाम नवखिंशोऽध्यायः ॥ ३३ ॥ कुल ओंवी ॥ ३२३ ॥

॥३१॥

१. मन आहिकरणो ग्रेंड २. आनंदथी ३. नव दिवस ४. भरध्या

## અધ્યાય ૩૪

ચ.ગુ. ૧ તવત્સુ ત એ આ અક્ષપ્રિય ॥ ભૂપ કહે વહો ભાવિષ્ય ॥ મુનિ કહે સ્પેટાહાયુષ્ય ॥ તવ તનય જીવશે આ ॥ ૧ ॥  
 ચ.સ. ૨ વેદા ન્તો પનિષત્કાર ॥ તુદ્ર વિધિથી<sup>૧</sup> મુનીખર ॥ પાણી કરે અધસંહાર ॥ યમપુર થયું ખાલી ॥ ૨ ॥  
 ||૩૨||  
 ૩૫  
 તજા એ તુલબ યમ ॥ કથે એને કહે અક્ષ ॥ અભાવિકને એ અધમું ॥ આપે શર્મ ભાવિકને ॥ ૩ ॥  
 ૩૬  
 મૃત્યુ કુ તથય જાય ॥ તુદ્રે અર્થે મૃત્યુંજાય ॥ પછી રદાલિષેક રાય ॥ દ્વિજવર્યાથે કરાવે ॥ ૪ ॥  
 ૩૭  
 ભણે તા ર સ્વરે રૂઢ ॥ મરતાં પુત્ર એ મુનીર ॥ તીર્થે પ્રોક્ષે શવ અતંદ ॥ લગાડે મોત શિવદૂતો ॥ ૫ ॥  
 ૩૮  
 ધર્મા ત્ત્વ ને યમ તેને ॥ કહે યમદૂતો જઈને ॥ યમ પુછે જઈ શિવને ॥ જુઓ કેઅને કહે એ ॥ ૬ ॥  
 ૩૯  
 શંખુ નો બ્યાલ માની ધર્મ ॥ જેવડાવી કેખ સાંભમ ॥ શિવદૂતોની માગે યમ ॥ ક્ષમા નીચું જોઈને ॥ ૭ ॥  
 ૪૦  
 ટજ્યું નૈ મિત્તિક અરિષ્ટ ॥ નૃપ કરે વિપ્ર સંતુષ્ટ ॥ ત્યાં નારહ કહે એ અદષ્ટ ॥ ઋખિને સ્પેષ ઉપકાર ॥ ૮ ॥  
 ૪૧  
 મહા ન હ થયો સર્વને ॥ અયુતાયુ સુત દેખીને ॥ શ્રીગુરુ કહે સતીને ॥ એ ગુરુને પ્રાર્થી કહે ॥ ૯ ॥  
 ૪૨  
 ઈતિ શ્રી ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસત્તાયારુચિત્રસ્ય શ્રી ૦ અં ૦ પાંડુરંગકૃતસમનુવાહે  
 રદાલિષેકલકથન નામ અતુલ્લિંગાદ્યાયઃ ॥ ૩૪ ॥ કુલ આંદી ॥ ૪૦૨ ॥

## અધ્યાય ૩૫

મંત્રો પ દેશ આપો મને ॥ જેથી નિત્ય સ્મરે આપને ॥ શ્રીગુરુ કહે કી મંત્રને ॥ પાત્ર ન, એને પતિસેવા ॥ ૧ ॥  
 અવ ઇય સાંભળ આ કથા ॥ દેવે દેત્ય રણે મારતાં ॥ સંશુદ્ધની જરી કરતા ॥ સંશુદ્ધ તાત ભાગ્ય ॥ ૨ ॥  
 અચિ ન્ય મંત્રવિદ્યાશક્તિ ॥ ઈદ્ર કહે શંખુ પ્રતિ ॥ આણી શુક સત્ત્વર ગતિ ॥ ઉમાપતિ ભક્તે એને ॥ ૩ ॥  
 એ બ ચે મૂર્દ્વારે પડી ॥ ઇરી દેત્યો ભચાવે અડી ॥ બૃહસ્પતિ કહે મંત્ર પાડી ॥ વદ્દકર્ણે ભષ્ટ કરીશું ॥ ૪ ॥  
 સ્વસુ ત વેગે એલાવીને ॥ દે મોકલી ખાળ કર્યને ॥ કપટી શિષ્ય એ થઇને ॥ શુકસેવને રત<sup>૩</sup> રહે ॥ ૫ ॥

૩૫.  
૩૬.  
૩૭.

||૩૨||

૧. અલદેવથા ૨. મંડળો.

१) न वा सः शुभदो नेऽस्य<sup>१</sup> ॥ एम मानी अने हैत्य ॥ मारी नाखे बचावे काठय<sup>२</sup> ॥ [द्विवार कन्यास्तेहे] ॥ ६ ॥  
 स.गु. २) हैत्य य त्ने भाणी अने ॥ लस्म मध्यमं भेणवीने ॥ आपे, शुड ए न जाणीने ॥ पीतां कन्या रडे विरहे ॥ ७ ॥  
 च.स. ३) कन्या दा जे शुडे सधणे ॥ हेखतां क्य पेटे भाणे ॥ कडे हेवयानी कणे ॥ उठाइतां ए भरुं हुं ॥ ८ ॥  
 ॥३३॥ ४) कन्या दि ०४ मंत्र माणे ॥ कडे क्यां उठाइ वेगे ॥ पठी तमने मंत्रयोगे ॥ हुं वेगे ज्ञानीश ॥ ९ ॥  
 ५) हेडे त्यलुश हुं अन्यथा ॥ ज्ञेवी कन्येाक्षित सांखणतां ॥ आक्षासीने मोडे हाता ॥ मंत्र पिता आपे अने ॥ १० ॥  
 ६) अ०४ ग ज्ञपे ए क्यार्थ ॥ द्वाडी पेट नीसरे सुत ॥ कन्या पठी उठाइ तात ॥ मंत्र श्रुत थयो क्यने ॥ ११ ॥  
 ७) मंत्र तं त्र प्रगट थतां ॥ आवे तत्काण निर्विद्यंता ॥ शुडमंत्रने आवे हीनता ॥ आज्ञा तुरत माणे क्य ॥ १२ ॥  
 ८) कन्या ते ने कडे मुज्जने ॥ वर, आप्यां विद्यासु<sup>३</sup> तने ॥ कडे क्य बहेन तुं भने ॥ भूत विद्याने कडे ए तुं ॥ १३ ॥  
 ९) क्य जो रथी शापे अने ॥ ज विम नहि वरे तने ॥ शुड उपदेशे लेथी खीने ॥ मंत्रने आवशे भ्रष्टत्व ॥ १४ ॥  
 १०) एदिज ज पुत्री हेवा छतां ॥ शापे थर्द ययातिकंता ॥ अने हानि मंत्र आपतां ॥ मताचरणु खीने क्षुं ॥ १५ ॥  
 ११) ए प ग वंही कडे प्रत ॥ कडे एक गुरुनाथ ॥ श्रीगुरु कडे सोमवत ॥ करतां भणे सर्वं सिद्धि ॥ १६ ॥  
 १२) आसद्धा वे कर परम ॥ आर्यावर्ते चित्रवर्म ॥ अने सीमंतिनी सुनाम ॥ उत्तम एक कन्यारत्न ॥ १७ ॥  
 १३) वर स यौद थयां अने ॥ वैध०४ जाणी पूछ्युं अने ॥ भैत्रेयीअे क्षुं तने ॥ मुभने कर सोमवत ॥ १८ ॥  
 १४) निश्च य भने धारी जाणु ॥ सोमवारे उपेषष्टु ॥ अथवा करी ४नक्तालोजन ॥ अर्यन करवुं गौरीशनुं ॥ १९ ॥  
 १५) नासे ते थी हुरित सती ॥ सौभाग्य सुत राज्यप्राप्ति ॥ आपे शीघ्र गौरीपति ॥ अर्यांतां ए प्रदीपे ॥ २० ॥  
 १६) ए अ खि ल हैष धरणु ॥ करे, हुःअ पडतांअे न ॥ छोडे जे, सीमंतिनी जाणु ॥ आचरणु करे सुणी ए ॥ २१ ॥  
 १७) हैव लं धी शुडे कौणु ॥ चित्रांगहने ए अपॄणु ॥ करी राज ग्रेमे जाणु ॥ करे अने धरज्जमाई ॥ २२ ॥  
 १८) इ॒षे य मुनामां जामाता ॥ कन्या प्राण्य त्यज्जवा ज्ञतां ॥ निवारी घेर ज्ञय पिता ॥ तोअे वत न छोडे ए ॥ २३ ॥  
 ॥३३॥

१. आ अहीं रहे ए आपणे माटे शुभ नथी. २. शुडायार्य ३. विद्या अने प्राणु. ४. राजे.

स.गु. मह श क काण्डुं ए ॥ द्वर न थाए कोईथीजे ॥ शोकमग्न वशुर् थ.जे ॥ बांधी हरे शनुराजय ॥२४॥  
 य.स. ए ई न्द्र सेनसुतने ॥ पातागे लह गया एने ॥ लवाडीने वासुकी तने ॥ पूछतां एने कहे सवै ॥२५॥  
 ॥३४॥ कहे म ने ताउं दैवत ॥ पूछे एवुं सर्वनाथ ॥ कहे नभी ए गौरीनाथ ॥ भद्रैवत जगहीय ॥२६॥  
 कहे सि ताक्षै रहे एने ॥ चित्रांगद कहे मोक्षेने ॥ हुःअ भद्रिरहे माताने ॥ थाय पत्नी त्यागशे प्राण ॥२७॥  
 ए ई य सर्वी सह मोक्षे ॥ वेगे आव्या यमुनाजपे ॥ त्यां तेा सीमंतिनी कहणे ॥ पागण शुं होडे ए ॥२८॥  
 शुं स च्चा हरे आ भत्पति ॥ एवुं ज्यां ए चिते सुहती ॥ त्यां तेा आवी सत्वरगति ॥ वार्ता पति पूछे एनी ॥२९॥  
 संल ग्नौदासीन्य दीन ॥ कौषु आ एवुं पूछतां जाणु ॥ शरमाई कहे सभीजन ॥ कहे चिह्न अधां ए ॥३०॥  
 सभी त चिह्न करे कथन ॥ कहे ए आने पति तत्क्षण ॥ आवी मणशे सत्य जाणु ॥ शिवसोगन जूँडुं ले ॥३१॥  
 स्वस त च्छे छोडवी तात ॥ माभापनी हरी चित ॥ सीमंतिनीने मणे तूर्त ॥ व्रतप्रभावे करी ए ॥३२॥  
 शोले जो डुं सुंहर अति ॥ राज्ये आडू थया पति ॥ शिवप्रते आवी प्राप्ति ॥ थर्द जरी कहे गुरु ॥३३॥  
 आचा वि त्रीवत तुं कर ॥ तथा५ कही करे स्वीकार ॥ आज्ञा लह ए स्वभंहर ॥ आवे नार पति सह ॥३४॥  
 सुखु द्वि ज्यां ए बंनेनी ॥ जेवी वाणी श्रीगुरुनी ॥ इत्प्राप्ति एवी एनी ॥ हुःअनी तेा वात कथांथी ॥३५॥

धर्ति श्री० ५० ५० वासुदेवानंहसरस्वतीविरचितसप्तशतीयुद्यरित्रस्य श्री० ५० पाठुरंगकृतसमतुवाहे  
सीमंतिन्याख्यानकथनं नाम पंचनिशोऽध्यायः ॥ ३५ ॥ कुल एंटी ॥ ४३७ ॥

### अध्याय ३६

यदा मां शून्यविवेक ॥ एवो हतो विग्र एक ॥ लावे नित्य करे आनिहक ॥ हतो रंक ए बहु ॥ १ ॥  
 निय म करी ए पराज ॥ त्यजे हंपतीलेजन ॥ नोतुं आए महाजन ॥ स्त्री जहने प्रार्थ गुरु ॥ २ ॥

१. ससरो. २. शुभनेत्रवागो. ३. वोडो. ४. ऐदमग्न. ५. डीक ६. एनी चां.

स.गु. तुरु कं ठ हुःभे करीने ॥ जाण्डी शुरु तेडी विप्रने ॥ कडे ज आने लઈने ॥ परान जमवा तुं ॥ ३ ॥  
 च.स. गुणु गा न करी तत्कष्टु ॥ गुर्वाज्ञा मानी सप्रमाणु ॥ पत्नीने साथे लईजाण्डु ॥ पराज्ञ जमवा गण्डे भे ॥ ४ ॥  
 ॥३॥ त्यां तो मा निनीये जमतां ॥ श्वसूकरोचिष्ठै हेखतां ॥ जोठे पति सहु हुश्चिता ॥ गुरुनाथने भणे अंने ॥ ५ ॥  
 नारी विनवी याचे क्षमा ॥ गुरु कडे धराईने मा ॥ कडे द्विज नियममां ॥ अष्टता मारा आवी हा ॥ ६ ॥  
 अव इय आ वेरी नार ॥ गुरु कडे हुःभ मा कर ॥ में माया हेखाई सत्वर ॥ शुद्ध कर्तुं भन एनुं ॥ ७ ॥  
 ए व च न मानशी तातुं ॥ स्वप्नेये पराज्ञ सातुं ॥ नहि अंभे, वत आ तातुं ॥ रडो चालु अभंड ॥ ८ ॥  
 प्रार्थे भू सुरै लवुं कुर ॥ अज्ञ वनये डोतुं तत्र ॥ गुरु कडे संभंधी भित्र ॥ गुर्वाज्ञ अत्र लेवुं सुभे ॥ ९ ॥  
 वजये ता भस कुचराज ॥ विधिनिषेधरहिताज ॥ हुधप्रतिष्ठ हुर्भक्ष्याज ॥ कन्यान सुत न थतां ॥ १० ॥  
 त्याग नि नहकाहिकान ॥ कहि जमतां ए श्राद्धान ॥ पट प्राणायाम कर पूर्ण ॥ प्रेताज्ञ त्याग सवंथा ॥ ११ ॥  
 अग्न्या धा नि—लागवताज्ञ ॥ पवित्र करे अद्विष्टान ॥ तीर्थे श्वेते पर्वे हान ॥ हीन कुदान न लेवुं ॥ १२ ॥  
 स्वाया र युक्ता नर ॥ सर्व देव उरे हर ॥ द्विज कडे सविस्तर ॥ नित्यायार कडो रपट ॥ १३ ॥  
 गुरु या चना सुणीने ॥ कडे पराशरमतने ॥ धाक्षमुहूर्ते उठीने ॥ गुरुटेवाहिने बंडो ॥ १४ ॥  
 थाँ या म्य मुअ राते हेभ ॥ हिवा संधि उद्भुमुभ ॥ नैऋत्य औष्ट्याए निःशंक ॥ मार्गेहिकवर्जित स्थणे ॥ १५ ॥  
 त्यछु ह रितृष्ट, ५ शर ॥ वस्त्रे ढंकी, जण हर ॥ मणमूर्त्रोत्सर्गं कर ॥ शौच कर मृतोयथी ॥ १६ ॥  
 गोणी मो ठी माटीनी कर ॥ लिंगे एक त्रि गुदा पर ॥ सात हाथपग उपर ॥ अधं रानो संकटे अधं ॥ १७ ॥  
 आदि जवर्यायार ॥ ६ वण्डी वनी यतीखर ॥ द्विनियुर्णुणायार ॥ खीकुमार हुगंधान्त ॥ १८ ॥  
 शुद्ध मा धै विक्ष्यनुसार ॥ विप्र कोगणा करे भार ॥ आठ छ ने चार ईतर ॥ अंते द्विराचमने शुद्धि ॥ १९ ॥  
 भुदा पुष्य मध्य स्नान ॥ प्रातःकाणे गोमयस्नान ॥ प्रतिसंन्यासीने त्रिस्नान ॥ खीने शिरःस्नान न नित्य ॥ २० ॥

३५.  
३६

१. ल्लीये २. भालाण. ३. अग्निहोत्री. ४. दक्षिण. ५. लीलुं धास ६. अलयारी.

॥३५॥

स गु. १३६॥ शीतो छणा भयु गृहस्थने ॥ माज्ञनाहि न एषे ॥ तर्पणाहि, वहिःस्नानने ॥ मुद्दारणु करे शिरे ॥ २१॥  
 अना मि काचे हल्पवित्र ॥ बद्धशिख सोपवक्त्र ॥ करे संध्या जे प्रकार ॥ गृह्यकार कडे तेम ॥ २२॥  
 औंजु चौ लादिमां न लस्तम ॥ तहन्यन जाणु परम ॥ सनक्षत्र संध्या उत्तम ॥ मध्यम जाणु लुप्ततार ॥ २३॥  
 चाकु ष सूर्यदर्शन ॥ प्रातः संध्या अधम जाणु ॥ एथी उलटुं रातो जाणु ॥ उपस्थान सूर्येक्षणे ॥ २४॥  
 पूर्वे धी मे आचमन ॥ प्राणायाम तथा माज्ञन ॥ मंत्राचमन करी जाणु ॥ अधमर्षण अर्धदान ॥ २५॥  
 मन स्स भाधाने त्रण ॥ कालात्यभे चायुं जाणु ॥ सूर्योदयविनकारण ॥ रक्षोगणु मरे एथी ॥ २६॥  
 आहु वर्ग रासे भारतां ॥ होष लागे, भूमि इरतां ॥ असावाहित्य जपतां ॥ आवे शुद्धता विप्रने ॥ २७॥  
 एँ स्व स्सो पानभूत थात ॥ कर्म रहेवुं सहोद्रव ॥ शुभासने न्याससहित ॥ जपतां स्मरो ऋष्याहि ॥ २८॥  
 गणे मो टा ३अक्षे जपने ॥ के स्टटिकादिमाणे एने ॥ निष्ठण मुद्राविनानाने ॥ समाधाने भौने जपे ॥ २९॥  
 शिध भू ल न थवा देवी ॥ माला छन न पडे एवी ॥ गायत्री छन्नर जपवी ॥ कभी करवी अशक्तो ॥ ३०॥  
 वृद्ध त्वा हि तारतम्ये ॥ न जपवी धनकामीये ॥ जसे जसे अने संध्याये ॥ सायं संध्याये एसीने ॥ ३१॥  
 उलुं रहेवुं उपस्थाने ॥ दिशा देव द्विज नभीने ॥ आवे गुरुपद वंहीने ॥ विसज्ञन छरवुं पछी ॥ ३२॥  
 ईदो सा भान्य संध्याविधि ॥ सायं प्रातर्होमविधि ॥ करवो स्वयं उदय साधी ॥ प्राहुष्करणु पछी होम ॥ ३३॥  
 आ आ तम स्त्रीसुताहिये ॥ करवो गृण्यधान्याहि ए ॥ धर्मकार्ये श्रमहःए ॥ न जराये डरे विप्र ॥ ३४॥  
 लोग कः पदार्थ माने दिन ॥ कर्म थाय शुद्धि निन ॥ आनंद लोगे ए ज सहज ॥ आज मुख्य देवपूज ॥ ३५॥  
 कुरी अ जहोम अन ॥ अक्षयज्ञ करवो चित्र ॥ अक्षांजलि सपवित्र ॥ लण्ठा मंत्र आक्षण्ठाहि ॥ ३६॥  
 विद्या हं कारवर्जित ॥ अक्षयज्ञ करे मुक्त ॥ केवुं एँ पठेने अशक्त ॥ होष न, जपे अनंध्याये ॥ ३७॥  
 कुर्म वै श्वेतोत्तर ॥ करे मध्यमंध्योत्तर ॥ तपें हेवर्वि पितर ॥ सूर्य निवीत्यसूर्ये ॥ ३८॥

अ.  
३६

१३६॥

१. रवर्गनी सीढी २. रुद्रक्षथी ३ सूतां, ऐसतां, यालतां, फावे तेम

स.गु. एवि श्वा तमा अक्षस्तंभान्त ॥ तप्सेषु तृप्त, यवाक्षत ॥ देवधिने करे तृप्त ॥ तवे तृप्त पितृन्मी ॥ ३८ ॥  
 अ.स. गृहे न आ तवत्पर्षु ॥ निधिने मांगल्ये न ॥ हिवाणीमां यमतप्सेषु ॥ तत्पर्षु भीष्माष्टमीन्मी ॥ ४० ॥  
 ॥३७॥ छोक रो आ ज्ञवत्पिता ॥ करे, होष अन्य करतां ॥ भद्रान्हे सूर्य आवतां ॥ भद्रान्ह संध्या करे ॥ ४१ ॥

24  
36-  
37

धृति श्री० ५० ५० वासुदेवानंहसरस्वतीविरचितसोतशतीयुग्मित्रित्य श्री० ५० पांडुरंगकृतसमनुवादे  
 आह्निकर्मनिष्पत्तु नाम पद्मिनेऽध्यायः ॥ ३६ ॥ कुल ओंनी ॥ ४७८ ॥

## अध्याय ३७

गृह भू मि संभार्जन ॥ करे नित्य लेपरंजन ॥ शालचाम शिला धेन ॥ राखीने रक्षा सुगम्य ॥ १ ॥  
 गृहि त्वा पित गृहभेदीये ॥ अग्निहोत्र के गृह्याग्निये ॥ संध्याची देवपूज्य थाये ॥ पशुतुद्य अन्यथा ॥ २ ॥  
 करे प्रा तविस्तारे ॥ व्योदे पंचेषाप्यारे ॥ संध्याये नीराजन करे ॥ यथाकाणे यथाशक्ति ॥ ३ ॥  
 धर णि भां जे को अधम ॥ न पूजे तेने हँडे यम ॥ वेदमंत्रे द्विज परम ॥ पूजे पौराण्याकृते स्तीशूद्र ॥ ४ ॥  
 विपिनां तोत्थ भद्र्यम ॥ क्षीति॒ हीन स्वीय उत्तम ॥ तेम श्वेत रक्त श्याम ॥ पुष्पे अधम शूद्रानीत ॥ ५ ॥  
 न हो दे वेने सङ्कुमितिर ॥ हुर्गा हृवा, कैवडा हर ॥ वल्ल॑ तुलसी गणेशूक्षर ॥ धन्तूरार्कीहि पूजे कृष्ण ॥ ६ ॥  
 वाम ह स्त रागो कलश ॥ पुष्पादिने दक्षिणू देश ॥ शंखंटा वामदक्षे आस ॥ करे न्यास देहे देवे ॥ ७ ॥  
 काय मा नस वाग्बद्ध ॥ बोडशोषाप्यारे शुद्ध ॥ पंचामृते पूजे समुद्ध ॥ स्नानपूर्वे पधी भूषा ॥ ८ ॥  
 तवा श्रि त हुं भने तार ॥ प्रार्थीने निर्माल्य ले शिर ॥ भावे मंत्र जपे सत्वर ॥ पी तीर्थ उद्घास ले शिरे ॥ ९ ॥  
 ए अंतःकरणे देशने ॥ स्मरी धोवा पंचहोषने ॥ करे पधी वैश्वदेवने ॥ प्रातःसायं स्वानन शुद्धयर्थ ॥ १० ॥  
 डाम प्रा तः कावे जे सुज ॥ करे तंज देवयजा ॥ कःकबलि ते भूतयजा ॥ पितृनृयजा तत्पर्षु ॥ ११ ॥

॥३७॥

१. जगलभां ज्ञानेवां २. वेचातां आणेवां

च.गु. वीक्षणा थं अतिथिने ॥ जरा वार थोलो आंगणे ॥ आवतां अन्न आपो एने ॥ यतिने सजलानन ॥१२॥  
 च.स. १ किलम पा ६ मुख क२ ॥ जमो लहने परिवार ॥ अनलषयाने पीरसो छ्र ॥ न करो पंडितलेह ॥१३॥  
 ॥३॥ भूँ न रे चित्राहुति ॥ आपेशने भौनस्थिति ॥ देवी भंगे प्राणाहुति ॥ पात्र हस्ते स्पर्शींने ॥१४॥  
 भौन स हु प्राणाहुत्यंत ॥ राखे पधी विकलिपत ॥ पाने छांडो न उचिष्ठ ॥ जल भीतां शब्द वन्नर्य ॥१५॥  
 न स मा तां हीप आवुं ॥ रजस्वला प्रत्ये न जेवुं ॥ तच्छण्डाहि न सांभगवुं ॥ न अडकवुं अन्योन्य ॥१६॥  
 हुर्वा यु अद्ये जतां ॥ कीटयुक्त रथे आता ॥ न जमवुं वांति थातां ॥ केश पडानां ग्रोक्षणु ॥१७॥  
 २ वियुक्तः स्याद् द्विनत्वात्स पलांडुलशुनादिभुक् ॥ तामसाहारभुग्दुर्धीः सात्त्विकाहारभुक् सुधीः ॥१८॥  
 आञ्ज्य<sup>३</sup> प येन्न लवण्य ॥ सर्वं आवुं अन्य अन्न ॥ शेष राखवुं उचिष्ठानन ॥ आपेशन अर्ध घीवु ॥१९॥  
 अन्न चा ववुं धीरे जने ॥ वन्नर्य तर्जनी मुख्योधने ॥ हस्त पाद मुख धोएहने ॥ द्विराचमने कही शुद्धि ॥२०॥  
 देवा स म्य इ तांभूत्वाहि ॥ सांलणो सुधे पुराणाहि ॥ करो सायंसंध्याविधि ॥ लोजनाहि पूर्ववत् ॥२१॥  
 क्षीरा ज राने प्रशस्त ॥ दिवाकर्म प्राक्षप्रहरान्त ॥ रानो वन्नर्य सौरपाठ ॥ निशीथान्तरै रात्रिकर्म ॥२२॥  
 जे प ऋ यज्ञाहिक चूके ॥ करे प्रायश्चित विवेके ॥ सूर्ये धूक्तर वंही सुधे ॥ करी कर्म धृशाप॑षु ॥२३॥  
 खीङ तु कांक्षे करो रति ॥ पवं भूल भद्रा रेवती ॥ वन्नर्य दिवा<sup>५</sup> श्राद्ध ग्रनाहित ॥ नंतुगामी अद्वाचारी ॥२४॥  
 न यु विं शी<sup>६</sup> साथे रमवुं ॥ कैपदेषाहि त्यजवुं ॥ नंतु टाणीने न जवुं ॥ जतां पामे भूषुहृत्या ॥२५॥  
 धर धंधे करतांये न ॥ छोडवुं स्वधर्माचरणु ॥ शुदु घेवुं कहे, प्राह्वाणु ॥ करी आचरणु तरे ए ॥२६॥  
 धति श्री० ५० ५० वासुदेवानंहसरस्वतीविरचितसतीशीयुर्यनित्य श्री० अ० ५० पांडुरंगाकृतसमनुवादे  
 आहिकर्मनिःपणुं नाम सत्तविशेषध्यायः ॥ ३७ ॥ दुल घोंवी ॥ ५०४ ॥

१. भीना २. १ आतां पलांडुलशुनाहि ॥ द्विनत्वथी पडे सुधी ॥ तामसाह रे वडे शुद्धि ॥ सुधी सात्त्विक आनपाने ॥१८॥

३. धी. ४. भद्ररात सुधी. ५. दिवसे ६. गलिंशी.

स.ग.  
च.स.  
॥३६॥

गुरु स मर्थने लिक्षा देवा ॥ भास्कर विप्र लाभ्यो नवा ॥ त्रिषु पुरतुं सीधुं भेवः ॥ जमवा असाख्यो अक्तोऽये ॥ १ ॥  
 ए स वं सामथीने ॥ सूर्ये लक्ष्मा भाथा कने ॥ त्रिषु भास थया तेने ॥ न भज्ये अने शून्यवार ॥ २ ॥  
 ए हा स्य करे देखी लेाक ॥ गुरु करावे स्वयंपाक ॥ कहे नेतर सर्वं लेाक ॥ जमवा कहे सर्वंने ए ॥ ३ ॥  
 इसे चा २ मणी टोणे ॥ कहे कल्पुओ भाग्ये भणे ॥ गुरु पासे जध ए भोक्ते ॥ भोक्तावे गुरु सर्वंने ॥ ४ ॥  
 निर हं कार ए आद्वाण्य ॥ करे पाक सुनिष्पन्न ॥ गुरु वसे करावी छन ॥ लहने अनन् पीरसावे ॥ ५ ॥  
 द्विज ह इचिते जम्या ॥ नहाना भैटा सर्व आभ्या ॥ चार हजार पात्रे थयां ॥ आकंठ जम्या सर्व ॥ ६ ॥  
 अन्ना दि आप्युं सर्वं जनिने ॥ आचंडाल अकाकाहिने ॥ तोअे घृत्युं नहि कौर्यने ॥ गुरुओ विप्रने जमाख्यो ॥ ७ ॥  
 अन्न सं चय वध्यो तेने ॥ नांख्यो जणे जग्यरोने ॥ अयाति थध भूमंडवे ने ॥ वर द्विजने आपे गुरु ॥ ८ ॥  
 हर्ष नि र्हर वहे लेाक ॥ गायु पुरतो हतो पाक ॥ जम्या त्यां आ अमित लेाक ॥ शुक्रौतुक श्रीगुरुनुं ॥ ९ ॥

धति श्री० ५० ५० वासुदेवानं दसरस्वतीविरचितसैतशतीयुरुचिरिनस्य श्री० अ० पांडुरंगाकृतसमनुवादे  
 अनन्पूर्तिकरणं नाम अष्टात्रिंशाऽध्यायः ॥ कुल एांवी ॥ ५२३ ॥

## अध्याय ३८

एक वि प्र सोमनाथ ॥ तत्की वृद्धा वैद्या अयात ॥ सेवे भावे श्रीगुरुनाथ ॥ इचित तेने पूछे गुरु ॥ १ ॥  
 एक द्वितीया गुरुने कहे ॥ अपुगा हुं व्यर्थं गेहे ॥ अस्थित्यने भजतां स्नेहे ॥ वृथा वहे लुवन ॥ २ ॥  
 थाएम ने आगण पुग ॥ युदु कहे कौ लहे परत्र ॥ आ जन्मे ज कन्यापुत्र ॥ थाए, खी गांठ वाणे ॥ ३ ॥  
 गुड त्त भ कहे नार ॥ अस्थिती निंदा भा कर ॥ अमे सर्वं हेव ए पर ॥ नारहने कहे अद्वा ॥ ४ ॥  
 श्रुति स्मृति गाय अति ॥ तेने कर भंहगति ॥ प्रहक्षिणा लक्षमिति ॥ कर अंते उद्यापन ॥ ५ ॥  
 आप ति ल स्वर्णाद्वित्य ॥ विप्रोने लोजन निश्चित ॥ थरो तने कन्यासुत ॥ नारी कथे हे हेव ॥ ६ ॥

अ०  
३८  
३८

હું હજ્જી ના કેમ માનું ॥ સાડ વરસ મને લાણુ ॥ નાવે રજસ્વલત્વ અણુ ॥ સેવન તોએ કરીશ ॥ ૭ ॥  
 સેવે ન મીને અધૈત્ય ॥ થઈ રજસ્વલા ત્વરિત ॥ પંચમ દ્વિને ગર્ભ તુરત ॥ રહ્યો કન્યા થઈ એને ॥ ૮ ॥  
 પર મ હર્ષે એ કન્યાને ॥ લાવે નારી શુરુ કને ॥ શુરુ કહે થશે સતી ને ॥ વરશે પતિને હીક્ષિત ॥ ૯ ॥  
 તારે પો ત મૂર્ખ શતાયુ ॥ કે નેદિએ બુધ અદ્વાયુ ॥ એ કહે ભલે અદ્વાયુ ॥ હીરાયુ મૂર્ખ કિમર્થ ॥ ૧૦ ॥  
 થાએ હ વંદ પંચ તલસુત ॥ તથાસ્તુ કહે શુરુનાથ ॥ કન્યા લઈ ગૃહે ત્વરિત ॥ આવી હસતી પ્રભાણી એ ॥ ૧૧ ॥  
 થયો ને દન શીશ એને ॥ વિદ્ધાન પૂર્ણ સર્વશુણુ ॥ પાંચ પુત્ર થયા એને ॥ થયો સર્વને વિસ્તમય ॥ ૧૨ ॥  
 કન્યા ચ હી વર્ણે હીક્ષિત ॥ ગાય સર્વે મંગલારીત ॥ કીર્તિં ઈલાઈ દિગંત ॥ શુરુનાથ કુપા એની ॥ ૧૩ ॥

ઇતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પતશતીગુરુસ્યરિત્રસ્ય શ્રી૦ ૪૦ ૪૦ પાંડુરંગકૃતસમનુવાહ  
 વૃદ્ધવધ્યાપ્રસવો નામ એકોનયત્વારિશોઽધ્યાય: ॥ ૩૬ ॥ કુલ એવી ॥ ૫૨૬ ॥

### અધ્યાય ૪૦

એક વે દશ પ્રાક્ષણુ ॥ શ્વેતકુષ્ઠે બ્યાપ્ત પૂર્ણુ ॥ શુરુ પાસે આની લાણુ ॥ કહે, નાથ તાર હે ॥ ૧ ॥  
 થયો દૈ વે કુષી દીન ॥ ન દેખે મુખ તેથી જન ॥ આનું કરો આપ શમન ॥ નહિ તો પ્રાણ ત્યાગીશ હું ॥ ૨ ॥  
 પુર શ્રી રણાદ્ધિથી પાપ ॥ ન જતાં ઉલટો થાય તાપ ॥ પ્રસો તુંજ મા ને બાપ ॥ માર્દી પાપ હુર કર ॥ ૩ ॥  
 આર્ત્વાસ ન આપે સત્વર ॥ શુરુ ત્યાંતો એક નર ॥ શુષ્ઠ કાઠ માથા પર ॥ લઈ ભાર આવે ત્યાં ॥ ૪ ॥  
 અપુ વૈ ક ચમતકાર ॥ કરવા ઈચ્છી શુરુવર ॥ કહે વિપ્રને કે સત્વર ॥ સંગમ પર રોપ કાઠ ॥ ૫ ॥  
 અવિ ર તૈ સેવ તું એને ॥ પહ્લવ કુટાં શુદ્ધ તને ॥ દ્વિજ રોપી એ કાઠને ॥ પાય પાણી સહલાવે ॥ ૬ ॥  
 દોક હ સીન વારે એને ॥ ન સાંલળે એ, શુરુ કને ॥ કહે તેઓ એ આવીને ॥ શુરુ કહે ઇણે ભાવ ॥ ૭ ॥

૧. અધ્યાત્મ.

૪૦.  
૩૬  
૪૦

स.गु. १ अप मेय सुष्णा भावदण ॥ धनंजय वाक्ये सुशील ॥ लिंग चिताभस्मे पूजे लिह्व ॥ भस्म भणी न एक हि ॥ ८ ॥  
 च.स. इच्छे वपु भाजवाने ॥ भार्या कहे भागो भने ॥ पूजे भस्मे भाणी एने ॥ प्रसादक्षणे जली ए ॥ ९ ॥  
 ॥८८॥ ए सु वेणाए प्रगटे हर ॥ आपे एमने इष्ट वर ॥ आवे भावनो आ प्रकार ॥ कही शुभ जया त्यां ॥१०॥  
 ए उ जो गने जेधने ॥ करे प्रोक्षण आहने ॥ आज्ञा अंकुर कूटीने ॥ स्वर्णवणुं थये विप्र ॥११॥  
 कुट्या वे गे रम्य अंकुर ॥ कुण्ड नाहुं त्यां ते सत्वर ॥ सत्वे विप्र ए अद्धकर ॥ थाय उद्दित अष्टभाव ॥१२॥  
 शांत दां त ईहुडाटिकांतीर्थ<sup>३</sup> अत्रिनंदन ॥ देववृंहवंधपाह दत्तात्रेयितरंजन ॥१३॥  
 पाप त घृतापभंजन सनातन जनादैन ॥ मायिकांधकारसूर्य<sup>४</sup> दत्तात्रेयितरंजन ॥१४॥  
 इता कृता कामरौप<sup>५</sup> वेष धारी बिजु तुं जन ॥ आपे इष्ट पाणे धर्म दत्तात्रेयितरंजन ॥१५॥  
 राग द्वे ष होष वार तार सूर्यचंद्रलेखन ॥ भक्ताकामधेतु तुंज दत्तात्रेयितरंजन ॥१६॥  
 इस्ते द इड कुंडी<sup>६</sup> लेई तुं छिड वीतछुवन<sup>७</sup> ॥ रक्तापद्मपत्रनेत्र दत्तात्रेयितरंजन ॥१७॥  
 तुंज वि श्व ढेतु भंतु<sup>८</sup> करे भाइआप सहन ॥ नित्य शुद्ध युद्ध मुक्ता दत्तात्रेयितरंजन ॥१८॥  
 तुंज दे व योगी थाय कापे हैन्य हुःअकानन ॥ तुं संन्यासी इष्टण्डावासी दत्तात्रेयितरंजन ॥१९॥  
 अह्व व स्तु तुं अनाहिमध्यनाश<sup>९</sup> आस वासन<sup>१०</sup> ॥ वार, भक्ता आप तार दत्तात्रेयितरंजन ॥२०॥  
 शुद्धा चा र भाव जणीने विद्वासरस्वतीभंत्रने ॥ आपी, राखी लीघे विप्रने ॥ सखीक एने श्री गुरुओ ॥२१॥

छति श्री० ५० ५० वासुदेवानंदसरस्वतीविरचितस्पतशतीयुयुरित्रिस्य श्री० अ० ५० पांडुरंगदृतसमनुवाद  
 विप्रकुण्ठहरणुं नाम यत्वास्त्रिओऽध्यायः ॥ ४० ॥ कुल ओंपी ॥ ५४७ ॥

- 
१. न भापी शकाय एवुं.
  २. करोड़ा चन्द्र जेवुं तेजस्वी.
  ३. कामकोष लेणे नष्ट कर्या छे एवो.
  ४. कमंडल.
  ५. भरी गर्येला.
  ६. अपराध.
  ७. आहि, मध्य ने अंतरहित.
  ८. वासना.

## अध्याय ४२

स.गु. निर हं कार त्वत्पूर्वज ॥ सायंदेव, कहुं छुं आज ॥ गाणुगापुरे वसे निज ॥ शुरुराज साक्षात् देव ॥ १ ॥  
 च.स. आ त द्वारा सांक्षणीने ॥ आवे साक्षांग नमीने ॥ थाय तद्वीन हेखी देवने ॥ करे स्तवन प्रेमरसे ॥ २ ॥  
 ॥४३॥ शुदु वि प्रने पूछे शेम ॥ कहे ए सर्व सप्रेम ॥ कहे भवत्सेवाकाम ॥ राखी धाम छोड़यं मैं ॥ ३ ॥  
 राखी मौ न अक्षिरसनी ॥ दूरंवा मैज धृच्छा मननी ॥ शुरु कहे सेवा अभ तथी ॥ अति कठखु न लाखे तुं ॥ ४ ॥  
 कहि पुर भद्ये वास ॥ आमे वने नहींये आस ॥ तने थरो कृष्ट सायास ॥ केम तुं वास अंगीकारे ॥ ५ ॥  
 ए स्वरु चिए स्वीकार ॥ करी रहे साथे नर ॥ एने एकलाने अहार ॥ संगमे शुरु लर्ध जय ॥ ६ ॥  
 जे हो बौ ध स्मरणे हरे ॥ संकटे त्यजे ए हरि शुं रे ॥ हार्दे शिष्य परीक्षा करे ॥ आजा करे भेदने ॥ ७ ॥  
 वायु लो क भयंकर ॥ वधे मेघ मुशग्नधार ॥ द्विने सही बातांपुधार ॥ रक्षा वस्त्राश्रये देव ॥ ८ ॥  
 शुरु के वल परीक्षार्थ ॥ लाव अभि कहे त्वरित ॥ विद्युतोने आमे इन्सित ॥ जर्ध हेवता लावयो ए ॥ ९ ॥  
 प्रत्य क्ष मार्गे सप्त हेघे ॥ होडतां मठे धवनि परघे ॥ प्रकाश हेखी मने यमके ॥ आवी हेघे तो एक शुदु ॥ १० ॥  
 सप्त र क्षाथं लेजया साधु ॥ तारुं मन वृथा बीधु ॥ कठखु सेवा नहोतुं कीधु ॥ साहस कीधुं शुरु कहे ॥ ११ ॥  
 रै प आ ताप थाय तने ॥ द्विज कहे प्रलो मने ॥ तुं जाखे शुं कहुं तने ॥ प्रार्थुं मने न काठ ॥ १२ ॥  
 प्रत्य क्ष तुं अक्षनिधान ॥ शुदुसेवानुं विधान ॥ कहे जेथी स्थिर जाल ॥ थर्शि सुणु कहे शुरु ॥ १३ ॥  
 कुमा र त्वधृहेवनो ॥ विद्यार्थी थयो शुरुनो ॥ लाव परीक्षवा एनो ॥ शुरु एने कहे रे ॥ १४ ॥  
 क२ ए क गृह निर्माण ॥ जे न तूटे न थाय लखु ॥ करे वृथाहि निवारणु ॥ ए सुष्णी तत्खी कहे ॥ १५ ॥  
 न सी व तां न वस्तुतां अने ॥ वराभर अंगे थाय मने ॥ रम्य कांचणी लाव मने ॥ तत्सुत तने कहे त्यारे ॥ १६ ॥  
 भारा च रहे सुझे बेसे ॥ भनेगति पंक न स्पर्शे ॥ पाडुका जे जल प्रवेशे ॥ न ढूझे, सुता कहे पधी ॥ १७ ॥  
 हे अ क्ष यैकस्तंभ धर ॥ पात्रे पाक न थाय शीतल ॥ काणुं न थाय लगार ॥ आप सुंहर कुड़वो ॥ १८ ॥  
 कुमार ए स्वीकारीने ॥ वंही एमने गयो वने ॥ अवधूत त्यां आवीने ॥ पूछे मुख चलान कां ॥ १९ ॥ ॥४२॥

मन स्स माधान करीने ॥ शिष्य करे सर्वं नमीने ॥ यति एने आश्वासीने ॥ काशीसेवन कहे कर ॥२०॥  
 ने शर्वा धिठान जाणु ॥ गंगा करे यद्वेष्टन ॥ सर्वं हेव तीर्थस्थान ॥ तत्सेवन कर शीघ्र ॥२१॥  
 त्यां जा णि न वात अमुक्ता ॥ तेथी कहे अविमुक्ता ॥ विरक्ता है विषयासक्ता ॥ तेए मुक्ता थाय ज्यां ॥२३॥  
 भीजुं भूमंडणे न एवुं ॥ शिष्य कहे न जाणुं कैवुं ॥ काशीश्वरो कथांथी ज्वुं ॥ प्रार्थुं आवुं कहे प्रबो ॥२४॥  
 कहे ता पसी अतावीश ॥ त्वद्वेगे दर्शन खास ॥ भनेए थशे अनायास ॥ कही पास लाभ्या क्षणे ॥२५॥  
 काशी नि कट आभ्या यति ॥ कहे यथाविधि सुमति ॥ कर यात्रा धरी लक्षित ॥ थशे पूर्ति कामनानी ॥२६॥  
 ए सा कूँ ते सुणी वचन ॥ कहे न जाणुं यात्राचरण ॥ कहे अवधृत करी स्नान ॥ मधिक्षिंडिकातुं आव तुं ॥२७॥  
 निक ट काशीविश्वेश्वर ॥ अंतर्गुंह यात्रा कर ॥ दक्षिण मानस यात्रा वर ॥ स्नानार्थन श्राद्धाने ॥२८॥  
 धति श्री० ५० ५० वासुदेवानंहसरस्वतीविरचितस्तेशतीयुरुपरिनस्य श्री० अ० पांडुरंगकृतसमतुवाहे  
 काशीयात्रःनिःपशुं नाम एकत्वारिणोऽध्यायः ॥ १ ॥ कुल ओंवी ॥ ५७४ ॥

## अध्याय ४२

तत्र स्थो हूँ<sup>२</sup> मानसयात्रा ॥ कर पंचकोशीनी जात्रा ॥ शुक्ल कृष्णपक्ष यात्रा ॥ नित्य यात्रा कर भावे ॥ १ ॥  
 प्रत्य क्ष ४ विश्वेश्वर ॥ भवानी हरि कुंडीश्वर ॥ हृषीकेश्वर ॥ विद्नेश्वर गुहा हेषी ॥ २ ॥  
 तुंस्थिर चितो जात्रा कर ॥ स्थाप लिंग हे कुमर ॥ भटी जशे चोर्यासी हेर ॥ कही त्वराए थया गुम ॥ २ ॥  
 शिष्य उठीने हेषे ज्यां ए ॥ थया गुम न हेषाए ॥ आज मारा शुक्ल कही ए ॥ करे यात्रा यथार्थ ॥ ४ ॥  
 ए वाच्य लीला शिच एने ॥ धृष्ट वर आए तेने ॥ आए सर्वं ए गुर्वादिने ॥ विश्वकर्मा थाय ए ॥ ५ ॥  
 द्विज ते कहे गुरु जेवुं ॥ हेषे त्यारे तेवुं तेवुं ॥ शुक्लाथने वंडी एवुं ॥ सायंदेव करे स्तवन ॥ ६ ॥

१. हेतपूर्ण. २. उत्तर.

२५.  
४१  
४२

॥४३॥

संगु. तुंज उ मापति देव ॥ देखाई काशी अन्नव ॥ शुरु कहे त्वदंशब्दव ॥ ऐकविश्वने यात्रालाभ ॥ ७ ॥  
 च. स. तुं उ त्त म गति पामीश ॥ छवे भवेच्छने न सेवीश ॥ लावी श्रीपुत्र अहीं वस ॥ अम पास सेवा करी ॥ ८ ॥  
 ॥४४॥ एनमः कहीने गयो ॥ स्वदुकुंभ लहने आयो ॥ स्तवीने श्रीगुरुने रह्यो ॥ कानडी स्तोत्रालापथी ॥ ९ ॥  
 एनोपु त्र नागनाथ ॥ वर आपे गुरुनाथ ॥ कहे सायंदेवने स्वस्थ ॥ कर अनंतवत आजे ॥ १० ॥

अ४-  
४२-  
४३

धति श्री० ५० ५० वासुदेवानंदसरस्वतीविरचितस्तशतीशुर्यरितिस्य श्री० अ० ५० पांडुरंगकृतसमनुवादे  
 'काशीयात्रानिरपण' नाम द्वित्वारिशोऽध्यायः ॥ ४२ ॥ कुल ओंवी ॥ ५८४ ॥

## अध्याय ४३

जे पु रु वार्थ आपे क्षेषु ॥ बाद शुक्ल योद्दसदिने ॥ योद्दवंथी रक्तसूत्रने ॥ पूलने करे बांध ॥ १ ॥  
 संतो ष मानी पूछे ए ॥ ब्रत कौष्णे कुरुं कहे ॥ शुरु कहे धूते हरी ले ॥ पार्थराज्य हुयेधन ॥ २ ॥  
 अबा स्वं पामीने पांडव ॥ वने श्रमतां आवे भाघव ॥ एने आपवा स्ववैष्टव ॥ कहे देव अनंतवत ॥ ३ ॥  
 त्वदन्यः कौडनंत धति ॥ पूछतां कहे हुंज श्रीपति ॥ सुषु सुमंतु कन्या हती ॥ पूर्वंखील सुशील ए ॥ ४ ॥  
 थाय प ती कौंडिष्यनी ॥ सावकी भाता द्वेषी एनी ॥ लर्धन्य भीजे एने धणी ॥ अनंतनी ए करे पूजा ॥ ५ ॥  
 श्रीव र आपे अनंत ॥ वशीकारलये अभिगत ॥ करे होरा सुनि कुपित ॥ हुःआभिधमां पडे ए ॥ ६ ॥  
 देव मा दी पर इठया अति ॥ कही सुनि सत्वरगति ॥ गया वने पठया मूर्छाथी ॥ श्रीमद्दनंत मञ्या एने ॥ ७ ॥  
 लुबा त्मे श अभिन्नत्वयी ॥ करे ऋषि एमनी स्तुति ॥ वर आपे सर्वैश्वर्यासि ॥ मोक्षप्राप्ति तत्पर्यात् ॥ ८ ॥  
 ए अ त्यु दार अनंत ॥ इरी करे एने श्रीमंत ॥ तेथी श्रीकृष्ण आ वत ॥ ३पार्थंहाये करावे ॥ ९ ॥

॥४४॥

१. तेजेहीनत्व.
२. तारा वगर भीमे वणी अनंत कौष्ण ?
३. युधिष्ठिर.

स.सु. दाया दा हिने<sup>१</sup> मारी धर्म<sup>२</sup> ॥ थयो जाणु सार्वजौम ॥ सदेह गयो स्वर्गे शर्म<sup>३</sup> ॥ पाख्यो, कर तुं वत ॥१०॥  
 च.स. विप्र ह इतर थईने ॥ शुड़का आ मत करीने ॥ रहे शुरुनी सेवा करीने ॥ अंध तोड़ीने थयो मुक्ता ॥११॥  
 ॥४५॥ तुं अंतः करणे ए जाणु ॥ गुरुप्रसाद थथे पूर्णु ॥ तारा वंशभां, तेथी मन ॥ तारुं जाणु रमे अहो ॥१२॥  
 याग यो गाहिक विषु ॥ तमने मज्युं आ निधान ॥ आम अक्ति करी जाणु ॥ हेव पोतानो करी ले ॥१३॥

24.

ઇતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્તથી ગુરુથરિત્રસ્ય શ્રી૦ ૬૦ પાંડુરગકૃતસમનુવાહે  
અનંતત્રતક્થનં નામ વિનિવારિશોઽધ્યાઃ ॥ ૪૩ ॥ કુલ એંવી ॥ ૫૮૭ ॥

અધ્યાત્મ ૪૫

ਸਿੰਘਾ ਲੋ ਕਨ ਕਰੀ ਕਥਣੁ ॥ ਸਾਂਭਣ ਆਗਣ ਆਮਧਾਨ ॥ ਤਾਂਤੁਕ ਸਾਂਸਾਰ ਕਰੀ ਜਾਣੁ ॥ ਜਨੇ ਗੁਰੂਨੇ ੩ ਯਾਮਮਾਤ੍ਰ ॥ ੧ ॥  
 ਤਵਦੈਂ ਕ ਸ਼੍ਰੀਸ਼ੈਖੈ ਜਤਾਂ ॥ ਛੇ ਏ ਏਨੇ ਆਲਾਵਤਾਂ ॥ ਗੁਰੂ ਪਾਸੇ ਸਰ੍ਵ ਹੇਵਤਾ ॥ ਸ਼੍ਰੀਸ਼ੈਲ ਮਲਿਕਾਰਜੁਨ ॥ ੨ ॥  
 ਸਰ੍ਵੰ ਤ ਆ ਗੁਰੂ ਏਕ ॥ ਪਥਰ ਜੇਵਾ ਫੋਡੇ ਕੋਇ ॥ ਏਨੇ ਨਿਹੀਨੇ ਗਯਾ ਲੋਕ ॥ ਆਵਧੇ ਤਾਂਤੁਕ ਗੁਰੂ ਪਾਸੇ ॥ ੩ ॥  
 ਏ ਗਾ ਯ ਵਾਂਹੀ ਗੁਰੂਗੁਣੁ ॥ ਗੁਰੂ ਪ੍ਰਥੇ ਫੈਮ ਗਧੇ ਨ ॥ ਕਛੇ, ਏਵੁਂ ਏਮਨੇ ਪਥੁ ॥ ਚਹੁੰਦੀਨਿ ਆਵਧੇ ॥ ੪ ॥  
 ਨਲੋ ਮਾ ਗੋ ਗੁਰੂਏ ਏਨੇ ॥ ਆਵਧੇ ਸ਼੍ਰੀਸ਼ੈਲ੍ਯੇ ਦਰਨੇ ॥ ਕੋਇ ਪ੍ਰਥੇ ਲੇਈ ਤੇਨੇ ॥ ਨ ਮਾਨੇ ਸਤਿ ਕਛੇਤਾਂ ॥ ੫ ॥  
 ਲਿਂਗੇ ਬਿ ਕੋਈ ਤਾਂ ਗੁਰੂਨੇ ॥ ਸਥਾਨਮਾਹਾਤਮ੍ਯ ਗੁਰੂ ਏਨੇ ॥ ਕਛੇ ਪਾਪਾਪੁਰੇ ਸ਼ਾਂਭੁਨੇ ॥ ਫੇਣੀਨੇ ਥਾਨ ਥਧੇ ਰਾਨਾ ॥ ੬ ॥  
 ਖੀਵ ਰਧ ਏ ਭਕੇ ਛਾ ਸ਼ੈਵ ॥ ਪ੍ਰਥਿਤਾਂ ਖੀਨੇ ਪ੍ਰਾਇਸ਼ਵਭਾਵ ॥ ਕਛੇ, ਰਾਣੀ ਪ੍ਰਥੇ ਸਵਲਵ ॥ ਕਛੇ ਏ ਪ੍ਰਥੇਂ ਕਾਗਡੀ ਤੁੰ ॥ ੭ ॥  
 ਆਲੰ ਬਿ ਤ ਮਾਂਸ ਤਵਨਸੁਖੇ ॥ ਸ਼੍ਰੀਸ਼ੈਲਾਂਗੇ ਫੇਣੀ ਜੁਖੇ ॥ ਸਮੀਨੇ ਤਨੇ ਮਾਰੇ ਹੁ:ਖੇ ॥ ਰਾਣੀ ਤੇਥੀ ਤੁੰ ਥਧੁ ॥ ੮ ॥  
 ਹੁੰ ਹੁੰ ਮ ਵਿਧਿਤਖ੍ਦ ਜਨਮੇ ॥ ਥਈ ਰਾਨਾ ਅਂਤੇ ਸਵਧਾਮੇ ॥ ਜਈਥੁੰ, ਕਛੇ ਤਾਂਤੁਕ ਮੇਂ ॥ ਥੇਤ੍ਰਧਾਮੇ ਆਵਧੇ ਤਨੇ ॥ ੯ ॥

118411

## ૧. પિતારાઈઓને ૨. પહોર.

ज्यां व त्य त्रै लागे आग ॥ त्यां शीघ्र थाय ध्वांतकंग ॥ तेभ थतां सद्गुरुसंग ॥ आवृत्तिकंग थाय तेनो ॥ १० ॥  
 स.गु. ए अ ठय अने गुरु संगमे ॥ लावी शीघ्र मोक्षे आभै ॥ अने भ्रांत कही स्वै हमे ॥ मठधामे आण्ये गुरु ॥ ११ ॥  
 च.स. ४ प्रत्यय यात्रिक आवतां ॥ आवे सहुने जय भ्रांतता ॥ भाने गुरुने प्रत्यक्ष देवता ॥ लक्ताशै तंतुकने ॥ १२ ॥  
 ॥४८॥

४५  
४४-  
४५

ईति श्री० ५० ५० वासुदेवानदसरस्वतीविरचित्सप्तशतीगुरुयरित्रस्य श्री० ५० ५० पांडुरगङ्कृतसमनुवादे  
 श्रीशैवयात्रावर्णनं नाम यतुश्वलारिशोऽध्यायः ॥ ४४ ॥ इति ओंवी ॥ ५०६ ॥

## अध्याय ४५

सुषु ई क्षर प्रकाव ॥ न दिनामे एक भूदेव ॥ कुण्ठे व्याप्त होडे सज्व ॥ देवी पासे तुण्डिपुरे ॥ १ ॥  
 न ई श्व रे क्षुं गुरु कने ॥ कहे ए कां लेजे नर कने ॥ पछी कही पूज्हकाने ॥ काढे एने देवी त्यांशी ॥ २ ॥  
 धी पु रः सरै न गमे एने ॥ तो ए मज्ज्यो गुरुनाथने ॥ शुकु कहे कैम एने ॥ नर कने आव्यो रे ॥ ३ ॥  
 स्वकी य भनोगत जाणीने ॥ प्रावें देव भानी गुरुने ॥ शुकु कहे पापे करीने ॥ कौद तने नीकज्ज्यो आ ॥ ४ ॥  
 अक स्मात् पाप हूर थरो ॥ संगमे स्नान कर ॥ एम कही साथे भूसुर ॥ सोभनाथ नर मोक्षे ॥ ५ ॥  
 एज क्ष णु स्नान ए करे ॥ अथर्वने प्रदक्षिणा करे ॥ आवी भढे ए अवसरे ॥ जे शरीरे कहे गुरु ॥ ६ ॥  
 शरी र एनु हिंय थयुं ॥ किञ्चित् जंधा उपर रह्युं ॥ पूछे कुण्ठ आ शाशी रह्युं ॥ कहे गुरु शंकाशी ॥ ७ ॥  
 तें जे म तुष्यधी करी ॥ एज आडे आवी तारी ॥ कर स्तोत्रे स्तुति भारी ॥ कहे ए अक्षरे न जाण्युं ॥ ८ ॥  
 भजू ती नाणी लुभ पर ॥ कहे गुरु स्तोत्र कर ॥ पछी ए थाय युद्ध धीर ॥ कर स्तोत्र श्रीगुरुनुं ॥ ९ ॥  
 ए तं तो देव ग्यधीश ॥ शुद्ध युद्ध सर्वधीश ॥ न जाणी तने कर्मपाश ॥ अजाने त्रास सहे लुप ॥ १० ॥

॥४९॥

१. दीवेटनी टोये २. अंधकारने नाश ३. सगां ४. विश्वास ५. अंतःकरणथी

એ અ હ ઈકારે જીવ ન્યિધિ ॥ પાપયોનિ કમે વિન્યિધ ॥ સમ પાપપુણ્યે ન્યિધિ ॥ રક્ત રેતે થાય નર ॥૧૧॥  
 ચ.ગુ. ૪૫. ગલે મ હા કષ લોગે ॥ મુજા થવા પ્રાર્થે વિરાગે ॥ થતાં ઉત્પત્ત વાયુવેગે ॥ વળી લોગે મરે પાછે ॥૧૨॥  
 ચ.સ. ૪૬. ॥૪૭॥ ત્વદી થ છુ વિના કેમ ॥ ટણે એનું મોતા જનમ ॥ તું જ કૃપા કર એમ ॥ સ્થિર મને પ્રાર્થે એ ॥૧૩॥  
 રહું રા ઈ સમ જે કુઠ ॥ ગયું તેજે થયો પ્રે૦૬ ॥ કવિતા હરી કવિશ્રેષ્ઠ ॥ એકનિષ્ઠ ગુરુપદે ॥૧૪॥

૪૫.  
૪૬.  
૪૭.

ઈતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્તશતીગુસ્યરિત્રસ્ય શ્રી૦ ષ્ર૦ ૫૦ પાંડુરંગાંતરસમનુવાદે  
 આલણાંદુષ્ટનિવારણં નામ પંચયત્વારિશોડધ્યાય: ॥ ૪૫ ॥ કુલ એંચી ॥ ૬૨૩ ॥

## અધ્યાય ૪૫

૨વિશ દ તત્કવિતારીતિ ॥ નૃકેસરી એ નરસ્તુતિ ॥ માની નિદતાં ગુરુમૂર્તિ ॥ તચ્ચિતો થઈ ગગટ ॥ ૧ ॥  
 લિંગ પિ છે બેસી જાણ ॥ એનું પંચકવિત્વપુજન ॥ ગુરુ પોતે કરે બ્રહ્મણ ॥ જેઈ ગુરુને પ્રાર્થે એ ॥ ૨ ॥  
 તું છ ચો ક છોડી દેવને ॥ મૂખ્યપણે કાં સ્તવે નરને ॥ એનું ગુરુ પૂછે એને ॥ થયો પ્રાર્થીને શિષ્ય એ ॥ ૩ ॥  
 આ ઉ ત મ કે કવિરતન ॥ ગુરુગાન કરે અનુદિન ॥ શ્રીગુરુ થઈને પ્રસક્ત ॥ કરે એમનો ઉદ્ઘાર ॥ ૪ ॥  
 એ ત મઃ શાંતિ કરે ભાસ્કર ॥ આ ભક્તાશાન મિટાવે ધીર ॥ અત્ર શાંત અન્ય ભાસ્કર ॥ કીર્તિ પ્રખર શ્રીગુરુની ॥ ૫ ॥

ઈતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્તશતીગુસ્યરિત્રસ્ય શ્રી૦ ષ્ર૦ ૫૦ પાંડુરંગાંતરસમનુવાદે  
 કવીશ્વરોપહેશો નામ પદ્મયત્વારિશોડધ્યાય: ॥ ૪૬ ॥ કુલ એંચી ॥ ૬૨૮ ॥

## અધ્યાય ૪૭

ભક્ત અ તિ પ્રિય સાતે ॥ વેર હીપોત્સવ નિમિત્તો ॥ તેડવા આણ્યા ગુરુને જાતે ॥ પ્રાર્થે સાત એ ચામવાસી ॥ ૧ ॥

॥૪૭॥

૧. અત્યાંત પ્રિય. ૨. ૨૫૭.

શુરુ તો ખવવા એમને ॥ સાથે સાત ઇપ ધરીને ॥ ગયા સાતને આંગણે ॥ રહીને મઠે કાયમ ॥ ૨ ॥  
 અ. ૪૭-  
 ચ. ૪૮  
 સ. ૪૮  
 ચ. ૪૮  
 ૧૪૮ ॥ ૫ ॥

એવિસ્તિ ત થઈ વાદ કરે ॥ પરસ્પર કહે અરે ॥ શુરુ તો હતા મારે ધરે ॥ હિવાળી કરી ત્યાં પોતે ॥ ૩ ॥  
 આમ લો ક કહે મિથ્યા સર્વ ॥ અહીં જ કયું શુરુએ પર્વ ॥ આપી વસ્તુ બતાવે સર્વ ॥ સાચા સર્વ કહે શુરુ ॥ ૪ ॥  
 તું જ કે વળ પરથ્રણ ॥ એવું સ્તવે એ સપ્તેમ ॥ લક્ષોને એ શુરૂતમ ॥ આપે ધામ અલથ્ય ॥ ૫ ॥

ધતિ શ્રી૦ ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પતશતીશુરુચિત્રિનસ્ય શ્રી૦ ૫૦ ૫૦ પાંડુરંગકૃતસમનુવાદે  
 શિષ્યવર્ગર્વાનયોગો નામ સોતયત્વારિશોઽધ્યાય: ॥ ૪૭ ॥ કુલ ઓંબી ॥ ૬૩ ॥

### અધ્યાય ૪૮

જે છે કે દોને અગોચર ॥ તે લક્ષોને સુગોચર ॥ આમે શૂરુ એ લક્ષીચર ॥ નમસ્કાર કરે નિત્ય ॥ ૧ ॥  
 જતા દે વ સંગમે યતિ ॥ જેઠ શૂરુ કરે પ્રાણુતિ ॥ ઇરી આવતાં એજ રીતિ ॥ કરે એતી લક્ષી કરી ॥ ૨ ॥  
 હેઠે ચ મતકાર ક્રોક ॥ કહે શૂરુને શુરુ હેખ ॥ અપોાર પહેલાં કાચેા પાક ॥ કાપી નાંખ આ તૂણું ॥ ૩ ॥  
 એ એ પ્ર માણુ માનીને ॥ સ્વામિલાગ નક્કી કરીને ॥ કાપતાં તત્ક્ષી ત્યાં આવીને ॥ કરે વિક્ષ્ટ તોએ ન હું ॥ ૪ ॥  
 એ કંધિ ત અધિકારીને ॥ કંદું, શૂરુ ન ગણે એને ॥ દેખાડી મધ્યાહુને શુરુને ॥ કહે ક્ષેત્રને કયું સાંક ॥ ૫ ॥  
 તું અ ત: પર શું ખાશે ॥ એવું શુરુએ પૂછતાં હુસે ॥ કહે ત્વત્પ્રસાહે થશે ॥ સે અંશે લાલ અમને ॥ ૬ ॥  
 ધચ્છા પુરી કરવા એની ॥ પાડી 'મૂલક્ષે' વૃણિ ઘણી ॥ થઈ શતગુણુ કમાણી ॥ શૂરુને શુરુકૃપાથી ॥ ૭ ॥  
 એ ચારુ ક્ષેત્રપૂજન ॥ કરે સખીક શુરુપૂજન ॥ સ્વામિલાગ કરી અર્પણુ ॥ હર્ષે દ્વિજગણ સંતોષે ॥ ૮ ॥  
 સંતો બો તુલ્લ શુરુમૂર્તિ ॥ આપે તરદંશને ગતિ ॥ લીલા કીધી અમિત અતિ ॥ અદ્ધારિએ ન જણે જે ॥ ૯ ॥

૧. મૂલકાને ૨. સુંદર. ૩. ક્ષેત્રપૂજન.

૧૪૮ ॥

ચ. ગુ.  
ચ. સ.  
॥૪૫॥

ઈતિ શ્રી ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પેતશલીયુગુયરિત્રસ્ય શ્રી ૦ અ૦ પાંડુરંગકૃતસમતુવાદે  
શ્રોતૃદ્વાન્યપ્રસવો નામ આણ્યવારિશોઽધ્યાય: ॥ ૪૮ ॥ કુલ ઓંતી ॥ ૬૫૪ ॥

૩૫  
૪૮-

## અધ્યાય ૪૮

આ છે તે મ અતિક્ષેત્ર ॥ સીમાઅમરણયોગ ચિત્ર ॥ રણે જલધર મારે સુર ॥ અમૃતે હર ઉઠાડે એ ॥ ૧ ॥  
હૃત મ: પ્રકાશક ॥ શિવ આપે અમૃત દેખ ॥ દળયું થોડું એજ વિશોક ॥ તે આ નહી અમરણ ॥ ૨ ॥  
એ ન યો પતાપ નિબારે ॥ લીમા સાથે સંગમ કરે ॥ પ્રયાગ સમ પાપ વારે ॥ ભૂમિ પર તારક એ ॥ ૩ ॥  
સર્વ મા ન્ય મનોધૃતીર્થ ॥ નયાં કદ્વપદ્મ અખેત્ય ॥ આગળ સંતોષાખ્યતીર્થ ॥ વિશ્વનાથ ત્યાં આવ્યા ॥ ૪ ॥  
આ છે શ પ્રસારે કરી ॥ એક લુબન-મુક્તે કરી ॥ કારી એ, નિજસ્નાને કરી ॥ કૈવલ્ય વરી નિઃસંશય ॥ ૫ ॥  
યતિ વ ર પાપવિનાશ ॥ તીર્થ બતાવે ત્યાં આસ ॥ ત્યાં મળે તત્સમથે સ્વસ્ત ॥ પૂર્વાશ્રમની રતના એ ॥ ૬ ॥  
એ એ મ હાતીર્થે કરી સ્નાન ॥ થઈ શુદ્ધ કુઠમુક્ત જાણુ ॥ ગુર્વાસાથી રહી તત્સ્થાન ॥ થઈ મુક્ત એજ જને ॥ ૭ ॥  
વારે સં કર કાટિરીર્થ ॥ આગળ હેખાડે રદ્રતીર્થ ॥ ઇણ ગયાસમ તદ્ગત ॥ ચદ્રતીર્થ એ પછી ॥ ૮ ॥  
આ સ સૂ ણ વારે હુરિત ॥ અસ્થિ કરે ચકાંકિત ॥ દ્વારિકાથીએ આ પ્રશસ્ત ॥ સ્નાને પતિત થાય જાની ॥ ૯ ॥  
કઢે ઢો લ વગાડી યતિ ॥ માયામગન સ્નાને મુક્તિ ॥ પામે અહિયાં વિશ્રાંતિ ॥ હુઃઅસંતતિ નાસે સહુ ॥ ૧૦ ॥  
રે પૂ જા અર્થ કરે ચિત્ર ॥ ક્ષેત્ર મહાપવિત્ર ॥ પ્રાગભાવે ગોકર્ણ ક્ષેત્ર ॥ આખું ક્ષેત્રમાહાત્મ્ય આ ॥ ૧૧ ॥  
અજા ના ડુકિત કલિ જાણુ ॥ થાય સર્વ તીર્થ પ્રચલન ॥ ગુરુ પ્રગટ કરે પૂણું ॥ થાય આનંદ લોકને ॥ ૧૨ ॥

ઈતિ શ્રી ૫૦ ૫૦ વાસુદેવાનં દસરસ્વતીવિરચિતસ્પેતશલીયુગુયરિત્રસ્ય શ્રી ૦ અ૦ પાંડુરંગકૃતસમતુવાદે  
અણ્ટતીર્થનિરપણ નામ એકોનપંચાશતમોઽધ્યાય: ॥ ૪૮ ॥ કુલ ઓંતી ॥ ૬૫૪ ॥

૧. અહેન.

॥૪૫॥

## अध्याय ५०

अ४.  
५०

स.गु. हे य ति श्रीपाद वर ॥ ए रजक पामे जन्मांतर ॥ थाय म्बेच्छ राज शूर ॥ धम् पर भन अनु ॥ १ ॥  
 च.स. अना पु रेहित कहे ॥ हिंदु पाखाणु पूजे भोहे ॥ भूगो-जलने हेव कहे ॥ हुर्मति ए न वंडवा ॥ २ ॥  
 ॥५०॥ राज रु वा॑ आवे वयन ॥ सत्यं भत अभनो जाणु ॥ जे देख करशे अभनो जन ॥ तेभने प्राणांत दंडीश ॥ ३ ॥  
 आ के जो किं छेडो तत्कष्णु ॥ अेखुं अभने कथे जान ॥ जंघा पर हैहो दारुणु ॥ थधने गीउ हैवे अहु ॥ ४ ॥  
 लेपे। त भ त्यां करे अति ॥ तो ए न थाय अनी शाति ॥ राज पूछे सद्विग्रे प्रति ॥ अेकांते ए कहीणु कहे ॥ ५ ॥  
 राज म व्याहिन त्यलुने ॥ एकदोन योते जधने ॥ पापनाशीथे आवीने ॥ पूछे वंडीने विप्रने ए ॥ ६ ॥  
 आवा स न आपी द्विज ॥ कहे सत्युरुचने जन ॥ थशे जवरोग निर्झिज ॥ भय सद्वाट ज कथांथी रहे ॥ ७ ॥  
 एक स वं कर्मणीन ॥ उज्जविनीमां हुतो जाणु ॥ द्विज वेश्याथी रमभाणु ॥ आवे गृहे ऋषब योगी ॥ ८ ॥  
 तत्पू व पुष्य थयुं उद्दित ॥ तेथी भज्या मुनि अंत ॥ पूज्या अंनेए महांत ॥ अहोरात्र सेवा करी ॥ ९ ॥  
 ए से वि त पुष्यथी अंने ॥ राजकुणे जन्मे इरीने ॥ लोग लोगवतां हैवे करीने ॥ आ०युं विष्णु स्वर्घमे ॥ १० ॥  
 जे स द्व छाहोय सकाम ॥ ए पामे श्रीमत्कुडे जन्म ॥ मुक्ति पामे जे निधाम ॥ सत्समाजम व्यर्थ न ॥ ११ ॥  
 द्विज ज न-मे दशार्थहेशे ॥ वज्रभाङु राजवंशे ॥ ज्येष्ठ राज्ञीनी कूपे वसे ॥ न गमयुं ए शोकने ॥ १२ ॥  
 यत्ने ति गम् सर्पगरल ३ ॥ आप्युं गर्जिणीने अमल ॥ ०याप्युं तो ए प्राणु अचल ॥ रहा, अकण हैवलीला ॥ १३ ॥  
 अनुं मां स लोही अगडे ॥ कष अभित अने पडे ॥ पुत्र प्रसवे अति रडे ॥ ग्रणु गीड अंनेने ॥ १४ ॥  
 थया स वीर्याय अपाय ॥ न थाय अने आरोग्य ॥ एक दिन अभने राय ॥ विजनारण्ये नांभी हे ॥ १५ ॥  
 ए पू व कर्म रमरीने ॥ भाणक उडे लधने ॥ करे आकंदन वने ॥ त्यां गोधन हेपे ए ॥ १६ ॥  
 राज भा भिनी४ गोवणने ॥ आवे पुरे वाट पूछीने ॥ वषिरूपति त्यां राए एने ॥ ग्रणुकटे भर्यो पुत्र ॥ १७ ॥  
 त्यां हे वे ऋषबयोगी ॥ सुखी दुदन आवे त्यागी ॥ कहे छानी रहे सुलागी ॥ शोक त्याग विवेक ॥ १८ ॥

१. छोधथी. २. तीक्ष्ण ३. ओर ४. ल्ली

॥५०॥

१५६॥  
 कथ न करे तत्वजन ॥ स्मरे पूर्ववृत्त तत्क्षण ॥ ज्ञवाडे ए सुत निपुण ॥ आपे अंनेने आरोग्य ॥१६॥  
 स.गु आवे भा ये मणे पुरुष ॥ जय तूर्ण दारुण दोष ॥ राजा पूछे सत्पुरुष ॥ दोषहर कथां मणे ॥२०॥  
 च.स. भूसु र कहे रे नृपति ॥ लीभातीरे वसे यति ॥ नामे नरसिंहसरस्वती ॥ सत्प्रवरगति मण एने ॥२१॥  
 ॥४८॥  
 राजा त थास्तु कहीने ॥ ए विग्रने सत्कारीने ॥ यतुरंग सौन्य लहने ॥ भाव राखीने आव्यो त्यां ॥२२॥  
 सिपा ह ए द्वर करीने ॥ आव्यो पगे त्यां चालीने ॥ संगमे हेखी देवने ॥ करे नमन एक भावे ॥२३॥  
 श्रीप ति कहे रे रज्ज ॥ कथां वसे, कां नावे रे ठक ॥ मणवा माटे भाविक ॥ ए सुखी थये ज्ञानी ॥२४॥  
 निज गु ह्य प्राप्तन्मनु ॥ स्मरे इप ए श्रीपादनु ॥ ओणभी मृहु वाचा धाणु ॥ करे स्तवन एमनु ए ॥२५॥  
 कां भा ह्य विषयाभिधमां हृत ॥ ठेके मुने तुं कृपावंत ॥ पकडी हवे भारा हाथ ॥ कठ त्वरित अहार ॥२६॥  
 हे ता त तुं भारा हाथ ॥ साह, आवुं पासे त्वरित ॥ जंघमणु करी निभित ॥ आपी लेट कृपाणु तें ॥२७॥  
 भारा मं गत रहे भाव ॥ युकु हे झैद्वा भताव ॥ जंघा घोले ज्यां ए सज्जव ॥ स्फोटकाभाव थये त्यां ॥२८॥  
 कहे शा भाश छे लेट ॥ भारा नष्ट कर्या तें स्फोट ॥ कहे न जाणु हुं आ फूट ॥ हेतु तव लेट भात्र ॥२९॥  
 हुं श ऋ भाव जे आचार ॥ न कुरुं गोहत्याहिकप्रकार ॥ कहे जुम्हा मारुं पुर ॥ नमस्कार करे झरी ॥३०॥  
 ए अ मि त सेना देखाईने ॥ युकु पालभीमां ऐसाईने ॥ जय साथे पगे चालीने ॥ ऐसाडे याने ॥ युकु एने ॥३१॥  
 क२ द शंन कही एने ॥ पापनाशतीथैं आवीने ॥ रहे युकु प्राथीं तेमने ॥ नागनाथ घेर तेडे ॥३२॥  
 युकु मु ज्य शिष्य सङ्कित ॥ जभी तीथैं आवे त्वरित ॥ त्यां तो राजा सवाधगीत ॥ नगरमां लह जय ॥३३॥  
 विवि क दृष्टि भगवान ॥ जय पुरे भक्ताधीन ॥ निजेश्वरैं राजरत्न ॥ भताडे सर्वने सप्रेम ॥३४॥  
 ए ग म्म त वर्षी न जय ॥ भहेत्सव करे राय ॥ द्वो पाहदास्य यतिराय ॥ प्राथैं भावे भूप एवुं ॥३५॥

तन या पूर्ण राज्य नाथ् ॥ करी श्रीशैले आगमन ॥ कर मादुं नित्यदर्शन ॥ राजा ज्ञान रहो कहे ॥ ३६ ॥  
 स.गु. ४५.  
 वहे न म थयो भूपति ॥ आश्वासीने यतिपति ॥ गाण्युगापुरे पुनःस्थिति ॥ करे अक्ताधीन हेव ॥ ३७ ॥  
 च.स. ४०.  
 ए अ घ छनि हरान ॥ थतां जनो छर्षपूर्ण ॥ करे सर्व नीराजन ॥ गुरुस्तवनपूर्वक ॥ ३८ ॥  
 ॥४८॥ ४१.

धति श्री० ५० ५० वासुदेवानंदसरस्वतीविरचितसप्तशतीयुग्मयरित्रस्य श्री० ५० ५० पांडुरंगकृतसमनुवादे  
 यवनेक्षणं नाम पांचाशतमोऽध्यायः ॥ ५० । कुल ओंवी ॥ ५८२ ॥

### अध्याय ५१

न आ ए स्थाने रहेवुं ॥ हवे कलिमां गुस थवुं ॥ श्रीगुरुओ कहेतां ओवुं ॥ हुःभित सर्व थया ए ॥ १ ॥  
 आपी त हाथासन नाथ् ॥ कहे अजवा लाभ्या हीन ॥ आगण आवशो हुहिन ॥ नाथ्याने ओ गुस रहेशुं ॥ २ ॥  
 जे स दबु छि अक्तजन ॥ तेमने अहा देशुं दर्शन ॥ गाण्युगापुरे रहीशुं नाथ् ॥ वी वयन त्रिवार ॥ ३ ॥  
 अवा ध्वा थायो सुगम तम ॥ अजतां पाहुडा जे काम ॥ ते पूर्ण थध अंतेधाम ॥ भगवी नाम मादुं गातां ॥ ४ ॥  
 अवां बु धितरथ्याथ ॥ अजे सिद्ध थशो स्वार्थ ॥ गातां अरित्र मनोरथ ॥ थशो पूर्ण व्यर्थं चिता ॥ ५ ॥  
 अव द्वि त पाहुडार्थने ॥ विक्षहर चितामधिने ॥ अर्यो प्रातः छृष्टास्तनाने ॥ जहने नित्य आवीश ॥ ६ ॥  
 अक्ति मान जेवा तेवा ॥ ते पासे हुं तेवा तेवा ॥ गुरुनो आ डैत ओवा ॥ कहे सिद्ध शिष्यने ॥ ७ ॥  
 रह स्या थं गुरुयरित्रनो ॥ संवाहे जे गुरुशिष्यनो ॥ सिद्धनामधारकनो ॥ सार तेनो आ चिद्रस ॥ ८ ॥  
 आ स त्क पा करीने दत ॥ वहावे प्रेरीने जे चित ॥ ततपहाणजे आ समस्त ॥ समर्पित थंथ हो ॥ ९ ॥

धति श्री० ५० ५० वासुदेवानंदसरस्वतीविरचितसप्तशतीयुग्मयरित्रस्य श्री० ५० ५० पांडुरंगकृतसमनुवादे  
 एकपांचाशतमोऽध्यायः ॥ ५१ ॥ कुल ओंवी ॥ ७०० ॥

१. पापहारक. २. संसारतो भाग.

॥५१॥

## આરતી

સ ચુ.

ચ.સ.

॥૫૩॥

જ્ય ત તૃપ્તાનનિદાન ॥ અનસૂયાત્રિનંદન ॥ તૃત્પદાખલ પરથી જાણ ॥ પંચ પ્રાણ વારી નાંધુ ॥ ૧ ॥  
 કર કૃ પા હે માણાપ ॥ વાર સર્વ પાપ તાપ ॥ નિજ માર્ગ સાતુક પ્રો ॥ સુગમ પૂર્ણ કર તે તું ॥ ૨ ॥  
 જે આ ત્ય દૃષ્ટુત તવ રૂપ ॥ તે આ ચિત્રો સ્વયં સરૂપ ॥ પ્રગટાવી જે કામકોપ ॥ શાંત પૂર્ણ કર તે તું ॥ ૩ ॥  
 તપ શ્રી ર્યા આ અમારી ॥ રહે તૃત્પમૃતિ મંગલકારી ॥ હૃવીસના મનમાં નઠારી ॥ ન જાઠે દાન આજ આપ ॥ ૪ ॥  
 શુષ્ણ ભા વે ગાઈ તારા ॥ અનાસક્તિથી વતું, તવરા ॥ કરું સત્ત્વં તાણી તેરા ॥ આપો વરદાન આ મુને ॥ ૫ ॥  
 અનુ ર કિંત તૃત્પહે રતિ ॥ વિષયે થાય સુવિરક્તિ ॥ કષ્ટ પડતાં ન હોણે ધૃતિ ॥ હાથે સેવા થાય તારી ॥ ૬ ॥  
 તારું ત તસ્ફુ અદ્વાપણુ ॥ રહે સંપૂર્ણાચરણુ ॥ દદ ધરું તવ ચરણુ ॥ તવન્યશરણુ ન મને ॥ ૭ ॥  
 || ધતિ શ્રીસત્તશતીયુદ્ઘરિત્રસ્ય સમતુવાદ: સમાપ્ત; ||

અવધૂત-વિશ્રામ,  
વૈઠ ૬-૩૦

---

૧ દ્વારા ૨. ઓમ.

॥ કાઢા

સ.ગ.  
ચ.સ  
॥૫૪॥

॥ શ્રીનૃસિહસરસ્વતીપાહુકાસ્તોત્રમ् ॥  
 શ્રીપાહ શ્રીનૃસિહાખ્યમ્ ઔહુભરનિકેતનમ્ ।  
 નમણિ સહગુરું વન્દે નરભાવવિમુક્તાયે ॥ ૧ ॥  
 સિન્ધુકાન્તં હ્યાસિન્ધું પાહુકારૂપિષું યતિમ ।  
 હરન્તં ભક્તાનાડયં કં કૃષ્ણાયેષીયુતિસ્થિતમ્ ॥ ૨ ॥  
 સચ્ચિદત્સુઓકદાતારં સવિન્માગૈકવિચછભમ્ ।  
 રહસ્યાખ્યાયિનં દેવં નાનાત્મૈકચપ્રાણાધિનમ્ ॥ ૩ ॥  
 સ્વતન્ત્રં સ્વૈકવરદ્દં સ્વપ્રકાશં સ્વસ્વસ્તરમ્ ।  
 તીર્થંતીર્થં તિર્થમરશિમ તિર્થયતારં ત્રયીમુખમ્ ॥ ૪ ॥  
 શ્રીખંડભૂતિલિંગાર્દું શ્રીકષ્ટઠકૃતસૌહૃદમ્ ।  
 પાથોદરયામલં શાન્તં શાવંરીશ-સહોદરમ્ ॥ ૫ ॥  
 હું વહુમહાવાગ્મિં હુલંલેક્ષં હુરાસદમ્ ।  
 કામડ્રયં કાકનિદ્રં કામગારં કવિપ્રિયમ્ ॥ ૬ ॥  
 નતિતુઠ્ઠં નયાકૃષ્ટં યોગિનીરાજિતં વિલુભમ્ ।  
 માયામાણુવક્તં મતં મદડલેશ્વરમહિંડિતમ્ ॥ ૭ ॥  
 મીનદર્શિં મનોવેગં મનઃસન્તાપહારિશ્ચમ્ ।  
 તિમિતાક્ષં તપોમલોધિં રર્જુલોષણુશાન્તાયે ॥ ૮ ॥  
 શ્રીનૃસિહસરસ્વતીપાહુકાસ્તોત્રમુત્તરમ્ ।  
 પઠન् વિનૈર્ન બાધ્યેત સહભાગ્યા સંયતેનિદ્રયઃ ॥ ૯ ॥

૨૮। અવધૂત

॥૫૪॥

૫૫

## પૂજય શ્રી. રંગ અવધૂત મહારાજની અન્ય દૃતિઓ

### ગુજરાતી

૧ શ્રીયુલીલામૃત (રાન, કર્મ, ઉપાસના) છુટી આ. ૩૦-૦૦	
૨ શ્રી ગુરુદીકામૃત (સાનકાંડ) : છુટી આવૃત્તિ	૧૦-૦૦
૩ શ્રી ગુરુદીકામૃત (કર્મકાંડ)	૧૦-૦૦
૪ શ્રી ગુરુદીકામૃત (ઉપાસનાકાંડ)	૭-૦૦
૫ અવધૂતી આનદઃ (નીળ આવૃત્તિ)	૩-૦૦
૬ ઉપનિષદોની વાતો : ચોથી આવૃત્તિ	૦-૭૫
૭ પત્રગીતા : (ખીળ આવૃત્તિ) હાલ નથી	૦-૨૫
૮ સંગીત ગીતા છુટી આવૃત્તિ	૦-૭૫
૯ ઉપઃપ્રાર્થના (પ્રેભાતિયાં) નવમી આવૃત્તિ	૦-૨૫
૧૦ ઐઠો અવધૂત (છુટી આવૃત્તિ) હાલ નથી	૦-૧૩
૧૧ ઊભો અવધૂત (સાતમી આવૃત્તિ) હાલ નથી	૦-૧૩
૧૨ આમ અવધૂત (નીળ આવૃત્તિ) હાલ નથી	૦-૫૦
૧૩ દત્તથાવની (તેચીસમી આવૃત્તિ)	૦-૧૫
૧૪ શ્રીદત્ત પંચપદી (૧૫મી આવૃત્તિ)	૦-૪૫
૧૫ આત્મચિત્તન ખીળ આવૃત્તિ હાલ નથી	૦-૧૦
૧૬ દત્તઉપાસના (એક ઊડતું પ્રવચન) પાંચમી આવૃત્તિ	૦-૪૫

૧૭ દત્તનામસંકીર્તનમ્ (ગુજરાતી લિપિમાં)	૦-૫૦
૧૮ અભુષ અવધૂત હાલ નથી	૦-૧૬
૧૯ નિત્ય સ્તવન ૨૦ અષ્ટ ગરખી ૨૧ ડાકેર માહાત્મ્ય	
૨૨ ધર્મજનો ઘડકો ૨૩ કણુભાનો કઢકો ૨૪ દ્વારકાનાં ડિડિમ ૨૫ નવાગામની નોાયત ૨૬ હાલરડાં	
૨૭ ભવરોગનું અચુક ઓસાડ ૨૮ અમર સદેશ ૨૯ અમર આદેશ (ઉપરનાં બધાં એક સાથે) ૧૬થી૨૮	૧-૫૦
૩૦ અવધૂતી-મૌજ (હિંદીમાં પહેલી આવૃત્તિ)	૦-૫૦
૩૧ દત્ત ઉપાસના (હિંદી)	૦-૫૦
૩૨ વિજષ્પુરાણની વાતો (પ્રથમ આવૃત્તિ)	૧-૦૦
<b>સંસ્કૃત</b>	
૧ રજ્જ-હૃદયમ્ : ખીળ આ.	૨-૦૦
૨ શ્રીવાસુદેવનામસુદ્ધા (સાર્થ) છુટી આ.	૦-૫૦
૩ સદ્ગોધશતકમ્ (શ્રીવાલ્લોધિની ટીકા સમેતમ) :—	૧-૦૦
૪ દત્તનામસંકીર્તનમ્ :— છુટી આ. હાલ નથી	
૫ બોધમાલિકા (ગુજરાતી પદ ઇર્પાતર સાથે) હાલ નથી	
૬ દત્તનામસ્મરણમ્ ૭ શ્રીદત્તરક્ષાસ્તોત્રમ્ ૮ સ્તોત્રપદ્કમ્	

૫૫

५६	<p><b>६ प्रभोतरमालिका (प्रथम आ.) सविवेचन प्रस्तुति। (गाधीनानार कृष्ण औद्योगिक शैली द्वारा दीया गया था।)</b></p>	०-५०
	<b>भराठी</b>	
१ श्रीवासुदेवसमशाती :-	... ... ... ....	१-००
२ रङ्ग तरङ्ग हाल नथी		०-१३
३ दत्तउपासना :-		०-४०
<b>पूज्यश्री प्रेरित पुस्तकों</b>		
१-३ श्री हातलीलासार (नण अंडमां)		५-००
४ हातलयांती-दर्शन (नवापुर सं २००८)		१-००
५ सोताहमांथी सोतीथी		२-००
६ अभर आहेश (हाल नथी)		
७ अक्षरगीता (भीज आ.) सविवेचन		३-००
८-१० अवधूती भसती		११-००
११ हत अवधूतांक (भंगल भंदिरनो)		४-००
१२ गांडा महाराजानुं चरित्र		३-००
१३ श्री गुलीलाभूत चित्रावलीः चित्रकार प्रमोद पटेल		१०-००
१४ हतउपासना-उद्घाटन ने विकास (अंग्रेज)		१२-५०
१ रंगस्तवन } २ नारेश्वरनो संत } ३ श्री उपर लभायेव पुस्तकों हाल नथी		४-५०      ५६
४ अवधूतसभरण (नवभी आ.)	५ रंग-अरणां	
५ अलौकिक अवधूत :-	दरेकनी किमत	०-५०
७ रंग-चित्रामणी		०-१७५
८ अद्धानुं इणी		०-७५
९ रंगभावनी (हाल नथी)	मात्र टपाल अर्य	
१० भगवद-रङ्गावधूत-मानसपूजा	११ श्रीअवधूतप्रशस्ति	०-५०
१२ श्रीरङ्गप्रशस्ति : १३ श्रीरङ्गगुणगरिमा } १४ रंगमंगलमालिका } <td>मात्र टपाल अर्य</td> <td></td>	मात्र टपाल अर्य	
१५ नारेश्वरनो संत	१६ नारेश्वरचे संत	१-७५
१७-१८ प्रवासी अवधूत (पु.५ १-३)		५-००
१९ संगीत अवधूत-१-२		२-२५
२० असात (तडीभार) रंगजयांती		
२१ मा दुकभाष्या		३-००
२२ रंगस्वत्यानुसधान		२-००
२३ सोतसिन्धु		१५-००
२४ अद्धान्जलि (पू. श्री. नो)		
२५ पु.भाल (स्मरणिका)		४-५०

॥ नरसिंहसरस्वतीस्तोत्रम् ॥

विजयते जयते जय ते यतेरिहुतमे। हृतमेषाहुतमे। नमः ।  
 हुद्दिकदाय पदाय सदा यदा तद्गद्येनद्येन। न वयेनयः ॥ १ ॥  
 उद्यते नयतेर्नयतेर्यहा मनसि कामनिकामहुतिस्तदा।  
 पद्गद्येन हुद्देषाक्षिते सिते भवति चेषावति चेषाग्निवरावरान् ॥ २ ॥  
 भवति आवज्ञेवावज्ञवो। यदा भवति कामनिकामहुतिस्तदा।  
 भवति भानव भानवहुतमे भवतिरेषाधिरतो। विरतोत्तमे ॥ ३ ॥  
 तव सतां वसतां भनसा नसा प्रपद्येषाः पद्येषारजसांजसा।  
 सुसहितः सहितस्तव तावता यद्वतारवता जनताविता ॥ ४ ॥  
 कृतश्वरं तु विहाय विहायसा समभजं भवतामजं तामसात्।  
 भिलति तारकमन्त्र कमन्त्रसत् पद्गरणे भ्रमहारिभ्रमहारिसत् ॥ ५ ॥  
 तद्गरामरकाशविक्षण्युः सद्गैषिगुण्यवेत्तुक्षलक्षण्यम्।  
 भुवनहेत्वध्यहुतिपुराधिकं तव न जातु पदं कुपुराधिकम् ॥ ६ ॥  
 त्रिविध्येष्टपरं समदश्यते विविध्येष्टपरं कमदश्यते।  
 पदभियं भुविद्युधनभुद्धिया सदनिदं प्रज्ञात्यधनुद्धिया ॥ ७ ॥  
 अजं नमे। जनमेषाहुनमेषाहनः प्रिय नियेषाजय ते नयते नते।  
 य ईह वेद निवेद निवेदवे त्यज पदं जपदं तपदं पदम् ॥ ८ ॥  
 ॥ ईति श्री ५० ५० श्रीवासुदेवानं दसरस्वतीविरचितं नरसिंहसरस्वतीस्तोत्रं सम्पूर्णम् ॥

श्रीकैलासभागरसूरि ज्ञानमन्दिर  
श्रीमहादीर जैन आराधना केन्द्र  
कोटा (गांधीनगर) पि ३८२००९

डॉडे औहुम्बर लु ततपे गाण्डिगापुर स्वामी  
लगी लीड अक्तान डी जगापे डॉडे अकाम कामी।  
दत्त हिंगंबर से । क्वितारक डॉ ऐसो॥१॥  
जये पुत्र भर्मन डी खी के देख शुद्ध मन वाको।  
लीका अद्भुत डीनी जगमें समरथ डॉ कहने डॉ।  
नृसिंहसरस्वती लो । श्रीपादश्रीवद्दक्ष॥२॥  
वंच्या डॉ सुत निर्धन डॉ वित हेत देख प्रीत जेही।  
प्राणु प्रेत डॉ पांव पंगु डॉ ज्ञान मूँड डॉ सोही।  
हुलंक डॉ नाही । हुपा करत जय ऐही॥३॥  
हिचो राज धोभी डॉ हेहो एक अक्ति डॉ भूषेहो।  
छन में शैव झुँचायेहो तंतुक बलतपात क्षेहो।  
सुरनर जश गावे । ले भागे सो पावे॥४॥

श्री नृसिंहसरस्वत्यष्टक  
(राग : साधी-मराठी)

श्रीमहादीर जैन आराधना केन्द्र  
कोटा (गांधीनगर) पि ४८२००९

धर्यो लेख यतिवर हौ आपे अलभ जगायेहो जगमें।  
इप अनेक दिखायेहो एके निराकार निर्गुण में।  
माया यह तेरी । दार धीर भव मेरी॥५॥  
अंत्यज मुख से येह निकालेहो टार्यो द्विजमह गहरो।  
सेर धान में गांव जिमायेहो । धन धन गुदु धन चेरो।  
धन गाण्डिगापुर से । आधिव्याधिहर ऐसो॥६॥  
रत्नार्थ डॉ कुण्ठ भिटायेहो तीरथसेह दिखायेहो।  
कर्मोपासन ज्ञान सिखायेहो धर्मद्वज इहरायेहो।  
मूर्गो सेस भयो । युन भरनन से हार्यो॥७॥  
सरन चरन में रंग रांक यह भयो हेण भतवादो।  
द्विरे बावदो तव युन गावत सुमिरन एक तिहारो।  
जय गुरु अवधुता । क्षया मुजको अब चिन्ता॥८॥

रंग अवधुत

आ. श्रीकैलासरामरम्भुरि चालन्दिर  
। श्रीमहावीर जैन आश्रमका तेल  
कलेक्टर (गोदानपत्र) पि १५००९